

ગુરૂ પદ્માલિઙ્ગ

શ્રી સુધર્માસ્વામી ગ્યાનબંદર, ઉમરા,  
ગુજરાત, ભારત  
ફોન : 0 26-26 26 26 26  
ફોક્સ 30008785

273

વરણેતરાચ રીનળ.

૨૧.૭૫  
૨૯/૭

નાનુરીમંડન શ્રીઆદિનાથાય નમો નમઃ ॥

‘શ્રી આદિનાથાય હંસ જૈન રત્નમાલા-રત્ન આઠમું’

## જૈન સમાજ સાવધાન


જૈન જગ્યાતિ લેખમાળાના મલ્લકા વગેરે  
શાસ્ત્ર-પરંપરા અને જૈનત્વથી પણ રહિત છે.

સંવત્સરી

ભા. શુ. ૪+૫ ગુરુવારે છે જ નંદિઃ

શાસ્ત્રીય સંવત્સરી

ભા. શુ. ૪ ને યુધવાંશુ



દે. મુનિ હંસચાંગર  
[ વદ્વાખુસાઠી - સંવેગીનો ઉપાગ્રય. ]

પ્રદાશક:-

૨૧. મોતીયંદ દીપચંદ

જ. ભાવનગર પાયા તલામા

મુ. દળીયા [સૌરાષ્ટ્ર]

વીર સં. ૨૪૮૩ - વિ. સં. ૨૦૧૩

શા. વ. ૪ બુંધ - પંદરનું ખર

મૂલ્ય-અમૂલ્ય,

મુદ્રક -

શ્રી અર્ણેષુદ્ધય મિન્ટીંગ પ્રેસ  
પ્રો. ડાયાલાલ એન્ડ ઇટેચાંદની કું.

ટે. આરગેટ-ભાવનગર.

શ્રીવર્દ્ધમાનપુરીમંડળ શ્રીઆદિનાથાય નર્મા નંમઃ ॥

‘શ્રી અણંદ-ચંદ્ર હંસ જૈન રત્નમાલા - રૂત જ્યાઠસું’

# નવામતના પ્રચારનું સચોદ્દિનરસન

દે ખુનિ હંસસાગર વઢવાણુસીટી. તા. ૧ ૮-૫૭

આણે શ્રી દેવસ્થર તપગંછ સમસ્તસંધ, આ વાતમાં તો જરૂર-  
સંમત છે કે-“આપણા ધર્મપ્રિય સમાજમાં છેલ્લા વીશ વર્ષથી ધર્મ-  
વર્ગને પાડતા કલેશનું મૌલિક ભૂળ, સં. ૧૯૬૨ના શાવણુમાસે મુંબદ્ધ  
લાલાગમાંથી શાસ્ત્ર અને પરંપરાથી સંદર્ભ વિરુદ્ધ નીકળેલો નવો  
નિથિમત છે કે-જે મત, પોતાના ગુરુઆદિનીય સલાહ અને સંમતિ  
લીધા વિના બા. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ સ્વેચ્છાએ કાઢેલ છે. તે  
મતમાં આ. શ્રી વિજયલભિધસૂરિજી અને આ શ્રી વિજયપ્રેમસૂરિજી  
તો પાછળથી અને શીરજેરીના પરિણામે લજ્યા છે, અને પરવરશ  
ગણૂલા ભોળા વયોવૃક્ષ આ. શ્રી સિક્ષિસૂરિજી મ તો રહી-રહીને  
૧૯૬૬માં ભગી જ્વાની સ્થિતિમાં ભૂકાયેલા છે. એટલે કે-શિષ્યે મત  
કાઢ્યો અને ગુરુઆદિ વડિલોએ તેને માન્યો ! એનો અવળા ગુંગા  
સમો તે વિચિત્ર મત છે.

આ. શ્રી વિજયરામચંદ્રસૂરિના તે મતને શાસનપદ્ધે અનેક વખત  
નિર્મૂળ દરાવી આપેલ છે, એ જગપ્રસિદ્ધ હકીકત છે, છતાં પોતાના  
તે નિરાધાર દરેલા મતને ય સાચો લેખાવવા સારુ તેઓશ્રી ‘હાયો  
જુગારી બમણું રમે’ એ ઉક્તિઅનુસાર સમાજમાં વારંવાર જૂહાં  
સાહિત્યો, બહાર પાડતા જ રહ્યા છે, તે ઘેંજનક છે. તેઓ તરફથી  
તાજેતરમાં પણ પ્રથમ મુંબદ્ધ સમાચાર તા. ૧૩-૧-૫૭ માં કોઈ  
‘ડી. સી. કાપડીયા’ના નામે એક લેખ જાહેર થયેલ છે. તે લેખમાં  
ચંચલતસરી અંગે અનેક અસંબદ્ધ વાતો પ્રણાટ કરવામાં આવી છે. તે  
પણી વળો એ જ લેખનું શીર્ષક પલટીને, તે લખાયુને ત્રણગણું  
વધારીને અને તેના લેખકનું પણ ‘ડી. સી. શાહ, કીર્તિ સરકબ,

મારુંગા-મુંબદ' એ તરીકે નામ પલાતીને તેમના તા. ૧૧-૧-૫જના મહાવીરશાસનપત્રમાં તે લેખને પ્રસિદ્ધ કરેલ છે ! એ પછી તે લેખને અહિં(વઢવાણુસીટી)ના પ્રેસમાં ટ્રેક્ટ તરીકે છપાવીને પણ મોકાગા હાથે પ્રચારવામાં આવી છે ! કહે છે કે-આ કાર્ય 'મુંબદ-લાલભાગમાં ચાતુર્માસ રહેલા શ્રી મુક્તિવિજયજી કરી રહેલ છે ! તે ગમે તે હા, પરહુ તેઓ તરફથી એ બહુડી લેખમાં પોતાની લા. શુ. ૪૫૫ને ગુરુવારની સંવત્સરીની માન્યતાને ધૂપાવીને તિથિ વિનાના કેવળ ગુરુવારની ૪ સંવત્સરીને સાચી દેખાડવાનો દાંલિક પ્રયાસ કરવામાં આવેલ છે, તેમજ પૂ. આ. મ. શ્રી વિજયનેમિસ્ટુરિઝ મ. ની હતી તે આચરણું મુજબ સં. ૧૬ ૬ સુધી તો પોતે પણ 'ચંડાશુ.માંના લા. શુ. ૫ ના ક્ષય વખતે ખીન પંચાંગની લા. શુ. ૬ નો ૪ ક્ષય કર્યો છે' તે સત્ય ખીનાને ધરિદાપૂર્વક ઉડાવી દેવામાં આવેલ છે ! એ પાપ તેઓએને કેમ અટકતું નથી ? અને ઉપરથી ગુરુવારની માન્યતાની અસત્ય આળ તળે પૂ. વયોવૃદ્ધ રાનગંલીર આ. મ. ની વિજયોદયસ્ટુરિઝ ઉપર અસત્ય હકીકત સ્વીકારેલ હેવાના અસત્ય આક્ષેપોની જડી વર્ષવિવાનું ગાઢ પાપ શું કામ કર્યું છે ? કે જે ભવલીર આત્માને શોલનીય નથી. તેઓની આવી અસત્ય પ્રોપેગેન્ડાથી કઢવાણુકાભી સમાજે ખૂબ જ ચેતતા રહેવા જેવું છે.

આ વાત એટલેથી જ નથી અટકી, પરંતુ તે પછી પણ તેઓના મહાવીરશાસન પત્રના અર્ધસ્વામી ગણ્ણાતા આ. શ્રી અમૃતસરિઝ મ. ની લેખાતી શ્રી હર્ષપુષ્પામૃત નૈન અંધમાળા તરફથી તેના અંધાંક '૩૨' તરીકે 'તિથિયર્યાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ' નામની એક ૬ ડેર્મ પ્રમાણું બુક પણ અહિં(વઢવાણુસીટી)ના જ પ્રેસમાં છપાવીને તુરતોતુરત બહાર પાડવામાં આવેલ છે ! કે-જેમાંની સર્વ ખીનાઓ નિરાધાર અને અસત્યપ્રાયઃ છે. અને તે બુકનાં પેજ ૧૭ થી ૮૦ સુધીમાં પણ 'ડી. સી. શાહ.'ના નામે પ્રસિદ્ધ થએલ એજ ટ્રેક્ટને ફરીથી પણ છાપીને પ્રચારવામાં આવેલ છે ! આ અજ્ઞા

પદ્ધતિનો મિથ્યા પ્રચાર, સમાજથાં તેના પ્રસંગે પણ તેઓ રીતે આ રીતે ચોગરદમ આદરી દીધેલ છે, તે જેનાં ‘નવામતને હવે જે વેગ નહિ આપીએ તો સમાજમાં સ્થાનજ નહિ રહે’ એવો તેઓશીને સખત ભય લાગ્યો જણાય છે! શાસનહેવ સદભુષિ આપો. [સં. ૨૦૧૩ના અશાડ શુદ્ધ ૧ શુક્રવારના લેખ તરીકે શ્રી અમદાવાદના દાનમંદિરથી મુનિશ્રી પદ્મવિના સહીથા સંદેશ મું. સ અને અશાડ વદ્ધ ૪ ના તેમના મહાવી.શાસન વગેરે પેપરોમાં ‘આ. શ્રી વિજય-પ્રેમસ્સરિણ મ. ના પત્ર’ના નામે પ્રસિદ્ધ થએલ પાખંડપૂર્ણ લખાયે પણ એજ દિયામાં પ્રગતિ સાધેલ છે. તેમાંની માયાળળનો પણ આંશિક ઘટરફોટ તો અત થઈ જ જતો હોવાથી અને પોતે અનેક વખત સમાધાન માટે કહેવહાવી ચુક્યા છે, છતાં પોતે માનેલા સ.ચા અતને ખોટા અને પોતે સદંતર ખોટા તરીકે માનેલા નવામતને સાચો કહેવાની અનારાધકદશાને સમાજભરની શરમ તજુને તેવી ખુલ્લી રિતે બતાવી શકવાની હિંમત કરી શક્યા હોવાથી તે પત્રમાંના શેષ લખાયુને અત એજવાખદારજનની ચેઠા ગણ્ણીને ઉપેક્ષવામાં આવે છે ]

શ્રી શાસનસુધાકર પત્ર વર્ષ ૧૦ માના તા. ૨૪-૬-૪૬ ના અંક ૬ નાં પેજ ૫૭ થી ૫૮ ઉપર [સં. ૧૬૫૨ ના લા. શુ. પાંચમના ક્ષયે લા. શુ. ઉનો ક્ષય માનીને ડેટલા પૂજન્ય મુનિવરોએ, ડેટલા શહેરોએ અને ડેટલાં સ્થાને શ્રી સંદેશાએ લા. શુ. ચોથના દિવસે સંવત્સરી કરી હતી? એ હકીકત, નામ-ગામ-સ્થાન વગેરે સંપૂર્ણ વિમનથી આપણુને માહિતગાર કરતી] સં. ૧૬૫૨ની સંવત્સરી પ્રસંગનો ‘શ્રી સાંકળયંદ હરીશાંગ સિદ્ધારથ’ના નામની (આજથી ૧૧ વર્ષ પૂર્વની) આચીન પત્રિકા પ્રસિદ્ધ કરવારમાં આવેલ છે. તે પત્રિકા વાંચનારા સહુ કોણ રૂપણ જણ્ણી ચૂકેલ છે—“સં. ૧૬૫૨માં લા. શુ. પના ક્ષયે લા. શુ. ઉનો ક્ષય કરીને લા. શુ. ચોથના દિવસે સંવત્સરી કરનાર તરીકે એકલા પૂ. સાગરજ મ. જ નહેતા; પરંતુ એ સાથે તે મુજબની જ આચરણું કરનારા આ. શ્રી વિજય-

सिद्धिसूरिज म., आ. श्री विजयकनकसूरिज म.ना गुड़ श्री ज्ञतविजयल दादा, सन्निमत्र कपूरविजयल, पं. श्री आनन्दवि. म., ईद्वारमां श्री शांतिवि. म. अने भीज पण मुनिराजे, तथा तेऽग्नेशीनी निआना पेटलाद-राधनपुर-ઈ-द्वार वगेरे अनेक गामोना समस्त संघो, सुरत वडाचौटानो संघ, सुरत गोपीपुराना श्रावको, तथा भावनगरना श्रावक भगवनलाल ऐयर, अमदाव द विधाशालाना श्रावक डाल्याभाई-शेठ भनसुभखाई भगुलाई वगेरे अनेक स्थले चातुर्भास रहेला अनेक साधुभद्वाराजे तेमજ हजारो श्रावकवर्णी पण उता.” (आ १४ ते वर्खते आमांथी डेट्लो सुनिसमुदाय आकी रहेलो उतो? ते संभया जेऽग्ने जाणुता होय तेऽग्ने ते वर्खते तेटला मुनिसमुदाये ४ ‘ला. शु. ५ ना क्षये चंडांशु. ने छोडीने भीज पंचांगमानी ला. शु. ६ नो क्षय पकडीने प्रवर्त्तेल होई शके,’ ए पण जाणुवुं सुगम थयुं उतुं.)

पू आ. म श्री विजयदानसूरिज म., पोताना विविधप्रओतर भाग भीजना पेज २८० उपर ते सं. १६५२नी संवत्सरी भाष्यत जणावे के— “सं. १६५२नी सालमां पण आ प्रमाणे उतुं, अने श्री तपगच्छना मेएा भागे ला. शु. ६ नो क्षय भानी ला. शु. ४ नी संवत्सरी करी उती.” एम जणावे छे. तेथी स्पष्ट छे के श्री तपगच्छना ते क्लेवाता मेएा भाग पधीरी आकीने लेखावातो थांडो वर्ग, ते आ उपर जणावेल सांकળचंद हडीशंग सिद्धारथनी पनिडाना आधारे स्पष्ट जणावी आपेक्ष छे, ते छे. अर्थात् “ते वर्खते ला. शु. ५ ना क्षये चंडांशु. ने नडि ४ छोडीने ला. शु. ३ नो क्षय करीने चोथे संवत्सरी करनार पू आनन्दसागरसूरिज म. आहि अनेक मुनिसमुदाय तेमज अनेक शहरोना हजारो श्रावको उता, अने चंडांशु. छोडी देवापूर्वक भीजुं पंचांग पकडी तेमानी ला. शु. ६ नो क्षय मानीने चंडांशु. नी ४ ला. शु. चोथे संवत्सरी करनार पू. पं. श्री गंभीरवि. म., लवारनी पोणवाणा पू. प. श्री प्रतापवि. म. पू. प. श्री ह्याविभलज्ज गणि अने पू. आत्मारामज्ज म. वगेरेनो समुदाय

વગેરે તથા તેઓશ્રીની નિઅના અનેક શહેરો તેમજ ગામેનાં હજારો આવકવર્યો હતા.”

અને એથી જ એજ પૂ આ. શ્રી વિજયદાનસૂરિલુ મ. ને પોતાના એજ વિવિધપ્રક્રોતર લાગ બીજના પેજ ૩૦૩ ઉપર આ બાખત વધુ રૂપણ પ્રકાશ પાડવાની ફરજ પડી છે કે—“આ પ્રમાણે સં. ૧૯૫૨ તથા ૧૯૬૧ માં પણ હતું, અને તે સમયે (શ્રી સંધના મોટા ભાગે નહિ પણ) શિષ્ટજનોએ છઠનો ક્ષય અંગીકાર કરીને શુદ્ધ ચોથની સંવત્સરી આરાધી હતી.”

‘આ સાંકળયંદ હડીશાંગ સિદ્ધારથ’ની તે સં. ૧૯૫૨ ની પત્રિકાના ઉપરોક્ત રેકોર્ડ ઉપરથી અને તે રેકોર્ડ ઉપર મહોરથાપ મારતા-નવામતી આ. શ્રી વિજયરામયંદસૂરિલુના દાદાયુદ્ધ પૂ. વિજયદાનસૂરિલુ મ.ના (ઉપર મુજબના) બખ્યા વખતના લખાણનું વાંચીને સુનાંધુએ સહેજે જ સ્વીકારે તેમ છે કે—“નવામતી આ. શ્રી વિજયચમૃતસૂરિલુ મ.ની લેખાતી ‘શ્રી હર્ષપુષ્પામૃત નૈત્ય અંથમાલા’ના અંથાંક ૨૨ તરીકે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તે ‘તિથિયર્યાના વિષયમાં સત્યનું રૂપણીકરણું’ નામની ૬ ડ્રાર્મ પ્રમાણું બૂકના પેજ ૧-૧૫ થી ૧૬ તથા ૨૭ તથા ૪૭ ઉપર છપાયેલ મં. ૧૯૫૨ની સંવત્સરી પ્રસંગનાં લખાણો ધરાદાપૂર્વકનાં માયામૃતપૂર્ણ જૂડાણાં જ છે, અને તે સાથે જ નક્કી થશે કે—તેઓ એવા હરદમ અસત્ય પ્રચાર-વડે પ્રલુશાસનની છાયોક કુસેવા જ કરી રહેલ છે.” મજફુર બૂકમાં પ્રચિદ્ધ થયેલ ‘તિથિયર્યાના વિષયમાં સત્યનું રૂપણીકરણું’ રીપર્ટ અને લેખો તેઓએ જ્યારે મહાનીરશાસનપત્રમાં પ્રસિદ્ધ કરેલા હતા, ત્યારે તેના સંજરડ જવાબો પત્રિકા નં. ૨ તથા પત્રિકા નં. ૭ દ્વારા મારા નામથી આપવામાં આવતાં, તે બદ્લ તેઓને આજમુદ્ધી લોચા વાળનાની રિથનિમાં મૂકાઈ જવું પડ્યું હતું, એ વાત ભૂલી જાને તેઓ આજે પાછા એજ એ લેખોને પોતાની આ તદ્દન તર્કારી ટ્રૂક્ટમાં આપવાની હિંમત વાપરી શક્યા છે, એ તેમની યોગ્યતા બદ્લ

શખ્દો નથી. તે ખૂફનાં પેજ ૪૩ ઉપર પેરા ૪ માં ‘શ્રી સિદ્ધયક પાલિકભાંના અંકા-સમાધાનો કાપીદૂપિને કૃતિમ બનાવીને છાપેલ છે’ એ મારા જવાયભાંના વાક્ય બહુવ લોચા વાળે છે કે “સિદ્ધયક વરસ, અંક, સમાધાન વગેરે નંબરવાર દર્શાવેલ છે; એટલે આ તો નફુર સત્ય હકીકત છે.” તેના બહુવામાં તેઓને ક્યા શખ્દોમાં માયામંદિર કહેવા? વર્ષ-અંક-સમાધાન વગેરે તો નંબરવાર દર્શાવેલ છે, પરંતુ સિદ્ધયકમાં અપાયેલ તે તે સમાધાનો તો અડધાપહ્યા કાપીદૂપિને પોતાને અનુષ્ઠળ વિભાગ પૂર્તા જ આપ્યા છે, તેથી તે નફુર સત્ય નહિ પણ નફુર અસત્ય હકીકત છે. આ વરતુ એમ જ છે એમ જાણવા છતાં જેઓ પકડાઈ ગયેલા પાપનો પણ આવી જૂડી રીતે દાલિક બચાવ કરે છે, તેને આરાધક કેમ બનાય?

તેઓ ભીતા આ રીતના ચોગરદમ જેરશોર્થી શરૂ થયેલા અસત્ય પ્રચારના પ્રતીકારની વિચારણા ચાલતી હતી, તેવામાં ગંધ કાલે એટલે જુદ્ધાઈની ડોમીએ અમદાવાદથી પોષ્ટદારા તેઓશ્રી તરફના જૈન જગ્યાતિ લેખમાળાના ૧ થી ૫ મણુકા (નવામત માટે હવે નવકારવાળા લેવાનું સુખવનારા પારા) આવી મળ્યા! જેના લેખક-અનિલકુમાર છે, પણ તે સાહિત્ય સાધાંત વાંચતાં તો લેખક ચોક્કા અનિલકુમાર ભાસ્યા! કારણ કે—“આ મણુકાઓમાં, તેઓશ્રીએ ભીજાભીજ પ્રચારની કેમ મં. ૧૬૫૨ના સંવત્સરી પ્રસંગ આહિની વાતો તો સદંતર બનાવતી તરીક આલેખી જ છે; પરંતુ ‘નવામતે દ્વાલાંધ શાસ્ત્રપાડોનો ય મજબૂત આધાર છે’એ પ્રકારે જનનાને અમનજીમાં સંડોવવા માટ મંઘ્યાંધ શાસ્ત્રપાડો આપવાનો ડાળ પણ બતાવેલ છે! પરંતુ તેઓ માટે શરમજનક છે કે-તેઓએ તે શાસ્ત્રપાડોને અડધા-પડર્હી ઝુરી નાંખીને અને કાઈ કાઈ પાડોમાંથી શાસ્ત્રકારના મૌલિક શખ્દોને જ ઉડાવી દેવાનું ધોર પાપ સેવીને પણ પોતાના નવામતને ધણા સાચા પાડોનો પણ આધાર છે એમ જનનાને સદંતર જૂડી રીતે બતાવવાનો મેધાડંબર કરવામાં આવેલ છે! એટલું જ નહિ પણ તે તુટક અને

ખંડિન પાડોના અથેં પણ અસત્ય કરીને અને તે જૂડા અથેંનો ભાવ પણ કૌંસમાં પોતાની જૂડી ભાન્યતા મુજાહનો લખી અતાનીને સ્વકૃપ્ય આવીશરાને મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવેલ છે ! ” કહે છે કે—“ એ રીતે તુટક તથા ખંડિન પાડો અને અથેં યોજ આપનાર ઓ ભાનુનિ તથા શ્રી મુક્તિવિ છે, અને તે વસ્તુને મીડી ભાષામાં યોજ આપનાર શ્રી ધીરજલાલ છે ! ” તે ગમે તે હા, પણ તેઓએ આવું લોકોત્તર સમાજને શાખ્યપાડોના ઓઠાતણે છેતરવાતું અધમ કાર્ય કરતાં ખરેખર શરમાવું ધટે છે.

## જૈન જગુનિ લેખ્યમાલાના ભણ્યકાચ્ચોમાંનાં અસત્યનું ઉદ્ઘાટન.

(૧) મણુકા પેલાના પેજ ૨૦ના પેરા ભીજના “ને ધાર્યું હેઠળ તો શ્રી સિદ્ધસેન દિવાકરે૦” થી માંડીને પેજ ૩૧ની અંતિમ “એટલે અમારે જેણ્યે કહેવું પડે છે. ” એ પક્ષિત પર્યન્તનું ગર્ભિત રીતે કેવળ આ. શ્રી વિજયરામયદ્રસ્ફુલિને ઉદ્દેશીને કરવામાં આવેલ લખાણ, “હવે માત્ર શ્રી ચારિત્રિનિ ને જ તેઓ તજી”, તો યે અમો તેઓને આજામાં લઈ લેવાપૂર્વક તેઓના સ્વીકારેલ મતનેં જાલી રાખવા તૈયાર છીએ. ” એમ કશુલાતર્દર્દીક જણાતું હોવાથી આ પહેલો મણુકો શાસનના અહિતનું પ્રથમ પગધિયું લેખી શકાય.

(૨) મણુકા ભીજના પેજ ૨૪ના પેરા ભીજના “પરંતુ અમારી દૃષ્ટિએ આ પરિસ્થિતિનું ખરું કારણું” થી માંડીને અંતિમ પેજ ૨૮ના પહેલા પેરાની “તેઓ આટલી હે જવા માટે તૈયાર છે ખરા ? ? ” એ એ છેલ્લી પંક્તિ સુધીનું લખાણ પણ આ. ઓ વિજયરામયદ્રસ્ફુલિને ‘તેઓને સમૃદ્ધામાં મેળવી લેવાને પોતાની આંતરિક ધ્યાન, એ રીતે છે’ એમ ગર્ભિતરીતે જણાવી દેનારુ છે, અને તે પછીના છેલ્લા પેરાના લખાણથી ‘ને એમ કશુલ હોય તો ‘નવો મત અમોને ભાન્ય જ છે’ એમ આ ભીજ મણુકા પઢીથા ને ત્રણ મણુકા પ્રસિદ્ધ કરવાના છીએ તેમાંના લખાણથી આત્મી આપીએ છીએ, ” એમ પણ ગર્ભિત

રીતે સકેત અપાએલ જણાતું હોવાથી આ ભીજે મણુકો પણ પ્રભુ-શાસનનાં અહિતતું ભીજું પગથિયું લેખી શકાય તેમ છે.

(૩) ત્રીજી મણુકાના પેજ ૬ ના ભીજી પેરામાં આદ્ધવિધિયંથના નામે જે “કલ્યાણુકોની તિથિઓનો સમાવેશ પણ પર્વતિથિઓમાં કરવાનો છે.” એમ એ વખત લખ્યું છે, તે શાસ્ત્રના નામે જનતાને ભરમાવનારું ઈરાદાપૂર્વકનું અસત્યસેવન છે. જિજાસુચી એ અવિકાર આદ્ધવિધિના પૃષ્ઠ ૨૫૨ ઉપર જેઠ લેવા વિનંતી છે. કલ્યાણુકપર્વતીએ એ કાર્યપર્વતીએ હોવાથી મરજ્જાત આરાધવાની હોય છે, અને મહિનાની ભાર પર્વતીએ એ કાલપર્વતીએ હોવાથી ફરજ્જાત આરાધવાની હોય છે. કલ્યાણુકો એક દિવસે એક-મે-ત્રણ-ચાર પણ આરાધી રાકાય છે. ન્યારે ભાર પર્વતીમાંની કોધપણ પર્વતી એક દિવસે એક ૪ આરાધવાની હોય છે. કલ્યાણુકપર્વતીએ અને ભાર પર્વતીએ વર્ચ્યે આટલો મોટા તદ્દીવન છે: અને તેથી ૪ આદ્ધવિધિકાર તો શું, ૧૫રંતુ કોધપણ શાસ્ત્રકાર તે મરજ્જાત ગણાતી પર્વતિથિઓ ફરજ્જાત ગણાતી ભાર-પર્વતીમાં સમાવેશ કરવાનું કહેતાજ નથી. આદ્ધવિધિમાં તે સ્થળે શ્રી નેમનાથ પ્રભુએ શ્રી કૃષ્ણ મહારાજને મૌન એકાદશી ઉત્કૃષ્ટી જણાવી છે, તે મૌન એકાદશી પણ ભારપર્વતીમાંનોજ એક પર્વતિથિ છે અને ભારેય નિધિ કરતાં તે તિથિએ કલ્યાણુકો પણ ધરણાં થયા હોવાથી તેને ભાર પર્વતીમાં વહુ ઉત્કૃષ્ટ કહેલ છે

(૪) તે મણુકાના પેજ ૭ ઉપરના પેરા ભીજામાં “આ પર્વતિથિ-એમાં વત-પર્વતીખુખાણ વગેરે કરવાથી શુલગતિનું આયુષ્ય બંધાય છે” એમ લખ્યું છે, તે સર્વ શાસ્ત્રથી વિસ્ક છે. શાસ્ત્રકારો કલ્યાણુકપર્વતી અને અદૂધપર્વતીને આશ્રયને આયુષ્યનો બંધ થતો હોવાનું જણાવતા નથી, પણ મહિનાની ભારપર્વતીને આન્યને આયુષ્યનો બંધ થતો હોવાનું જણાવે છે. કારણ કે-ભાવિ આયુષ્યનો બંધ પણ આનુ આયુષ્યના ત્રીજી ત્રીજી લાગે પડે છે અને ભારપર્વતીમાંની પર્વતિથિ

પણ ત્રીજ ત્રીજ દિને આવીને બેભી રહે છે.' (કલ્યાણુકાદિપર્વિએ  
ત્રીજ ત્રીજ દશાડે આવતી નથી.) જુઓ આચારોપદેશ અંથ.

(૫) તે મણુકાના પેજ ૧૩ના પેલા પેરામાં જે “ઉત્તર-આપણા  
પંચાગોમાં તિથિએની હાનિ અને વૃદ્ધ આભતમાં માન્યતાનો મુખ્ય  
ક્રેદ આવે છે, × × × × આજે જે પંચાગો નીકળા રહ્યાં છે ને  
જેનો આપણા સમાજમાં પ્રયાર છે, તે બધા લૌકિકમત મુજબનાં છે.”  
એમ લખાણ થયું છે તે આલિનિવેશિક મિથ્યાત્વથી પરિપૂર્ણ છે. કારણ  
કે-આપણા સમાજમાં જે પંચાગોનો પ્રયાર છે, તે પંચાગોમાં લૌકિક  
ગ્રીપણુમાં આવતી પર્વતિથિએની હાનિ અને વૃદ્ધિનો આપણા ‘ક્ષય  
પૂર્વા’ શાસ્ત્રથી સંસ્કાર કરી નાખવાપૂર્વક તે તે ક્ષીણું અને વૃદ્ધ  
પર્વતિથિને (ગ્રીપણુમાંની અપર્વતિથિના સ્થાને) ઉદ્યાત્ર તરીકે બનાવ-  
વામાં આવતી હેઠાથી આપણા પંચાગો હંગીજ લૌકિક નથી:  
દોડાતર ૭૪ છે.

(૬) પેજ ૧૪ પંક્તિ ૪ થી ૭ “ચાન્દ અને સોર સંવંતસરના પ્રત્યેક  
બધાએ મહિને એક એક અહોરાત્ર ધટે અને એકેક અહોરાત્ર વધે, કે  
જેનો ઉદ્દેશ આગમોમાં અવમરાત્ર અને અતિરાત્ર તરીકે કરવામાં  
આવ્યો છે” આ લખાણમાં ‘પ્રત્યેક બધાએ મહિને એકેક અહોરાત્ર  
ધટે’ એમ જણાવવાવડે તેમણે અવમરાત્ર=તિથિક્ષયને અહોરાત્ર કરેલ  
છે એ હિસાએ ‘બધાએ મહિને એક અહોરાત્ર વધે’ એમ જણાવવાવડે=  
દિનવર્ષદ્વિને અહોરાત્ર કહેવાને બદલે અતિરાત્ર=તિથિવર્ષદ્વિને અહોરાત્ર  
કહેલ છે. (જુઓ એ ત્રીજ મણુકાનું પેજ ૨૬ પેલો પેરો) એ ભૂત  
છે. અવમરાત્રનો શાસ્ત્રીય અર્થ તિથિક્ષય અને અતિરાત્રનો શાસ્ત્રીય  
અર્થ દિનવર્ષ છે, તેની સમજના અલાવે સર્વત્ર ‘અહોરાત્ર’ કરીને યાલે,  
તેવા અજાની માણુસને તેમના ગુરુજીએ શાસ્ત્રઅધ્યાત્મનો સખત નિષેધ  
કરવો ધટે છે, અથવા તો પોતાને આવડતો હોય તો ‘ય પક્ષાશ્રિ-  
તમોઽહોરાત્રસ્તસ્મન્નેકષાશ્રિતમા દ્વાષશ્રિતમા ચ તિથિનિંધનમુપ-  
ગતેતિ દ્વાષશ્રિતમા તિથિલેકિ પતિતેતિ વ્યવહ્રિયતે’ એ શ્રી

સૂર્યપ્રતાપિત અંથના પૃષ્ઠ ૨૧૭ ઉપરના પાઠનો અર્થ સમજાવીને, 'નૈતનમત પ્રમાણે નિધિ ધટે પણ કહ્યે વધે તો નહિ જ' એમ નક્કર બોધ પીરસીને પછી જ બોલવાની રજ આપવી ધટે છે. તે પેજની પુટનોટના પહેલા પાઠમાં જણાવેલ 'તેવીસતિમે' ને બદલે 'તેવીસતીમે' અશુદ્ધ લખ્યું છે, તે અને બીજા પાઠમાં જણાવેલ 'વીસતિમે' ને બદલે 'વીસમેઝમે' અશુદ્ધ લખ્યું છે, ને શરૂદેશ સુધારી લેવા ડિક છે.

(૭) તે ભણુકાનાં પેજ ૨૪ની અંતિમપંક્તિથી લખ પેજ ૧૫ ની પહેલી પંક્તિમાં લખ્યું છે કે—“અને તે તે પર્વતિથિના ક્ષય વખતે એની આગધના માટે પૂર્વનિધિ લેવાતી” એ વાક્ય સાદંતર જૂડું છે. ‘પૂર્વનિધિનો ક્ષય કરીને તેનાં સ્થાને ક્ષીણું પર્વતિથિ લેવાતી’ એ વાક્ય સાચું છે. દશાશ્રુનાસ્કંધ વગેરેનો નિર્યક્તિઓનાં તેમજ નિર્ણય-ચૂર્ણી વગેરે ચૂર્ણીઓમાં ‘અભિવહૃતસંઘચ્છરે જત્થ અહિઅ-માસો પડતિ તો આસાદપુર્ણિમાતો વીસતિરાતે ભણતિ ઠિથામો ત્ત્વ’ એ પ્રમાણે આવતા પાડો રૂપ્ષ જણાવે છે કે—‘યુગને અંતે આવતા બીજા આસાદમાસની પૂર્ણિમાનો નૈતનગણિતને આધારે ક્ષય આવતો હોવા છતાં તે ક્ષીણું પૂર્ણિમાચાળા હિવસને આસાદ શુદ્ધ ૧૫ તરીકે માનેલ છે અને જણાવેલ પણ છે.’ તેથી લૌકિક ગીતપણામાંની પર્વતિથિના ક્ષય વખતે આપણા સમાજમાં એની આરાધના માટે પૂર્વની નિધિ નહોતી લેવાતી, પરંતુ પૂર્વનિધિનો ક્ષય કરીને તેના સ્થાને ક્ષીણું પર્વતિથિને ઉદ્યાત પર્વતિથિનું નામ આપ્યા બાદજ તે નિધિ પર્વતિથિ તરીકે આગધના માટે લેવાતીઃ જે શાસ્ત્રીય પ્રથાનું અનુસરણ અવિચિન્નપણે વર્તમાનમાં પણ પ્રવર્તે છે. અં. ૧૬૬૦ વર્ષ ૬, આવણ વદ ૬ તા. ૨-૬-૩૪ ના તેમના નૈતનપ્રવચનના પેજ ૧૭૭ ઉપર પણ ‘આ. શ્રી. ૪ ના ક્ષેત્રે ત્રીજનો ક્ષય કરવાનો છે’ એમ રૂપ્ષ લખેલું છે.

(૮) તે ભણુકાનાં પેજ ૨૧ ના પેરા બીજામાં ‘તિહિવાપ પુત્રવતિહી૦’ ગાથાનો (જેમણે આડમનો ક્ષય હોય તો સાતમ જે

ઉદ્ઘનિથિ છે તે અહણ કરીને આદમતિથિ આરાધનાં ( × × × ) એ અર્થ કરેલ છે, તે શાસ્ત્રકારે જણાવેલ અર્થથી ધરાદાપૂર્વક ઓટો કરેલ છે શાસ્ત્રકાર તો એ શ્લોકથા ‘આદમનો ક્ષય હોય તો સાલમને આ દમ તરીક ગણુંની’ એમ જણાવે છે.

(૯) પૃષ્ઠ ૨૦ ઉપર ક્ષયે પૂર્વાંવાળી ગાથાનો પણ એ જ રીતે ઓટો અર્થ કરેલ છે. ‘ગ્રાહ્યા’ રાખ્યથી ‘પૂર્વની જ ઉદ્ઘનિથિ લેની’ એમ શાસ્ત્રકાર જણાવતા જ નથી શાસ્ત્રકાર તો તે ‘ગ્રાહ્યા’ રાખ્યથી ‘પૂર્વની તિથિ જ ક્ષાળુ પર્વતિથિ તરીક લેની’ એમ જણાવે છે.

(૧૦) પેજ ૨૩ નો છેલ્લો (પેજ ૨૪ પર્વતનો) પેરા આભોયે બ્રમક છે. તેમાં ‘શ્રી પર્વતિથિ-ચર્ચાસંગહમાં આ વિષયમાં જણાયું છે કે-’ એમ લખ્યું પણ કોણ જણાવે છે? એ ત્યાં ધરાદાપૂર્વક દૂધપાણ્યું છે. તે સં. ૧૮૭૦ ની સાલના જૈનદીપણાં જૈનપંચ લખેલાં છે છતાં તેમાં પર્વતિથિની હાનિ કાયમ રાખી છે, એ વગેરે લૌકિક દીપણાના ઉતાંડપે સમજવાનું છે, એમ પૂર્વે અનેક વખત સમજવાયું છે, છતાં તે-ને-તે વાતને ( નવોમત યેનકેન સાચો લેખાવવા સાડ ) વારંવાર આગળ ધરાય છે, તેમાં આરાધકપણું કૃત્યા પ્રકાણનું સમજવું? મારે ‘આરાધનાના ભીંતીયાં પંચાંગમાં પર્વતિથિની હાન વૃદ્ધ ન થાય’ એ માન્યતા તે સં. ૧૮૭૦ પછીથી પ્રયોગિત થઈ નથી, પરંતુ પ્રભુશાસનની શરૂઆતથી જ પ્રયોગિત છે. આ ખુદાસા પછીથી વાયકમદાશાં સ્વયં સમજ સ્કે તેમ છે. કે-૨૪ મા પેજના તે લખ્યું પછીથી તેને અનુસરીને કરવામાં આવેલું પેજ ૨૫ ના પહેલા પેરા સુધીનું સમસ્ત લખાણ આમક છે.

(૧૧) પેજ ૨૬ થી ૨૮ ઉપર છપાએલ પૂ. જવેરસામરળ મ.ના શાખાવાળા હેંડબીલમાની પક્ષિતઓને સ્વમતને અનુદૂળ લેખાવવા કરેલો પ્રયાસ વ્યર્થ છે. કારણ કે-પ્રશ્નકારે ‘એકમ બીજ લેણી કરવી કે બારસ તેરસ લેણી કરવી? એમ પૂછેલ છે, એટલે જ ત્યાં ‘એકમ દૂ જ લેણી કરશું’ એમ ઉત્તર અપાએલ છે. પ્રશ્નકારે ‘એકમનો ક્ષય

માનવો કે તેરશનો? એમ પ્રથમ કરેલ હોત તો ‘એકમનો ક્ષય કરવો’ એમ જ ઉત્તર મળત તે વખતે પૂ. ભૂગ્રયંદળ મ. આદિ તો ધણા મહાત્માઓ હતા, તેઓ પણ પર્વક્ષયે પૂર્વઅપર્નો જ ક્ષય કરતા હતા. અન્યથા લાવનગરથી પ્રાયઃ તે વખતથી જ છપાવા શરૂ થયેલાં આપણાં આરાધના માટેનાં ભીતીયાં પંચાંગમાં લૌકિક ટીપ્પણામાંના પર્વક્ષયે પૂર્વના અપર્વતિયનો ક્ષય છપાયેલ જ છે, તે શેના આરાધારે છાપી શકાય છે?

(૧૨) પેજ ૨૮ ના પેના બોલમાં “આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ સમજય છે કે નૈનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ નથી એવા વાતનો ને પ્રચાર થયેલો છે, તે તદ્દન ખોટો છે અને આરાધક આત્માઓને અવળે માર્ગ લઈ જનરો છે” એમ લખ્યું છે તે લખાણ જ સદંતર ખોડું છે. ‘નૈનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ નથી’ એમ આજ સુધી કોઈએ કહ્યું નથી, પછી એ વાતના પ્રચારને રથણ જ કયાં છે? સૂર્યપ્રરાપિત, જ્યોતિષ્કરંડક આદિ નૈનમતને જણાર તો ‘બાર માસમાં છ તિથિનો ક્ષય તો આવે જ છે, પણ કોઈ તિથિની વૃદ્ધિ તો આવી શકતી નથી.’ એમ જ કહે છે: તમો પણ તમારો નવો મત નીકળ્યા પણી જ આ રીતે ‘નૈનમતમાં પર્વતિથિની વૃદ્ધિ આવે છે’ એમ સમગ્ર નૈનજ્યોતિષશાસ્કોથી વિરુદ્ધ ખોલવા લાગ્યા છો કે? મં. ૧૬૬૨ સુધી તો તેવું કદી ખોલ્યા જ નથી એ નફર સત્ય હકીકત છે કે? હવે તેવું ખોલવા લાગ્યા છો, પણ ‘ક્યા નૈનશાસ્ક્રમાં પર્વતી વૃદ્ધિ આવે છે?’ એ શાસ્ક્રનું નામ અને રથળ જણાવો. એમ પૂજનારને તે શાસ્ક્રનું નામ અને રથળ તો જણાવી શકતા જ નથી! પછી એ ઉલ્લેખો પરથી હવે તમને તેવું સમજવા લાગ્યું છે, તે અણાન આરાધક આત્માઓને અવલે માર્ગ લઈ જનારું શાન કેમ નહિ?

(૧૩) પેજ ૨૯ ના પહેલા પેરામાં “ને નૈનમતમાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ થતી ન હોત તો અવમરાત્ર અને અતિરાત્ર જેવા શઠદ્દા

કેમ વપરાત ?” એમ ધરાદાપૂર્વક શાસ્ત્રવિરસ્થ અર્થો કરવાના ધરાદાથી બખનારા તેઓને અશો છે કે-અતિરાત્ર શબ્દ ચંદ્રમાસની અપેક્ષાએ નહિ પરંતુ સૂર્યમાસની અપેક્ષાએ જ વપરાએલ છે, એમ તમો જાણતા નથી ? તેમજ એ અતિરાત્ર શબ્દનો અર્થ ‘નિથિબૃદ્ધિ’ નહિ પણું ‘દિનબૃદ્ધિ’ થાય છે, એ પણ શું જાણતા નથી ? ‘અતિરાત્ર = અધિકદિનં-દિનવૃદ્ધિરિતિ યાવત્’ પાડ જાણો જ છો કે ? જ્ઞાનાં ભતાગ્રહને વશ પડીને એ અતિરાત્ર શબ્દનો અર્થ નિથિવૃદ્ધિ કર્યો જ રાખો છો, એ શું શાસ્ત્રાનુસારિતા છે ? જૈનમત મુજાહ દરેક નિથિ દુર્ઘટ અંશ જ હોવા છે કે ? અને તેથી વર્ષમાં છ નિથિ ધરે ખરી, પરંતુ વંચવા તો પામેજ નહિ, એ સિદ્ધાંત પણ શું ધ્યાન બદ્ધાર છે ? જે નહિજ, તો આ રીતે શાસ્ત્રપાડનો દિનબૃદ્ધિ અર્થ છાડીને નિથિવૃદ્ધિ અર્થ, ધરાદાપૂર્વકજ જૂદો કરો છો, એમ નક્કીજ કરે છે કે ? શાસ્ત્રના અર્થો આ રીતે છડેચોક જૂદો કરનારાઓએ આવાં અપકૃત્યો બદ્ધ શરમાવું ધરે છે. કારણ કે-જૂદો અર્થો ધરાદાપૂર્વક કરવા તે બહુલસંસારીનું લક્ષણું છે

(૧૪) પેજ ૨૬ના તે પહેલા પેનામાં “ વળો શ્રી ઉમાસ્વાતિવાચકને ક્ષયે પૂર્વાં એ શણદો શા માટે ઉચ્ચારવા પડત ? ” એમ ને હવાદો આપેલ છે, તે ખોટા છે. ઉમાસ્વાતિ વાચકનો તે પ્રવોષ, શાસ્ત્રમાં તિથિનો ક્ષય આવે છે, એમ પ્રતીતિ કરાવવા અર્થો છે ? એ નહિ, તો ઉપર કરેલી તિથિક્ષયવાળી વાતના આંધારમાં તે પ્રવોષને રણૂ કર્યો તે ગળાનું આશ્ચર્યથું પગમાં ધાલવા જેણી સ્પષ્ટ ભૂલ કેમ નહિ ? એ પ્રવોષ તો તમે તમારા પાંચમા મણુકાના પેજ ૨૨ ઉપર ‘તિથિનો ક્ષય હોય (અર્થાત્ સૂર્યોદયમાં ન હોય) તો પૂર્વની તિથિ આરાધ્ય (પર્વતિથિ) કરવી ’ એ અર્થ જ સૂચવે છે કે ? એ સિવાય એ પ્રધોષનો ‘ પૂર્વની અપર્વતિથિમાં આરાધના કરવી ’ ધર્તિધારીને મનસ્વી અર્થરૂપે ઉપયોગ કરવા માંયા છો, તે હરદમ જૂડું છે. એમ અહિ તમારા હાથેજ સાંબિત થઈ જવા પામેલ છે કે ? અને એ સાથે શ્રી ધર્મસંબહુના

ભાષાંતર ભાગ પહેલામાં તે ક્ષયે પૂર્વાં પ્રચોપનો અર્થો, આ. શ્રી સિદ્ધિસ્તુતિ મના પ્રશ્નાય સુનિ શ્રી અદ્રંકરવિજયજીએ પણ તમાં વાહે ચડી જવાના પણિખુમે જ તેવો ખોગે કરેલ છે, એ વાત પણ નક્કી થઈ જાય છે કે ?

(૧૫) પેજ ૧૮ના ભીજ પેનમાં “ તે વખતે પૂનમ, ચૌદ્દશમાં સમાતી હતી અને સચિતત્યાગ, ઘનિયર્થ તેમજ પ્રતિકમણુહિ બાળ આગધના આવી જતી ” એમ લખ્યું છે તે શાસ્ત્ર અને અવિચિન્હન પરંપરાથી સદતર વિરસ્થ છે. આ ‘અસત્યના ઉદ્ધારન’ના સાતમા નંબરમાં જણાવેલ નશાશુન્નકંધ વગેરેની ક્ષીર્ણ નિર્ભુક્તિએ આહિમાના ‘અમિબાહૃતસંબંધદરે’ પાઠ અને તમારું છઢા વર્ષનું વૈતન પ્રવચન છાપું પણ સ્પષ્ટ જણાવે છે કે પૂનમના ક્ષય વખતે પૂનમાં ચૌદ્દશ સમાતી નથી, પણ પૂનમપણે સરતંત્ર જેલીજ રહે છે ક્ષીર્ણ પૂનમને પૂનમ તરીકે જેલી ગાખવાનું જણાવનારા આવા સ્પષ્ટ આગમસુનના પણ મજબૂત પણ હોવા છતાં અને સં. ૧૯૬૨ સુંધી તો પોતે પણ પૂનમના ક્ષયે પોતાના પંથાગમાં તેરસનો ક્ષમ કરીને ક્ષીર્ણ પૂનમને ઉદ્ધાર પૂનમ તરીકેજ વર્ષો સુંધી છાપેકી-પ્રયારેવી અને આચયરેલો હોવા છતાં, ‘પૂ. ડીસ્ક્રિપ્શન મ. વખતે પૂનમ ચૌદ્દશમાં હતી’ આજે તેવું આગમ અને આચયરણવિરસ્થ બોલ્યું થાય છે, તે ખૂબ જ લંગતરસ્પદ લેખાવું જોઈએ નવો મત કાદ્યો ત્યારથી આવું એવણું વકતન્ય કરવા તો લાગ્યા છો, પરંતુ કર્તિકી પૂનમના ક્ષયે, ચૈત્રી પૂનમના ક્ષયે, આસો શુદ્ધ ૧૫ ના ક્ષયે તમો પણ તે ક્ષીર્ણ પૂનમને ચૌદ્દશમાં સમાવી શકતાજ નથી, એ તો ઉધાડીજ વાત છે ને ? છતાં આ રીતે પૂનમ ચૌદ્દશમાં સમાધ જવાનું લખ્યે રાખીને અરાજનતાને સન્માર્ગથી બષ્ટ કરવાનું ધોર પાપ કેવા પ્રકારના લલા માટે કરવું પડતું હશે ? ‘ચૌદ્દશ પૂનમ બંનેનું’ એક દિવસે આરાધન થઈ જ જાય છે’ એમ બોલો નાખવું તો સહેલું છે, પરંતુ પાદીતાણે ચોમાસું હોય અને આવતા વર્ષે કા. શુ. ૧૫ નો ક્ષય હોય ત્યારે

કાર્તિકી ચોમાસીનું પ્રતિક્રમણ અને કાર્તિકી પૂનમની યાત્રા બંનેથી તે એક દિવસે કૃયાં કરી શકે છે ? કરી શકતાજ નથી પૂનમની યાત્રા ચૌદ્ધશની સવારે કરે તો તે દિવસે તેમને સવારથી જ પૂનમ ગણુવાનું થતું હોવાથા ચોમાસીનું પ્રતિક્રમણ કાર્તિકી ચૌદ્ધશને બદલે પૂનમે કુવાની અનિષ્ટ રિષ્ટિતમાં મૂકુલું પડે છે કે ? પણ તે બંનેથી તિથિનું આરાધન એક તિથિએ કૃયાં કરી શકે છે ? વળી તે વખતે પૂણિભાનો વિહાર પણ ચું ચૌદ્ધશની સવારેજ કરો છો ? અને તેમ કરવા જવ તો ચોમાસી પ્રતિક્રમણ ચોમાસું રહ્યા તે સ્થળમાં કરવા પામોજ નહિ કે ? ચોમાસામાં વિહાર કર્યાની આપાચિના ભાગી થવા પામો અને પૂનમનું આરાધન તો હવામાંજ ઉડાડી દેનારા તરીકે પર્વતિથિલોપક ગણુવા પામો તે નહીંમાં ! એ જ રીતે ચૈ. શુ. ૧૫ અને આ. શુ. ૧૫ના ક્ષયે પણ તમો તે તે માસની ચૌદ્ધશમાં પૂનમને સમાવી શકતાજ નથી ! અરે સમાવતાજ નથી !!! કારણ કે-પૂનમને ચૌદ્ધશમાં લેખવા જતાં શ્રી નવપદજીની ઓળા આઈજ દિવસની લેખાવની પડે, અને તેમ લેખાવવા જન તો તે વાત તો તમારા ભક્તો પણ સ્વીકારે તેમ નથી; માટે તેવા પ્રસંગે તમારે શ્રી નવપદજીની ઓળાની શરૂઆત તો તમારા આજના પંચાગમાં પણ [ ક્ષીણું પૂનમે તેરસનો ક્ષય કરીને ૧૪-૧૫ જોડિયું પર્વ જોડે જિલ્લું રાખ્યારા સાચનપક્ષની ઓળા જે દિવસથી શરૂ થાય છે ] તે દિવસથી જ બતાવવી પડે છે કે ? આ રીતે પૂનમના ક્ષયે ચૌદ્ધશના દિવસે એક સાથે ચૌદ્ધશ-પૂનમનાં એ આધિંભીલ તો તમારાથી બની શકતા નથી, એમ જાણુવા જતાં પૂનમના ક્ષયે ચૌદ્ધશના દિવસે પૂનમની પણ સચિતત્તમાગ, ઘલચર્ય તેમજ પ્રતિક્રમણાદિ બીજું આરાધના આવી જતી હોવાનું અસત્ય કેમ કરીને ઓદાય છે ? અને પ્રચારાખ છે ? આરાધક આત્માઓની આંખે પાટા બાંધીને તેઓને અવળે માર્ગે લઈ જવાનું આ હોરં કારસ્થાન ખરું કે નહિં ?

(૧૧) પેજ ૨૬ના છેલ્લા પેરાથી પેજ ૩૦ના પેરાની પહેલી હંકિમાં જે “કેટલાકો કહે છે કે ‘આજે એ તિથિ લેગી છે, એવું

ઓલાય કે લખાય નહિ." "એમ લખ્યું છે, તે બોટું છે. એમ કાઢ કહેતું જ નથી. કેટલાકો જે કહે છે, તે—"આરાધનાનાં પચાંગમાં આજે એ તિથિ ભેગી છે, એવું ઓલાય કે લખાય નહિ." એમ જ કહે છે: અને તમાંના બધા જ દાદાગુરુઓ—ગુરુઓ અને સં. ૧૯૮૨ સુધી તો તમે પણ એમ જ કહેતા હતા, માટે લોકિક ગ્રિપ્પણુમાં એ તિથિ ભેગી આવો હોય અને ભેગી ઓલાય કે લખાય, એમાં લદે સમ્યગ્રદિષ્ટનું લક્ષણ માતો, પરંતુ ક્ષયે પૂર્વાંના સરંસ્કારવડે આપણે લોઽાતર બનાવીએ તે આરાધનાનાં પચાંગમાં આજે એ નિથિ ભેગી છે, એમ ઓલાય કે લખાય, તે તો મિથ્યાદિષ્ટનું જ લક્ષણ છે: તેને સમ્યગ્રદિષ્ટનું લક્ષણ ગણાવવામાં તો તમારા બધા જ દાદાગુરુઓ—ગુરુઓ અને ૧૯૮૨ સુધી તો તમે પણ મિથ્યાદિષ્ટના લક્ષણવાળા તરીકે તમારા હાથે જ ગણાઈ જવાની આપત્તિ આવી પડે! વિચારશો: અને એ સાથે આરાધનામાંથી એક દિવસે એ તિથિ ભેગી લખવામાં-ઓલાવવામાં અને આચરવવામાં આ ઉપર જણાવેલ ૧૫ નંબરના ઉદ્ઘાટનમાં બતાવેલ છે તે અડગણોના ભોગ પણ બની જાય છે, એ ધ્યાનમાં લેશો. ભૂલો છો પણ યાદ રાખશો કે આરાધનામાં શ્રી હિરસ્સ. મ૦, હિરમશ્ના પૃ. ૧૪ ઉપર અને શ્રી સેનસુરિલુ મ૦, શ્રી સેનપ્રશ્ના પૃષ્ઠ ૮૭ ઉપર—અને તિથિ ઉદ્ઘાટના જ હોવા છતાં બીજી તિથિને જ ઔદ્ઘયિકી કહે છે, તે જ સમ્યગ્રદિષ્ટનું લક્ષણ છે.

(૧૭) પેજ ૩૦ના બીજી પેરાથી આરંભિને પેજ ૩૧ સુધીમાં લખેલી વાતોને વિદ્યાજ્ઞનો, આ ઉપર જણાવેલ નં. ૧૫ અને ૧૬ નંબરવાળા ઉદ્ઘાટનના મનન બાદ સહજતયા જ ઉન્મતના પ્રલાપ તરીકે ઓળખી શકે તેમ હોવાથી તે વાતોની અત ઉપેક્ષા કરવામાં આવે છે.

(૧૮) ચોથા મણુઢાના પેજ ૪ થી ૫ ઉપર 'સ'. ૧૯૮૨ની ઘટનાને એ શર્ષીકૃતણે છપાએલી વાતને પૃ. આ. શ્રી વિજયદાનસુરિલુ મહારાજે ઉપજની કાઢીને તે સં. ૧૯૮૧ની સાલમાં પ્રાય: બીજી આવૃત્તિ તરીકે પેતાની દેખરેખ નીચે છપાએલ 'પ્રશ્નોત્તરતનથિતામણી' નામના 'અથ(માં નહિ, પણ તે)ની પ્રસ્તાવનામાં એક આવહના નામે અડાવા

દઈને છપાવી નાખેલ હોવાનો ખુલાસો, શ્રી સિદ્ધયક માસિક વર્ષ ૨૦  
સં. ૨૦૧૦ના આવણુ માસના અંક ૧૧ના પેજ ૨૦૫ની પુટનોટમાં  
આજથી નણુ વર્ષ પહેલાં જાહેર પણ થયેલ છે. આમ છતાં તે બનાવઠી  
ભીનાને પૂરુ આત્મારામજી મ.ના વચન તરીકે લેખાવવાનો પ્રયાસ કર્યો  
છે, તે શાસનની કુસેવા છે. પૂરુ આત્મારામજી મહારાજે સં. ૧૯૫૨ના  
જેઠ શુદ્ધ પાંચમે આ. મ. શ્રી વિજયવલ્લભસુરિજી મ.ના હાથે લખાવેલો  
મૂળપત્ર ‘શાસન સુધાકર’ વર્ષ ૧૦, અંક ૭-૮ના પાના ૫૦ ઉપર  
ખ્લોકડેપે છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે પછી ‘સિદ્ધયક’  
તા. ૨૩-૮-૫૨ના વધારાના પેજ ૧૭ થી ૧૮ ઉપર પણ પ્રસિદ્ધ  
કરવામાં આવેલ છે. તેમાં પૂરુ આત્મારામજી મહારાજે ‘પાંચમનો ક્ષય  
આ વખતે કરવો સરો છે’ એમ તો જણાવ્યું જ નથી; પરંતુ ‘અમારી  
સંભતિમાં તા એમ આવે છે જે ઈ તો ક્ષય કરવો જોઈએ’ એમ સ્પેષ્ટ  
જણાવ્યું છે. આ વસ્તુ જણાવ્યા છીં અને લદ્રિકજોને ભરમાવવા તેઓ  
આવાં સરાસર બૂડાણાં સમાજમાં ફેલાવતાજ રહે છે, અને પોતાને  
આગાધક લેખાવી રાડે છે; એ સમાજની નિર્ઝાળતા છે. કલ્યાણકમી-  
જનોએ ખખર લેણી ધટે. ‘ફૂત પેટકાદમાં જુદા જુદ માણસોના હંદ્યમાં  
ન રૂચવાથી અને સુરતમાં એક લાધને તે સમજમાં ન આવવાથી  
તેમને શાંત કરી પ્રતિકમણ જુદું કર્યું; બાકી બધે એક થયું ‘હતું’  
એમ દખેલી છેલ્દી વાત કેવી અક્ષરશ્લો: જૂદી છે, તે તો આ પત્રિકામાં  
પૂર્વ બતાવી આપવામાં આવેલ’ તે સં. ૧૯૫૨ની શ્રી સાંકળયંદ  
હડીથાંગ સિદ્ધારથની પત્રિકામાંનું તારવણ અને આ. શ્રી વિજયદાન-  
સુરિજીના કથનોજ જણાવી આપતા હોવાથી તે બાબત વધુ કહેવું  
રહેતું નથી. હજરો જનોને જુજ લેખાવે તેને કહેવું પણ શું?

(૧૬) મણુડા ચોથાનું પાતું ઈ પેરા ભીજમાં-‘આ. શુ. પ ના  
ક્ષયે ભીજ પંચાંગમાંની બા. શુ., ઈનો ક્ષય કરીને બા. શુ, ચોથે  
સંવત્સરી કરવાનું ૧૯૮૬થી શરૂ થયું’ એમ જણાવ્યું છે, તે જૂદું  
છે. પૂરુ આ. શ્રી દાનસુરિજી મ૦, તેમના ‘વિવિધપ્રાંતર’ લાગ.

ખીજના પેજ ૨૮૦ તથા ૩૦૩ ઉપર સં. ૧૯૫૨-૧૧ અને ૧૯માં છઠનો ક્ષય કર્યો હોવાનું જણાવે છે. આ. શ્રી વિજયનરદાલસુરિજી ‘આત્માનંદ પ્રકાશ’ પુસ્તક ૩૪, અંક ૧૨માં તા. ૧૫-૮-૩૭ના પત્રથી આજથી વીશ વર્ષ પહેલાં જણાવે છે કે—“સર્વ આધુઓએ સ્વ. ગુરુહેવની આજા મુજબ સં. ૧૯૫૨માં ભા. શુ. ૬નો ૧૨ ક્ષય માન્યો હતો, પાંચમનો ક્ષય કોઈએ માન્યો નહોતો × × × × તમામ સાધુઓએ સં. ૧૯૮૬માં પણ ૧૯૫૨ની માદ્ક ભા. શુ. ૬નો ૧૨ ક્ષય માન્યો હતો × × × કોઈપણ આં, ઉં, પંચાસ, પ્રવર્ત્તક, ગણ્ય કે સામાન્ય સાધુએ ભા. શુ પનો ક્ષય કોઈ વખતે પણ કર્યો નથી એ નિર્વિચાદ વાત છે” આમ છતાં આ પ્રચારમાં નવામતીઓ આજે ભા. શુ. ૬નો ક્ષય કરવાનું ૧૯૮૬થી જ શરીર થયેલ હોવાનું અને ૧૯૫૨માં સહુએ ભા. શુ. પનો ક્ષય માનેલ હોવાનું કરેકેડં અસત્ય સાહિત્ય હિંમતભેર પ્રચારી રહ્યા છે, એ જેતાં તેઓનાં હુદયો કેવા ધૃષ્ટ બની ગયાં છે, એ કહેવું મુશ્કેલ થઈ પડે છે!

(૨૦) પેજ ૬ના પેરા ૩(પેજ ૭ સુધી)માં જણાવેલી સં. ૧૯૫૨ની સંવત્સરી સંબંધની ખીજા કેવલ વાહિયાત છે, તે તે પ્રસંગનું સાંકળયંદ હૃતીશંગ સિદ્ધારથનું હે-ઝીલ તથા શ્રી દાનસુ. મ૦ના વિવિધપ્રશ્નોત્તર લાગ ખીજામાંના (આગળ જણાવવામાં આવેલ છે તે) લખાણો જ સાખિત કરી આપે છે.

(૨૧) પેજ ૭ના પેરા ખીજામાં ‘સં. ૧૯૬૧ની ઘણના’ શર્ષક તળે લખ્યું છે કે—“સંવત ૧૯૬૧ની સાલમાં પણ ભા. શુ. ૫ નો ક્ષય આવ્યો ત્યારે ચંદ્રશુયંકુમાં નિર્દ્દેશેલી ઉદ્યાત ભા. શુ. ચોથે ૧૨ સંવત્સરી કરી હતી. તે વખતે કપડવંજમાં ચાતુર્માસ રહેલા પૂ. શ્રી સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન સં. ૧૯૫૨ મુજબ પંચાંગની ત્રીજે ન કરતાં સહુલસંધ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું: ને કે-આ પ્રસંગે પોતાને કુરુષિન્યાયે તેમાં બળવું પડ્યું

હતું, એવી જહેરાત કરાઈ હતી." આ લખાણ ડેટલું અસત્ય છે, એ વાચકમદારથો જ નકી કરી લે, એ શુભ આશયથી આ નીચે તે સં. ૧૯૬૧ની અન્યત્ર અન્યત્ર પ્રસિદ્ધ થએવી તે વખતનો વિગતો જ માત્ર રજૂ કરી દઉં છું: (૧) 'શાસનસુધાકર' પત્રમાં આ પ્રસંગને અનેક વખત યથાવત् જહેર કરવામાં આવેલ છે કે— 'સં. ૧૯૬૧ ની તે સંવત્સરી વખતે પણ પૂજ્ય શ્રી સાગરજી મહારાજે તો ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાની પ્રાચીન પરંપરાનુસારી રીતિને જ સાચવી છે, શ્રી સક્લબસંધને સંવત્સરીના પ્રત્યેક ખામણા પ્રસંગનો મિન્થામિ દુક્કડ પણ પોતાનો તે માન્યતાનુસારે ત્રીજના દહાડે થતી ચોથની સંવત્સરીના હિસાબે જ આપેલ છે, અને સંધમાં લાગલા પડે તેવું સંધને લાગતું હોય તો મારો તેમાં આચચ નથી." (૨) મુનિશ્રી સૈમંકરસાગરજી મહારાજના નામથી સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલ 'આ. શ્રી રામચંદ્રસુરિજીને સખુસણુંતો જવાબ' નામની ખૂંકના પેજ ૪૭ ઉપર લખેલ છે કે '૧૯૬૨ (૧) માં કપડવજ મુકામે પુ. આચાર્યશ્રીએ શ્રીસંધ વચ્ચે લા. શુ. ૫ ના ક્ષયે ત્રીજનો જ ક્ષય અને વૃદ્ધિએ ત્રીજની જ વૃદ્ધિ થાય એમ સાદે જહેર કરીને કુલષ્ટિન્યાયે જ સંધ સાથે સંવત્સરી કરી છે.' તથા (૩) તે ખૂંકના પેજ ૫. ઉપર પણ લખેલ છે કે—"પુ. આચાર્યદેવશશ્રીએ તો તે વખતે પણ ૧૯૫૨ની જ માન્યતા ત્યાંના સંધ વચ્ચે જહેર કરી છે અને સક્લબસંધને સંવત્સરી પ્રતિકમણુમાં આવતો મિન્થામિદુક્કડ પણ તદ્દનુસાર જ દીધિએ છે." (૪) સં. ૨૦૦૪ માં પુ. મુનિરાજશ્રી દર્શનરિગ્યજી મ૦, પોતાનો 'નૈનપર્વતિથિનો ધર્તિહાસ' નામની ખૂંકના પેજ ૪૪ ઉપર લખેલ છે કે—"પુ. શ્રી સાગરજી મહારાજે પણ કપડવંજના સંધની એકતા માટે સંધને + અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું: એ પણી તે પંક્તિમાંની આ + નિશાનીવાળી ટીપ્પણીમાં લખે છે કે-ભા. શુ. ૩ ના ક્ષયના હિસાબે આવતી ભા. શુ. ૪ ના રોજ સક્લબસંધને ખમતખામણાં કર્યાં હતાં અને જણ્ણાચ્યું હતું કે-'મારી

માન્યતા ત્રીજના ક્ષયની છે, પણ તેમ કરતાં સંધમાં એકતા ન સચવાય તેમ હોય તો હું તેનો આગ્રહ કરતો નથી.” (૫) સં. ૨૦૧૦ના ‘સિદ્ધયક’ વર્ષ ૨૦, અંક ૧૧ના પેજ ૨૦૪ થી ૨૦૬ ઉપર સુરત તથા રાધનપુરના આગેવાન સાત શેખીની સહીવાળું તે સં. ૧૮૬૧નું હૈનુભીલ પ્રસિદ્ધ થયેલ છે, તેના સારફે શીર્ષકમાં પ્રસિદ્ધ થયું છે કે—‘સં. ૧૮૬૧માં લા. શુ. ૫ ના ક્ષય પ્રસગે ગ્રામીન પરંપરા મુજબ ત્રીજનો ક્ષય કરી ચોથે સંવત્સરી પર્વ આરાધનાર શ્રી સુરત નૈન સંધના આગેવાનોએ પ્રસિદ્ધ કૃતેલ પત્રિકા.’ કેને પત્રિકા સં. ૧૮૬૧નો સંવત્સરી પ્રસંગ જાણવાની જિશાસાવાળાએ વાંચવી જરૂરી છે.

સત્ય વરસુ આમ હોવા છતાં ‘સં. ૧૮૬૧માં સહુએ ચંડાંશું માંતી ઉદ્ઘાત લા. શુ. ચોથે સંવત્સરી કરી હતી, તેમજ સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન ૧૮૫૨ની જેમ પંચાંગની ત્રીજે ન કરતાં સંકલસંધ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું’ એ મુજબ તે બીનાને ઉલટાજ સ્વરૂપે જૂહા ઇપમાં કહે અને પ્રચારે તેમાં આત્માર્થીપણું ક્યાં રહ્યું? સં. ૧૮૫૨માં જેટલો વર્ગ લા. શુ. ૫ ના ક્ષયે ત્રીજનો ક્ષય કરને ચોથે સંવત્સરી કરવાના સત્યમાર્ગ હતો, તેમાંથી ધણ્યા વર્ગને આવા અસત્ય પ્રચારોવડેજ સત્ય માર્ગથી બાટું કરવામાં આવેલા, તેથી જ તે સત્ય માર્ગનું આરાધન કરનાર વર્ગ, આ સં. ૧૮૬૧માં અત્ય રહેવા પામ્યો હતો, એ સત્ય દ્ર્ષ્યાવે નહિં તો સારું.

(૨૬.) પેજ ઉપરના ‘સં. ૧૮૮૮ની ઘટના’ શીર્ષક તથે ત્રીજ પેરામાં ૮ મે પાને લખ્યું કે—(૧૮૮૮ની સંવત્સરી પ્રસગે લા. શુ. ૫ના ક્ષય વર્ષતે લા. શુ. ત્રીજે ચોથ કરીને સંવત્સરી કરનાર) પૂ. શ્રી સાગરાનંદસ્થીશ્વરજીના સમુદ્દ્રાય સિવાયતમામ સમુદ્રાચોથે શુફ્તવારની સંવત્સરી કરી હતી.” એ બદ્ધ તેચો સાચા થઈ જવાબું આપે કે—“(૧) તે સં. ૧૮૮૮ની વર્ષતે [ સં. ૧૮૬૧માં પેતાના તરફથી નીકળતા લીતીયાં પંચાંગમાં લા. શુ. ૫નો ક્ષય બહાર પાડનાર ] શ્રી ભાવનગર

જૈનધર્મ પ્રસારક સભાએ પણ—“હવે તિથિનો ક્ષય ન કરવાની આપણી ખૃતુંને અનુસારે શુદ્ધ પના ક્ષમે શુદ્ધ રનો ક્ષય કરવો જોઈએ પરંતુ તે દિવસે સંવત્સરી પર્વનો દિવસ હોવાથી તેનો ક્ષય ન કરીએ તો તે નો ક્ષય કરવો જોઈએ” એમ જહેર કર્યું છે કે ? (૨) તે વખતે અધાર પડેલા : આપણાં આરાધનાનાં બીતીયાં પંચાગેમાં પૂર્ણાંનિજયજી ત્રિપુરી મહારાજ આદિએ તે બા શુદ્ધ પંચમીના ક્ષમે ત્રીજનો ક્ષય જહેર કરેલ છે, અને તે પ્રમાણે જ સંવત્સરી પર્વનું આરાધન કરેલ છે કે ? (૩) તે વખતે તે ત્રિપુરી મહારાજે આપ્રમાંસ કરેલ શહેર, આજુઆજુનાં બીજાં ગામો, ની ભીવામેનો, ધાર (માળવા), છાણી, સુંત, કડોર, દમણ, વેજલપુર, વગેરે અનેક શહેરો અને ગામોના સમસ્ત સંવીએ પણ પાંચમના ક્ષમે ત્રીજનો ક્ષય માનીને જ સંવત્સરીપર્વ આરાધ્યું હતું કે ? (૪) અને એમાંની ડેટલીક બીજા સં. ૧૯૮૬ના શ્રી સિદ્ધયક પાલ્સિક આવણ વદો) ના ૨૩મા અંકના અંતિમ ટાઇટલ પેજ ઉપર આજે પણ વાંચી જ શકો છો કે ?” જે હા, તો “ તે વખતે એકલા પૂર્ણ સાગરજમના સમુદ્રાયે જ પાંચમના ક્ષમે ત્રીજનો ક્ષય કરી સંવત્સરીનું આરાધન કર્યું હતું, અને તેમો સિવાયના તમામ સમુદ્રાયોએ ચોથ શુફ્લવાની સવત્સરી કરી હતી.” એમ લખો છો તેમાં ‘ભૂપાવાદવિરમણ’ નામના અધારને સાચવવાની લેખ માત્ર કાળજી રાખી હોય તેમ જણાય છે ? આ ખુલાસા પછી સુજગનો સમજ રાડે તેમ છે કે—પ્રગતું ચોથા ભણકાના પેજ ૮૨ ઉપરના “ઉપર પ્રમાણે સં. ૧૯૫૨ અને સ. ૧૯૮૮માં × × × એલ્યે નિધિયર્થાંતી અર્થાત તિથિના મતભેદની શરૂઆત શ્રીખુજરાનો સમય આદ કરતા વર્તમાનકાળે ક્યારે કાના તરફથી શરૂ થઈ, તે વાયકો સારી રીતે સમજ રાખશે.” એ લખાઓવાળા બાળ પેરાના લખાણવડે ‘તિથિયર્થાંતી શરૂઆત સં. ૧૯૮૮થી જ શરૂ થવા પામી અને તેના જવાઅધાર પૂર્ણ સાગરજમના છે,’ એમ ડાસાવવાનો જે પ્રયાસ કરેલ છે, તે સહંતર બાદીશ છે.

(૨૩) પેજ ૮ ના વીજ પેરામાં જે—“ સં ૧૯૬૦માં સાધુસંમેલન થયું તે વખતે પૂ. દાનસુરિજી મહારાજે પૂ. આ. શ્રી વિજયનેમિસુરિજી મ. વગેરે આગેવાન આચાર્યેને કચ્છુંકે—‘તિથિનો વિચારણા પણ કરી લો’ પરંતુ તે વખતે પૂ. નેમિસ્ક. મહારાજે એવો જવાબ આપ્યો કે—‘અહિ તો ભીજ અચ્છવાળા પણ છે, અને તિથિનો પ્રશ્ન તો એકદા તપાગઅહે વિચારવાનો છે’ એમ લખ્યું છે, તે આખીએ વાત ઉપજાવી કાઢેકી છે. સંમેલન વખતે તેવી કોઈજ વાત કોઈએ કોઈને કરી જ નથી. અત્ર સુતાજીનો વિચારે કે—નવા મતની ઉત્પત્તિ જ સં. ૧૯૬૨માં છે, પછી એ અદ્દલ ૧૯૬૦માં વાત કરવાની હોય પણ શું? હતી જ નદી. આથી તે સ્વયં જીબી કરીને અહિં રજૂ કરી દીધેકી કપોલકટિયા વાત ઉપર ઈષ્ટ પિષ્ટ વિવેચન કરીને આપેખેલું આપું દમું પેજ જ અનવસ્થિની લેજનાં ચાલાસ્વરૂપ હોઈ તેની પણ ઉપેક્ષા કરવામાં આવે છે.

(૨૪) પેજ ઈના અંતિમ પેરાથી લઘ પેજ ૧૩ સુધીમાં સં. ૧૯૬૨માં આવેલ બા. શુ એ પાંચમને આશીને કરેલી સંવત્સરી પ્રસંગની વાતોને તેમણે આ મણુકાઓમાં પોતે પ્રથમ રજૂ કરેલી નિરાધારપ્રાયઃ વાતોને ખરી વાતો તરીકે ટકા આપવાપૂર્વક, મનગમતી રીતે અને અચ્છત્ય સ્વરૂપે રજૂ કરેલ હોવાથી તથા તેનો સચોટ અને જડાતોડ રદ્દીયો આમતાં લખાણું નિરર્થક વર્ધી જતું હોવાથી, તે વાતોની પણ અત્ર ઉપેક્ષા કરવામાં આવે છે.

(૨૫) પેજ ૧૩ના અંતિમ પેરાથી માંડીને પેજ ૧૫ના પહેલા પેરા સુધી કરેલી ‘સં. ૧૯૮૬ની ઉભય આચાર્યેની ચર્ચા, લવાદ નીમાયો’ વગેરે વાતો તો (અંતે સ્વમતને સમાજને માથે યેનકેન ઢોકી બેસાડવા ચાર લવાદને પણ ઝોડી નાખવાનાં કરેલા ભેદી કાવતરાં શાસનપક્ષના હાથે પકડાઈ જવા પણ પામતાં સમાજમાં જાંચું માથું કરીને ચાલવાનું રહ્યું નથી, ત્યાંસુધી પહોંચી છે અને તે સારા સમાજને સુવિદિત છે તેથી) ભીતાં ભીતાં અને ધર્યી અધૂરી લખેલી

હોવાથી તથા તે અધૂરી પણ હેંકાઈંકપૂર્વંકનો હોવથી તે વાતોનેય ઉપેક્ષણીય ગણવામાં આવે છે.

(૨૬) પેજ ૧૫ ઉપરના ‘સં. ૨૦૦૪ની ઘટના’ શર્ધાક તળેના લખાણુથી પેજ ૧૭ના ખીજ પેરામાંની “અનંતર ચોથે એવો પાડ નથી મળતો તેથી સંલગ્ન અર્થ ક્યાંથી લેવો ?” ત્યાંસુંચીનું ને તે આચાર્યાંભગવંતોના નામે લખેલું લખાણું, તે તે આચાર્યાંભગવંતોએ પોતાનું મંત્રય તથાપ્રકારનું છે, એમ કોઈને કહ્યું નહિ હોવા છત્તાં કલ્પિત બેલું કરેલ છે. નિર્ધારથ ચૂર્ણિમાંના ‘અણાગળાએ ચર્ચાત્થીએ’ પાડનો અર્થ ‘અનંતરચોથે’ એમ જણાવનારો પાડ તમને મળતો નથી, તેથી તમે ‘સંલગ્ન’ અર્થ લઈ શકના નથી, તો તે ‘અણાગળાએ’ પાડનો અર્થ ‘પૂર્વની ચોથે’ એમ જણાવનારો પાડ કર્યાં છે ? નમને ક્યાંથી ભલ્યો ? કે-જેથી તમે ‘અણાગળાએ’ પાડનો સર્વ આચાર્યોએ સર્વસંમતત્વા અધાપિ પર્યાંત કહેલો અને આચરેલો ‘અનંતરચોથે’ અર્થ હોડીને ‘પૂર્વની ચોથે’ અર્થ કરવા માંયો છે ? જો પૂર્વચાર્યાંચરિત અથેનિ માનવા નથી એમ અઃગ્રહ ન હોય અને પોતાના તરફથી બેના કરવામાં આવના કલ્પિત અર્થને જ સાચા અર્થ તરીકી લેખાવ્યા કરવાની મનત્વની ધૂન ન હોય તો હવે તે ‘અણાગળાએ ચર્ચાત્થીએ’ પણ નો અર્થ તમે સં. ૧૯૬૮થી ‘પૂર્વની ચોથે’ કરવા માંયા છો, તેવો અર્થ તમે જ સર્વમાન્ય એવા કોઈપણ નૈતન્યાસ્ત્રમાંથી ખતાવોઃ છે કોઈ સ્થળે ? અને ‘અનંતર ચર્ચાત્થીએ’ અર્થ તો અનેક આચાર્યાંભગવંતો આહિએ કરેલો મોજુદ છે કે ? તમારા પહેલાં માર્ગસ્થ કોઈ આચાર્યે તે પાડનો ‘પૂર્વની ચોથે’ એમ અર્થ કર્યો છે ?

(૨૭) પેજ ૧૭ ઉપર શ્રી કલ્પકિરણાવકીમાનો મુઢ્ઢ મૃતમાતૃ-સદ્ગ્રાંઠિ પદ્મમર્મી, સ્વીકૃત ચ કલ્પલતાસમાં ચતુર્થી પાડ, મૂળપાડમાં જણાવેલા હેતુપાડેને તોડીને અને ‘મુઢ્ઢ’ રણ્ણ પોતાના ધરનો જોડીને તે શાસ્ત્રકારના નામે રજૂ કરવામાં આવે છે કે ? શ્રી કલ્પ-કિરણાવકીમાં તે મૂળ પાડ, ‘પરિત્યજ તૌર્થાનાદ્વત્ત્વેન મૃતમાતૃ-

કલ્પાં પञ્ચમીં, સ્વીકુરુ ચ તીર્થાહતત્વેનૈવ કલ્પલતાકલ્પાં  
ચતુર્થીં જિનાજ્ઞાત્વાત्' એ પ્રમાણે જ છે કે? નવા ભતમાં તમે જ  
તમને સચા જણ્ણાતા હેત તો આમ શાખના પાડોનેય તોડીદીડી  
નાખવાનું પાપ કરો ખરા?

(૨૮) તે પાઠની નીચે રજૂ કરેલી નહિ એ પર્વી પંચમી, સર્વ  
સમાણી ચોથે। ભવમીરુ સુનિ માનશે, ભાષ્યુ અરિહાનાથે ॥' એ  
ઓ પર્યુષથ્યાના ચૈત્યવદનની ૮ મી ગાથાના અનુસંધાનવાળી આ  
'નવ વખાણ પૂજા સુણો, શુક્ર ચતુર્થી સીમા; પંચમીનિ વાંચે સુણો, હોય  
વિરાધી નિયમા' તરીકેની સાતમી ગાથાને ધરાદાપૂર્વક ગોપનીને રજૂ  
કરી છે, કોઈ અપૂર્વ શાખના ગાથા તરીકે અદિકણનોમાં ભાસ કરવા  
તે ગ્રહ્યર ગાથાને ભાલાનમોધ ટાઇપમાં છાપી બતાવો છે અને તે  
૮ મી ગાથામાંના ભૂગ 'પર્વ' શબ્દનો 'પર્વી' શબ્દ બનાવી દીઘેલ છે.

(૨૯) તે પાઠની નીચેના અતિમ લખાણમાં ને 'પર્યુષણા  
સંવત્સરી તરીક ચોથને લીધી છે, પરંતુ પાંચમની લગોલગ આવેલી  
પૂર્ણતિથિ તરીક લીધી નથી' એમ શાખના સર્વમાન્ય અર્થથા વિરદ્ધ  
લખ્યું છે, તે લૌકિક ગ્રિપણુમાં નથારે ભા. શુ ચતુર્થી એ આવે ત્યારે  
તેઓ તેમના નવા ભત પ્રમાણે ભા. શુ પની જોડે સંવત્સરીની  
ચોથ બતાવવી જ જોઈએ તે બતાવી શકે તેમ નથી, એ મુંઝવણું  
આજથી જ દૂર કરવાના ઉપાયઃપે છે.

(૩૦) પેજ ૧૮ના ડીન પેરામાં—“અહીં વિચારણીય એ છે કે—  
ને પાંચમની લગોલગ આગલો દિવસ એ જ સંવત્સરીની ચોથ ગણ્ણાતી  
હોય તો પંચમીના ક્ષયે એની પૂર્વની ત્રીજ એ પંચમીના આગલો  
દિવસ ગણ્ણાય અને ત્યાં જ ચોથ ભાનાને સંવત્સરી કરવી જોઈતી હતી,  
તેમ તો કર્યું નથી, અને તેમ થઈ શકે પણ નહિ કેમકે-ત્રીજ એ  
પંચમીનિથિથી દૂર પડે છે” એ પ્રમાણે લખ્યું છે, તે ધરાદાપૂર્વક  
ઓહ ગણ્ણાતી રજૂ કરીને ભાગક લખ્યું છે. (૧) તેઓના સમર્સત

વડીલોએ અને સં. ૧૬૮૨ સુધી તો આ સમરત નવા વર્ગે પણ પંચમીની લગોલગના આગલા દિવસને જ ચોથ ગળેલ છે પછી ‘ચોથ ગળાતી હોય તો’ એવા ભામક શખદોને અવકાશ જ કર્યાં છે ? ‘(૨) પંચમીના ક્ષયે એની પૂર્વની ત્રોજ’ એમ લખ્યું તે પણ ભામક છે; કારણું કે-પંચમીના ક્ષયે ‘ચતુર્થીની પૂર્વની ત્રોજ’ એમ સીધું લખ્યું છાડીને ‘એની (પંચમીની) પૂર્વની ત્રોજ’ એમ ઉધું લખ્યું છે. (૩) પંચમીનો તો ક્ષય જણાવો છો, પછી તે ક્ષીણું પંચમીની પૂર્વે ત્રોજ કર્યાંથી લાવો છો ? ચોથ લાવો એટલે તે તો પંચમીનો આગલો દિવસ ગણ્યાય જ છે, અને ત્યાં ચોથ ડાણે નથી માની ? સવાલ જ તે ચોથને સ્થાને તે ક્ષીણ પંચમીને ક્ષયે પૂર્વાં વાળા અપવાદસ્તુત્રથી સંસ્કાર આપોને ઉદ્ઘાત પંચમી તરીકે બીજી રાખવાનો છે કે જે સંસ્કાર તે પંચમી સિવાયની બીજી અધી જ પાંચમના ક્ષય વખતે સં. ૧૬૮૨ સુધી તમારા પંચાગોમાં પણ તમે આપેલ જ છે. એટલે જ ચોથ પાંચમનું તે જોડીયું પર્વ, ત્રોજ ચોથ ઉદ્ઘાત બને અને ચોથે પાંચમ ઉદ્ઘાત બની જવાપૂર્વક બેલું રહે છે. અને તો જ ‘ઉદ્ઘંમિ જા તિહીં’ નો ઉત્સર્ગમાર્ગ ક્ષીણુપર્વ પ્રલગે પણ સચ્યાય છે: સં. ૧૬૮૨ થી નવો મત કાઢવા જતાં એ સંસ્કાર આપવાનું તમે ખીટીએ મૂક્યું એટલે તેના લાલમાં તમે કેદલું ગુમાવ્યું ? જીએ : “ ભા. શુ. ૪-મનું આ જોડીયું પર્વ તમારે નૃટ્યું, પાંચમ પર્વ તો સમૃણાં ગુમાવ્યું ! શ્રી હિરસ્સરિલ મહારાજે જણાવેલ ‘ યેન શુક્રપંચમ્યુચરિતા ભવતિ તેન મુખ્યવૃત્ત્યા તૃતીયાતોઽષ્માં કાર્યઃ ’ એ પાઠ અનુસાર પંચમીનું આરાધન કરનાસે ત્રોજથી અદુમ કરવાની અશક્તિ વસાની, પૂ. હીરસ્સ. મ. શ્રીના તે ચોક્ખા રાખ્યા પાઠને પણ અવગણ્યવાનું પાપ વહેરાખું ફડ્યું, ૧૬૫૨ના જેઠ શુદ્ધ પાંચમના પ્રતમાંના તમારા મહાન દાદાણુસે પૂ. આત્મા-રામજી મહાસઙ્કે લખાવેલા ( અને અમે તેનો ફડોક પણ બનાવીને ‘શાસનસુધાકર’ તથા ‘સિદ્ધચક્ર’ માં પ્રસિદ્ધ કરેલા )

“ચોથ પાંચમ લેળું ગણુશો. તો ચોથને દહૃતે તો સંવત્સરીની કિયા કરી, પરંતુ પાંચમતિથિની કિયા કરે દહૃતે કરવી?” એ ટંકશાળી શણ્ણો ઉંડું હુસ્તાળ મારવી પડી અને તમારા દાદાગુરુ પૂ આ. શ્રી દાનસુરિલ મ, વિવિધ પ્રશ્નોત્તર બાગ પહેલાના પૃષ્ઠ ૧૦૬ ઉપર ચાદ્ર જણાવે છે કે—“ઓ (મુહુયવૃત્ત્યા તૃતીયાતોऽષ્ટમઃ કાર્ય:) પાડમાં શ્રી જગદ્ગુરુ મહારાજ પંચમીનું જેમ આરાવન થાય તેમજ ઝેરમાન કરે છે! ’ એ વચ્ચેનો ઉપર તો તેલામિશ્રિત ભરીનો ઝૂંક કરી ઝેરવનો પણો! ” ધ્રઘીએ કે-શાસનદેવ તમેને હજુ પણ મૂળમાર્ગ આવી જવાની સતતર સદશુદ્ધિ આપે.

(૩૧) પેજ ૧૮ના પેગ ત્રીજમાં કખ્યું છે કે—“અહીં મહત્ત્વનું વિચારવા જેવું એ છે કે-પર્યુષલું અદ્ભાદ કે જેને શાસ્ત્રે મહાનૃ અદ્ભાદ તરીકે મહત્ત્વ આપ્યું છે, તેનો ગણના લા શુ ૪ નો દ્વિસ પંચાંગમાંથા નિશ્ચિત કરી એની પૂર્વના સાત દ્વિસ લાધને કરવામાં આવે છે. એને પણીનો પાંચમ સાથે નિસ્ખલ નથી. એટલે કદાચ પાંચમના ક્ષ્ય-વૃદ્ધિ આદ્યા તો પણ તે ચોથે સમાપ્ત થઈ જતી અદ્ભાદમાં કાઈ જ ઝેરકાર કરી જીકે નહિ.” એ સદંતર વિચિત્ર એવા શાસ્ત્ર એને પરંપરાની અદ્ભુતી રહિત હૈયાનું માપક છે, કારણ કે-પર્યુષણુની અદ્ભાદ પંચાંગમાંથી લા. શુ. ૪ નો દ્વિસ નક્કી કર્યે નક્કી થધ જાય, એ માન્યતા તેઓની હોય તો તેઓ જાણો. કોઈ શાસ્ત્રકારની તેવા માન્યતા છેજ નહિ. લા. શુ. ૪-૫ એ ૧૪-૧૫ આદ્દિનો માદ્દાક જોડીયું પર્વ છે, તેથી તે પાંચમને એને ચોથને પરંપર ગાડ નિસ્ખલ છે માટે પર્યુષણુની અદ્ભાદ નક્કી કરવા સારુ પ્રથમ તો પંચાંગમાંથી લા. શુ. પાંચમ જ નક્કો કરવી રહે છે: ઓ અવિનિષ્ઠન પરંપરાજન્ય સત્યસ્થિતિ છે. છતાં તમે હવે ચેમ બોલો છો કે—‘પાંચમ સાથે તેને નિસ્ખલ નથી’ એનો અર્થ ખુલ્લો છે કે-ઓ. શુ. પાંચમની તમને પર્વ તરીકે પણ કિ મત રહી નથી. વળી પંચાંગમાંથી ચોથ નક્કી કરો તો પણ ચેથે તમે તેની પહેલાંના સાત દ્વિસ લઈ લેવા માત્રથી અદ્ભાદ

ક્ષયાં માની લો તેમ છે? વચ્ચમાં આવણું વદ ૦))નો ક્ષય આવે ત્યારે તમે તે ચોથ પહેલાના ૭ દિવસ લઈને અદ્ધાર્દ કેવી રીતે કર્નાના? સં. ૧૯૬૦ માં બા. શુ. ૪ નો ક્ષય આવેલ હતે, તે વખતે તો તમે બા. શુ. ૩ નો ક્ષય કરી તેના સાથે ચોથ ઉદ્ઘટ બતાવવાપૂર્વક તે ક્ષયે પૂર્વાંથી સરકાર આપીને જનાવેલી બા. શુ. ૪ ની પહેલાના ૭ દિવસ લઈને પર્યુષણુંની અદ્ધાર્દ કરી હતી; (જુઓ નૈત પ્રવચન વર્ષ ૬, અંક ૧૨-૧૩-૧૪ આ. વ. ૬ તા ૨-૬-૩૪ નો અંક ૫૪ ૧૭૭.) પરંતુ હવે પછીથી જન્યારે પંચાંગમાં લા. શુ. ૪ નો ક્ષય આવણે ત્યારે તમે તે સંવત્સરીની ચોથને ય તે તમે પ્રથમ કર્યું છે તે પ્રમાણે પણ આખી કરાંથી નકી કરી શકવાના? અને એમ ચોથ જ નકી નહિ થાય એટસે તેની પહેલાના સાત દિવસ લઈને અદ્ધાર્દ પણ રહી રીતે નકી કરી શકવાના? ધૃત્યાદિ અનેક પ્રકારે જે લખાણ એના લેખકને જ આપત્તિજ્ઞન્ય છે, તેવા ધૂમાડાના બાયકા સમાં તે લખાણને અવલંખીને કરેલાં તે પેજ ૧૮ ના પેરા ખીજાથી લઈને પેજ ૨૨ના ખીજ પેના પર્યાતનાં લખાણને સમાજે શાસ્ત્ર અને પરંપરાના ધ્વંસક વિચારોઝે આના લેનું રહે છે; કારણું કે-તેમાં શાસ્ત્ર અને પરંપરાને ઉડાડીને સ્વમતસ્થાપનરસિકતા ભરી છે.

(૩૨) પેજ ૨૪ના પેરા ખીજામાં લેખકે પોતાના નવામતની પુષ્ટિમાં-સિદ્ધયક વર્ષ ૪, અંક ૪, પૃ. ૬૪માનું ૭૭૬માં પ્રશ્નાનું જે “ન્યોતિષ્કરંડક, સ્રૂત્પ્રતિપ્તિ અને લોકપ્રકાશ આદ્ધિને જાણુનારો મનુષ્ય × × × × ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા એવો શ્રી ઉમાસ્વાતિનો પ્રધ્યાપ હોત નહિં:” પર્યાતનું સમાધાન રળ્યું કર્યું છે, તે તે સમાધાનની જોડેનું “માટે ન્યોતિષ્ના હિસાબ પ્રમાણે પર્યાતિથિનો ક્ષય ન જ હોય એમ કહેવાય નહિ, પરંતુ આરાધના કરવા માટે નિયત થાયેલ ખીજ આદિ તિથિઓનો ક્ષય હોય તો આરાધના કરનારાઓએ તે તે આરાધનાથાયક ખીજ આદ્ધિનો બોગવટો પોતાના પહેલાની એકમ આદિ તિથિમાં થતો હોવાથી એકમ આદિ તિથિને દિવસે ખીજ

આહિ પર્વનિથિનું આરાધનાકાર્યે કરાય માટે આરાધનાની અપેક્ષાએ પર્વતિથિનો ક્ષય ન હોય એમ કહેવું વાજખી ગણી શકાય, તે તેથી જ આરાધનાની અપેક્ષાએ ભાંતીયાં પંચાંગો છ્યાવનારા મૂળ દીપખુમાં પર્વતિથિનો ક્ષય હોય તો તેને સ્થાને પૂર્વની તિથિનો ક્ષય કરી પર્વની તિથિએને અખંડિત રાખે છે.” એટલું ઘણું સિદ્ધયક્તમાંતું લખાણ છોડી દેવાનું પાપ કરીને રજૂ કર્યું છે. તેઓએ આ છોડી દીખલાં લખાણું તેણે રજૂ કરેલ લખાણું સાથે જોખા બાદ તે આપું સમાધાન છે કે-જે આપું સમાવાન તેમના નવામતને સાઝે જૂડો અતાવે છે. પોતાના સર્વદ્વિક્રિ અસત્ય ડરેલા મતને સાચો લેખાવવા સારુ જેઓ સામા પક્ષના માસિક લખાણું પણ આ રીતે છુટ્યોક કાપી નાખવાની છિંમત ધરાવે છે અને તે લખાણુમાંના ખંડન અથે, રજૂ થયેલા ફાવટ પૂરતા ઉઠાવી લાખેલા લખાણું પોતાના મતની પુષ્ટિમાં ધુસાડી હેતા શરમાતા નથી, તેઓ જિનેશ્વરજીગમવંતના શાસનના રસિક શી રીતે માની શકાય? [ આ સમાવાન-આલી જ રીતે શ્રી જંખૂસ્તુરિએ તેમની તિથિસાહિત્યદર્શિણ નામની ખૂફમાં કાપીને રજૂ કરેલ છે, અને શ્રી પુષ્પવિંના શિષ્ય (નવામતિ) અમૃતસ્તુરિએ ‘તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્વપૃથીકરણું’ નામની તાજેતરમાં (તેમની ગ્રંથમાલાના નં. ૩૨ તરીકે) બહાર પાડેલ દ ફોર્મ પ્રમાણુની અસત્ય પ્રલાપમય ચોષડીના પેજ ૩૪ ઉપર પણ સ્વીકારીને પોતાનાં મહાત્માને ખીંટીએ મૂકવાનું પાપ કર્યું છે! આવા છે એ આગમપ્રરા અને સુવિહિતશરીરોમણૂં.] પોતાના મતને કોઈ શાસ્ત્રનો કે પરંપરાનો અધ્યાપિ પર્યાત એકાદ પણ ટેકો મજ્યો નથી અને કાઢ્યો છે તે મત કોઈ વાતેય મૂકી શકતો નથી; તેની જ આ બધી પ્રઘંચલીલા છે. આ તો શું છે? પણ લેદી ચીછીએ લખીને લવાદને પણ ફાડી શાસનની અવિચિન્ન પરંપરાનેજ ઉધ્યાલાવીં નાખેવા સુધીના પણ એ મત ખાતર તેઓને ધોર અપકૃત્યો કરવાં પણાં છે! એ જેતાં તેઓ પ્રતિ કાને અનુકંપા ન થવા પામે? આવા ધૈરાતિધીર પાપોનો

અવાતરમાં અંનભ શું ? એટલું હજુ પણ એ વર્ગ વિચારવા કૃપા કરે એમ છબ્બીએ છીએ,

(૩૩) તે પેજ ઉપરના પેગ ત્રીજના “સિક્ષયક વર્ષ ૪, અંક ૪, પૃ. ૮૭ માં તેઓ ક્ષય થતાં પૂર્વનિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણું, એ મથાળા નીચે લખે છે કે—‘અને આ જ કાણુથી ખીજ, પાંચમ વગેરે પર્વતિથિયાનો ક્ષય હોય છે, ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે. કેમકે તે તે પર્વતિથિનો લોગવટો તે તે આગવી સૂર્ય ઉદ્ઘયવાળી તિથિની પહેલાં થઈ ગયો છે.’” ત્યાં સુધીનાં લખાણ પછીથી તેમણે જે × × × આ પ્રમાણે ચોકડીએ દર્શાવી છે તે, તે પછીનું લખાણ પણ જે પોતે છાપી બતાવે તો તેમનો ભત ખોટા ભનાવે તેમ છે, મારે તે પછીનું ‘અને સ્ફોર્યુદ્ઘયવાલી તે તે પર્વતિથિ ન ભળે તો તેની આગવી તિથિની પહેલી તિથિએ તે તે પર્વતિથિનો લોગવટો હોવથી તે તે પર્વતિથિની આરાધના થાય છે. કેમકે—જેમાં જે ન હોય તેમાં તેનો સમાવેશ કરવો એ હિતકર છે ! એટલું તે સિક્ષયકના અંકમાંનું લખાણ તેમણે તે ચોકડીએનાં સ્થળોથી કાપી નાખ્યું છે, અને તે કાપી નાખેલ લખાણ પછીનું ‘પણ ત્રીજ, ૪૬, નોમ વગેરે × × × અને કલ્પનામાત્ર જ છે.’ એ લખાણ (પ્રથમનાં લખાણ સાચે સંગત લેખાવવા તરફિ) જોડી દેવાનો પ્રપંચ કરેલ છે. તે રથળે સિક્ષયકમાં એ પછીનું પણ નવ પંક્તિપ્રમાણ લખાણ છે, છતાં તે લખાણ પણ પોતાના ભતને જૂડો ડરાવતું હોવાથી એમણે અહિં લીધું નથી=છોડી દીધું છે. વિશેષમાં આ ધાલમેલ કાઈની જાણમાં ન આવે એ કાર તે સ્થળને ખોટી રીતે જ પૃ. ૮૭ તરફિ જણાવવામાં આવેલ છે ! સિક્ષયક વર્ષ ૪, અંક ૪ ના પૃ. ૮૭ ઉપર તે લખાણ જ નથી ! વાયકવર્યોએ સિક્ષયકમાં તે પેજ જોઇ લેવા વિસ્તૃતિ છે.

(૩૪) પેજ ૨૪ની અંતિમ એ પંક્તિથી માંડી પેજ ૨૫ ઉપરની સૂત પંક્તિ સુધીમાં-સિક્ષયક વર્ષ ૫, અંક ૧, પૃ. ૫ ઉપરના જે ગ્રન્થ

અને સમાધાન પ્રસિદ્ધ કરેલ છે, તે સ્થાનાંગસૂત્ર, સૂર્યપ્રતાપિત, જન્મોતિષ્ઠ-કરંડક આદિ નૈતેન શાસ્ત્ર પ્રમાણે (નહિં કે આરાધનામાં) પર્વતિધિ-ઓનો ક્ષય હોય એમ જણાવે છે, છતાં તે લખાણ પછી તે પ્રથ્મ અને સમાધાનના ઓાડે તેમણે ત્યાં ત્રીજી પેરામાં કે 'હવે આજ મહાપુરુષ નિધિયચોમાં પદ્ધા પંચી એમ કહે કે-'નૈતેનમત પ્રમાણે પર્વતિધિની ક્ષયવૃદ્ધિ મનાય જ નહિં' તો તટસ્થ વક્તિઓએ શાનો સ્વીકાર કરવો ? એમના પૂર્વ પ્રથ્મોત્તરોનો કે પ.જગના લખાણનો ?" એવું કાપદ્યપૂર્ણ આલેખન કરીને પૂ. સાગરજી મ.ને બેઠી રીતે જ કેંતું કેંતું બોલનાર તરીકે દેખાડુવાની હિંમત કરે છે, તે અદ્ભુત તેને શું કહીએ ? આમને કોઈ પૂછો તો ખરા કે શ્રી સાગરજીમહારાજ, નૈતેનમત પ્રમાણે પર્વતિધિની ક્ષયવૃદ્ધિ મનાય જ નહિં એમ કહે છે, કે-'આરાધનામાં પર્વતિધિની ક્ષયવૃદ્ધિ મનાય જ નહિં' એમ કહે છે ? શા માટે તેઓશીનાં નામે આવા માયામૃખપૂર્ણ લખાણો કર્યે રાખીને લારી થતા હરો ! પૂજ્ય સાગરજી મહારાજે 'નૈતેનમત પ્રમાણે પર્વતિધિની ક્ષયવૃદ્ધિ થાય નહિં' એવું કોઈ સ્થળે જણાવ્યું છે ? જણાવ્યું હોય તો બતાવો. નહિં તો જૂઠથી વિરમો.

(૩૫) પેજ ૨૫ના ત્રીજી પેરામાં જણાવેલ છે તે સં. ૧૯૬૨નો નૈતેનપ્રકાશના વૈરાખ્યના અંકમાં છ્યાએલ શ્રી આત્મારામજી મ.ની જન્મશતાબ્દીની ઉજવણીનો હેવાલ તમારી જેવા કોઈએ લખી મોકલ્યો હોય તે પ્રમાણે છપાયો, તેથામાત્રથી ત્યાં તમારી ૧-૨ લેણાંની માન્યતા માનનાર છે કોણું ? આગળ જતાં સદ્ગલાંગ્યે હેયાંમાં છે તે હુઠે આવી જવાથી જ લખાઈ જવા પામ્યું છે કે-' શાસ્ત્રકારોએ પર્વતિધિ આરાવનાતું કણું છે, નહિં કે બાર દિવસ અને પંચાંગમાં ૧૪-૧૫ લેણાં આવે, ત્યાં તિથિ તો જને હાજર છે જ. છતાં કહેવું કે-' ના, એમાં તો એક પર્વદિવસ ઓછા છુટ ગયો. પર્વતિધિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિં.' એ કથન તિથિ અને દિવસનો શું શાંખુંગેળો નથી કરતું ?

તાત્પર્ય એ છે કે—મતનો મૂળ પાયો જ એણો છે: એટલે  
 તેના પરં બાંધેલી ઈમારત પણ એટી ક હોય એ સ્વાભાવિક  
 છે.” વાચક અહોક્ષય ! જુએ જુએ—બરાબર આંખ જોડીને અને  
 ચિત્ત ચોડીને નવા તિથિમતની અખંકર જાહીમતસનું અદ્દિન નકર દર્શને  
 કરી લો: કે જેથી તેણેને હવેથી ભૂવથી પણ શાસ્ત્રપ્રિય માનવાની  
 જરાય ખૂલ ન થવા પામે. નવામતીએ આપણને તેમની શ્રદ્ધાજ્ઞાતાનું  
 અહિ બરાબર ભાન કરાવે છે ! ઉપરના લખાણું તેણો આપણને  
 સ્પષ્ટ કર્યાવે છે કે—‘તમે બધા ભીજ, પાંચમ, આઠમ, અગ્રીઆરશ,  
 ચૌદશ, પૂનમ અને અમાસ પર્વતિથીએને આણો દિવસ આરાધ્યો છો,  
 તે ખોડું છે કેઅ પણ પર્વતિથી આણો દિવસ આરાધ્યવાની નથી;  
 ફરંતુ લોકિકીપણામાં પર્વતિથીએ જેટલી ઘડી હોય તેટલી ઘડીજ  
 આરાધ્યવાની છે ! એટલે કે ગીપણુંની સાતમના દિવસે ૪૦ ઘડી સાતમ  
 ગણા બાં આઠમ જેસતી હોય તો ત્યારથી જે આઠમ આરાધ્યવાની છે  
 અને તે આઠમના સુરોદય પછી તે આઠમ પચ્ચીશ ઘડી બાં મૂર્જ  
 થઈ જતી હોય તો ત્યાંજ તે આઠમની આરાધના પૂર્ણ ગણવાની  
 છે. એ રીતે પર્વનું આરાધન કરો. એટલે પંચાંગમાં ૧૪-૧૫ લેણાં  
 આવે ત્યાં તેરશને દિવસે જ્યારથી ચૌદશ શરૂ થઈ જતી ત્યારથી  
 માંડીને ચૌદશના સુરોદય પછી જેટલી ઘડી ચૌદશ હોય ત્યાં સુધી  
 ચૌદશ આરાધ્યી. અને (પછી પૂનમ ભણી) તેનો પૌષ્ય પારવો,  
 ઉપવાસસનું પારણું કરવું એ ખણું ત્યાંજ કરી લેવું અને તે ચૌદશના  
 દિવસ તે ચૌદશની ઘડીએ પછી શરૂ થતી પૂનમની જેટલી ઘડીએ  
 હોય તેટલી ઘડીએ પ્રમાણ પૂનમ આરાધવી ! એકેક પર્વતિથી એકેક  
 દિવસે આરાધ્યવાની નથી. બારપર્વિએના આરાધન જાહે ભાર દિવસ  
 જેનાનાજ નથી, પછી એકું પર્વહિદિવસ એકું યદ્દું જાણાની વાતને  
 સ્થાનજ ઉધો છે ? તિથિ અને દિવસનો શંખુમેળો કરવામો નથી,  
 છતાં તમે પર્વ અને દિવસનો શંખુમેળો કરતા આવ્યા છો, માટે તમારા  
 મતનો મૂળ પાયો જ એણો છો, એટલે તેના પર બાંધેલી ઉદ્યંમિ

જા તિહોં, નિધિશ્ર પ્રાતઃ પ્રત્યાહ્યાનબેલાયાંં, ક્ષયે પૂર્વાં, અતઃ પૂર્ણિમાતો દિનગજને તેણાં પંચાશાદેવ બોધ્યભૂ, પ્રાયે ચુરગતિ સાથે પર્વને દિવસે રૈ, અ.૬ દિવસની જ અફાઈ ગણની, ઓમરત્ત ત્ત અવમા હીના રાત્રિગવમરાત્રો દિનક્ષયઃ, ઈત્યાદિ ધ્રમારત પણ ખોડીજ હોય એ સ્વાભાવિક છે." હવે આ મનને પણ જૈત્રમત કેખવાને ઢાણ જૈત્ર માને?

## શાસનરસિક પૂજયવર્યેને વિનંતિ

આવી ભાન્યતાના સ્વામી, એ આપણા નવામતી અં. આ વિજ્ઞયરામચંદ્રસૂરીધીરજી ભગવંત (?) છે કે-જે મને અજ્ઞાન અને સ્વાર્થપદ્ધુ એવા ઘણા જનોએ પરમભક્તપણાનો અણુનમ દાવો ધરાવાને "પરમ શાસનપ્રભાવક, અન્નેડવાહિવિજેતા, પ્રભર વ્યાખ્યાતા, ઉદ્ધવિહારી, અન્નેડ ચારિત્રી ધત્યાદિ વિવિધ વિશેપણોનું વર્ષે સુધી જિરદાય્યા આદ આજે ઉપેક્ષાની આરડીમાં પદ્ધરાવેલ છે. તેઓઓ આવના વર્ષે પોતાની આ પ્રકારની વાસ્તવિક ભાન્યતાવણા નિધિમતને જાહેર રીતે ય સાચ્યા ઠરાવી બતાવવા માટેનું આપણને આ જાતનું છેદલું પરાક્રમ બતાવવા સારુ અમદ્વારાં પંચારવાના છે, અને ગામ ગાંદું કરવાના છે એ અવસરે આવી અજૈની ભાન્યતા વનવતા તેઓઓ જેઠે પ્રકુશાસનના અતુરાગી પૂ ચાચ્યાર્થભગવંતો આદિમાંના કોઈજ પૂજય શાસનરસિક મુનિવરોએ ચર્ચાનો પ્રસંગ તો પાડવાનો રહેતોજ નથો, પરંતુ 'હાણ્ણાતણો' જે સંગ ન તબેં એ ઉક્તિ અતુસાર તેઓઓનો સામાન્ય સંસ્કર્ણ પણ કરવો રહેતો નથો, એમ અમારું આ સહુ પૂજયવર્યેને વિનંતીપૂર્વીકરું આજુથી જ જહેર ભંતબ્ય છે.

(૩૬) પેજ ૨૬ ઉપર તો પોતાની મળીનવૃત્તિનું પ્રદર્શન ભર્યું છે! પૂ. આ. મ શ્રી સાગરાનંદસૂરીધીરજી મ ના ગુરુવર્ષું શ્રી જેરસાગરજી

મ. શ્રીના “ ડોઈ ગંગામે મતમે દરશનમેં સાંખ્યમેં નહિ હૈ કી શુદ્ધારી નિષ્ઠા વહબેં ને વદ્ધી તિથિ શુદ્ધમેં હાનિવૃદ્ધિ કરણી. કિંબદુના આત્માર્થી-ઓંકો તો હઠ છોડ કર શાસ્ત્રોક્તા ધર્મકરણી કરકે આરાધક હોણા ચાહીએ.” એ રાણ્ણો છાપીને ‘પૂ. જવેરસા. મ.ના તે સખ્યો પ્રમાણે પૂ. સાગરજી મ અને તેમના શિષ્યોની વર્તતા નથી’ એ પ્રકારે અદ્વિકળનોમાં તેઓ પ્રતિ નિઃશ્વકતા ફેલાવવાની વદ્ધતિથી પૂ. જવેરસા. મ. શ્રીના તે શાખદોના નાચે તે સખ્યોને અનુલક્ષ્ણિને તેઓ લખે છે કે— “પરંતુ કાળની અજય લીલા છે કે અને તેમનાની શિષ્ય અને પ્રશિષ્યો પણ તેમણી એ ગંભીર પવિત્ર વાણીને મહત્વ આપતા નથી. પણી આ પરિસ્થિતિમાં શ્રી સંધમાં પર્વતિથિના આરાધન અંગે આરે અભ્યવસ્થા ઉત્પન્ન થાય એમાં નવાદ શી ? ”

આ પ્રકારનું સદંતર નિરાંતર અસત્ય, આપણી લોકોત્તર સમાજમાં જેઓ આને નિર્જયપણે વદી શકે છે, એ જેતો તેઓ હવે જૈન સમાજમાંના પોતાની સિરાયના બીજા બંધાયને મૂર્ખાંનું મંડળ માનવા જેવા ઘેલાન બની ગયા જણ્ણાય છે. ! તે વર્ગમાં જો ડોઈ ભાગ્યસ્થ હોય તો તેઓના તે લખાણનો તેઓ જવાબ આપે કે— “પૂ. જવેરસા. મ. શ્રીના ‘શુદ્ધારી તિથિની વદમાં અને વદની તિથિની શુદ્ધમાં હાનિવૃદ્ધિ કરણી, એ ડોઈ ગંગામાં-મતમાં-દર્દનમાં અને શાસ્ત્રમાં નથી’ તે ઉપરે કા વચ્ચેને પૂ. સાગરજી મહારાજ અને તેના શિષ્યો મહત્વ આપતા નથી, એમ રા આધારે લખાયું છે ? શું પૂ. સાગરજી મ. અને તેના શિષ્યો, શુદ્ધારી તિથિની વદમાં અને વદની તિથિની શુદ્ધમાં હાનિવૃદ્ધિ કરે છે ? જો નહિં જ, તો તેઓ ‘કાળની અજય લીલા છે કે તેમનાની શિષ્ય પ્રશિષ્યો પણ તેમણી એ ગંભીર અને પવિત્ર વાણીને મહત્વ આપતા નથી.’ એ કંઈ શુલ વૃત્તિથી લખે છે ? આ પ્રકારે સદંતર અસત્ય વસ્તુઓ જેલી કરીને બીજોઓ ઉપર જૂડી આળ મૂકુનારાઓમાં તમે મહાવતો ક્યા અવગુણની ખાખીને લીધે માની શકો છો ? કે-જેથી આજું પ્રકારની મહીનાનૃત્તિપૂર્વકા આવા સદંતર જૂહ પ્રચારમાં પણ

શાસનસેવા હેઠળ રહ્યા છો ? ” જવાબ આપશો કે-જેથા ‘તમારી આ પરિસ્થિતિમાં જ શ્રીસંધમાં પર્વતિથિનાં આરાવન અંગે લારે અભ્યવરથા ઉત્પત્ત થવા પામી છે’ એમ કોઈને માનવું રહે નહિ.

(૩૭) પેજ ૨૬ ઉપર તે પણી લખે છે કે—“મારા સાહેબો ! પુનમના ક્ષયે તેરશનો ક્ષય, પંચમીના ક્ષયે ત્રીજનો ક્ષય, એ પૂનમ હોય તો એ તેરથા, એ પંચમી હોય તો એ ત્રીજ વગેરે કરતાં (કરો છો તેમાં) ‘સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણુ કરવી’ એ સિદ્ધાંતનું પાલન થાય છે અઝિં ?, તેના જવાબમાં આ સાહેબાઓને પ્રશ્ન છે કે—‘ઉદ્યાંમિ જા તિહી સા પમાણં=સૂર્યોદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ’ એ સિદ્ધાંત ટિપ્પણુમાં આવેકી ઉદ્ઘાત પર્વતિથિને માટે છે કે-ટિપ્પણુમાંની ક્ષીણ પર્વતિથિને માટે પણ તે ઉત્સર્ગમાર્ગ છે, એમ કહેવા લાગ્યા છો તો ટીપ્પણુમાં ઉદ્ઘયતિથિ ચૌદશનો ક્ષય આવે ત્યારે તેની પૂર્વે ઉદ્ઘયતિથિ તો તેરશ છે, ચૌદશ તો ઉદ્ઘયતિથિ નથી જાઃ તથી ત્યાં તમો તો ચૌદશ માનતા જ નથી ને ? આજે તો તેવા પ્રસરે તમે પણ તે તેરશે ચૌદશ માનો જ છો, તેનું કેમ ? ત્યાં સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણુ કરવા’ એ સિદ્ધાંતનું પાલન તમારે થાય છે અઝિં ? જે નહિં, તો તે દોષથી બચવા સાર્થ આઠમ-ચૌદશ આદિ પર્વતિથિના ક્ષયવૃદ્ધિ વખતે તમે તે ઉદ્યાંમિના સિદ્ધાંતનું પાલન કરી બતાવીને દાખલો કુયારે ઐસાડવા માગો છો ? જે કે-તમે તો હવેથી ‘પર્વતિથિ જેટલી ધડીની હોય તેટલી જ તેને આરાધવા’ એ માન્યતાવાળા તરીકે ખુલ્લા થયા છો, છ્ટાં એ માન્યતાને બરાબર પગભર ન કરી શકો ત્યાં સુધીમાં તો એ ‘સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણુ માનવી’ એ સિદ્ધાંતનું પાલન કરી બતાવીને તમારે ઉત્તાવળે દાખલો ઐસાડવો જ ધરે છે. ઐસાડશા ને ?

(૩૮) પેજ ૨૭ના પેરા ત્રીજનાં લખે છે કે—“પુનમની ક્ષયવૃદ્ધિએ ‘ક્ષયે પૂર્વાંતું’ અપવાદસ્ક્રન પૂનમને લાગુ પડે ને ત્યાં પુનમની ઉદ્ઘ-

તિથિનો આગહ રખાય નહિ, પરંતુ પંચાંગ ચૌદશાંતી ક્ષયવૃદ્ધિ તો અતાવતું નથી, પણ ઉદ્યતિથિ અતાને છે. એમાં ચૌદશ માટે તો ઉત્સર્ગમાર્ગ ઉદ્યતિથિ લેવાનો જ લાગુ પડે પણ અપવાદ નહિ. વાત પણ જ્યાણજ્ઞાની છે કે-પૂનમને જરૂરી અપવાદ પૂનમના ઉત્સર્ગને ગૈણુ કરે પણ ચૌદશના ઉત્સર્ગને કેમ ‘હણે?’ તેઓની આ વાત શાસ્ત્રનિરપેક્ષ અને સફંતર બ્રામક છે-ક્રોલિકલિપત છે-લાદ્રિક આરાધકજનોને ગુંચ-વાડામાં પાપવાની જળદાય છે, તે જળનું શાસ્ત્રીય રૂપણીકરણ આ છે કે-“ક્ષયે પૂર્વાંત એ વિધિવાક્ય છે, અને ‘વૃદ્ધૌ કાર્યાંત’ એ નિયમવાક્ય છે. એ એ વાક્યો તિથિના ભોગ અને સમાપ્તિને માટે નથી, પરંતુ અપર્વતિથિના સૂર્યોદયને પર્વતિથિનો સૂર્યોદય ગણના અને પર્વતવૃદ્ધિ વખતે પહેલા સૂર્યોદયને નહિ ગણના માટે છે. પૂનમના કષ્યે તે ‘ક્ષયે પૂર્વાંત’નું અપવાદસૂત્ર પૂનમને લાગુ ન પડે પણ ચૌદશના સૂર્યોદયને પૂનમનો સૂર્યોદય બનાવવા [ ચૌદશ પંચાંગમાં ઉદ્યાત્ર પર્વતિથિ હોવા છતાં યાવત્સંમબ્રસ્તાવદ્વિધિ: ન્યાયે ] ચૌદશને લાગુ પડે, તેથી (‘ત્યાં પૂનમની ઉદ્યતિથિનો આગહ રખાય નહિ’ એમ લખ્યું છે તે શાસ્ત્ર અને પરંપરાથી [વિરુદ્ધ એવું બ્રામક છે, ) ત્યાં ચૌદશના ઉદ્યતિથિનો આગહ રખાય નહિ. એટલે ક્ષીણ પૂનમને એ ‘ક્ષયે પૂર્વાંત’ વિધિવાક્યવડે સૂર્યોદયયુક્તા બનાવતાં દીપણાંતી ઉદ્યવાળી ચૌદશ જે પર્વતિથિ છે તેનો ક્ષય થવા પામે, અને તે તો શાસ્ત્રકારને ધિષ નથી જ; આથી તેવા પર્વાનાંતર પર્વતા ક્ષયની વખતે તે ‘ક્ષયે પૂર્વાંત’નો વિધિસંકાર તેવા સ્થાને ફરી પણ પ્રવર્તાવવો જ પડે છે. પંચાંગ લદે ઉદ્યતિથિ બતાવતું હોય; પણ ક્ષીણપર્વતને લોડેટાર તિથિ બનાવવા સાડ સંઝા આપવાનો જરૂર પડે ત્યારે તે પંચાંગમાંના ઉદ્યને પલટવો જ રહે. આથી ‘ક્ષયે પૂર્વાંત’ના સંસ્કારવડે એમ ઉદ્યમી પૂનમ નહોતી તેને લોડેટાર ઉદ્યવાળી બનાવી, તેમ તેને પૂનમની સંઝા આપતાં ચૌદશનો ક્ષય થવાની અનિષ્ટસ્થિત પ્રાત્ત થવા પડ્યી, તેથી ફરીથી તે જ ‘ક્ષયે પૂર્વાંત’નો વિધિ પ્રવર્તાવવાની જરૂર

ઓબી રહે જ છે: અને તેથી ફરીથી તે જ વિધિ પ્રવર્તાવીને ચૌદય ઉદ્ઘયમાં નહોતી રહેતી તેને લેકોતર ઉદ્ઘવાળી ચૌદશ બનાવી. પ્રભુશાસનતી આ અવિચિન્હન આચરણા પ્રવર્તમાન જ છે ત્યાં હૌકિકિ-પંચાંગની ગણ્યાતી ઉદ્ઘતિથિ ચૌદશ માટે ઉદ્ઘયંમિ જા તિહી સા પમાણ' ઉત્સર્જમાર્ગ, ( પંચાંગના જ ઉદ્ઘયને સ્વીકરવાઇપે ) લાગુ પડે નહિ, એણુ 'ક્ષયે પૂર્વાંતિ'નો અપવાહમાર્ગ જ લાગુ પડે." તેવા પ્રસંગે તે ચૌદસને ઉત્સર્જમાર્ગ લાગુ પાડવાના ચાળા કરવા જનારને '૧૪-૧૫ જેડીયાં પર્વ તરીકે રહેવા પામે નહિ, મહિનાની ફરજીયાત લેખાતી આરપર્વી અગીયાર પર્વી બની જવા પામે, 'મુખ્યચૃદ્ધ્યા બાક્ષિક-પૂર્ણિમયો: ચતુર્વિધાહારઃ ષષ્ઠ એવ કૃતો યુજ્યતે' એ શ્રી સેનપત્રના વચન અતુસાર ભુખ્યવૃત્તિએ ૧૪-૧૫નો છુટજ કરવાનો છે તે બનવા પામે નહિ, શ્રી હીરસૂરિલ મના પૂર્ણિમાયાં ચ ત્રૂટિતાયાં ત્રયોદશી-ચતુર્દશ્યો: કિયતે પાડના આભોગપૂર્વક અપલાપના બાગ્ય અને શાસ્ત્રકારે અષ્ટમી-અતુર્દશી-પૂર્ણિમા અને અમાવાસ્યાને જે અતુર્પર્વી જણાવેલ છે તે તોડી નિખરી બનાવી દેવાના પાપના બાગ્ય થયું પડે' જે સ્થિતિના ભાજન નવીનોને અનતું એણુ પર્યું છે; માટે તેવા પ્રસંગે પંચાંગની ઉદ્ઘવાળી ચૌદશને પૂર્ણ હીરસૂ. મ.ના. ત્રયોદશીચતુર્દશ્યો: પાઠ તેમજ અવિચિન્હન પરંપરાના આધારપૂર્વક તે ઉત્સર્જ માર્ગ લાગુ પડાતો જ નથી. આ વસ્તુ જાણવા છતાં તે પોતાની શાસ્ત્ર અને પરંપરાથી નિરખેનું એવી સંદર્ભ કપોલકલ્પિત વાતને પોતે જ વ્યાજભી કંહવાઇપે છે. આપીને આગળ ગોળો ગંડાવે છે કે-'વાત પણ વ્યાજભી છે કે-પૂનમને જરૂરી અપવાહ પૂનમના ઉત્સર્જને ગૌણુ કરે પણ ચૌદશના ઉત્સર્જને કેમ છે?' એ તો ઉધાડા ઉત્સર્જનું પ્રદર્શન છે. પૂનમને જરૂરી એ 'ક્ષયે પૂર્વાંતિ' અપવાહે, ઉદ્ઘયમાં પૂનમજ નહોતી, ત્યારે તે પૂનમ બનાવી છે, આ સ્થિતિમાં જે ઉદ્ઘયમાં જ નહોતી તે ક્ષયે પૂનમનો 'ઉદ્ઘયંમિ' એ ઉત્સર્જ કેવી રીતે ગણ્યાવે છે? જ્યાં પૂનમનો તે ઉત્સર્જ જ નથી લેખાતો ત્વાં 'પૂનમના ઉત્સર્જને ગૌણુ કરે' એમ કહેવું

તે કેટનું બધું વાદ્યાત ગણાય ? તે પ્રકારે તે વાતજ વાદ્યાત હોવાથી પંચાંગની ઓદ્યિકી ચૌદ્ધશના ‘ઉદ્યાનિ’ ઉત્સર્ગને ‘ક્ષે  
પૂર્વી૦’ અપવાદ હણેજ હણેઃ એમાં નવીન શું દીહું ? પૂ આત્મા-  
રામજ મ., ઉ. શ્રી વીરવિજયજ મ., આ શ્રી દાનસુરિજ મ. અને  
સં. ૧૯૬૨ સુંધી તો તમો પણ તેવા પ્રસંગે ચૌદ્ધશના તે ઉત્સર્ગને  
હણુતાજ હતા કે ? અને તેમ કરવામાંજ તમો સહુએ પોતાનુ શાસ્ત્ર  
અને પરંપરાનુસારીપણું માનતા હતા કે ? તો હવે તે સ્વયં પણ વણે  
સુંધી આયનેલું શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું કયા કહીન કર્મના ઉંગે  
નિપરીત ભાસવા લાગ્યું ? વિચારશો.

(૩૬) પેજ ૨૭ના ચોથા પેરામાં લખ્યું કે—“વળી જ્યોતિષ-  
શાસ્ત્રના જાણુનારાએ ‘પુનમના ક્ષેત્રે તેરસનો ક્ષય’ વગેરે આપણા  
સિદ્ધાતો સાંકળીને આપણી મસ્કરી કરે છે અને ખુલ્લાખુલ્લા જણાવે  
છે કે-તમારા કહેવા કે માનવા માત્રથી આકાશના અહેનો યોગ થોડાજ  
ક્રી જવાનો છે ? ” એ પણ પોતાનું ગાઢ અભિનિવેશિકાંતિથત પ્રલભન  
છે. જ્યોતિષ શાસ્ત્રના જાણુનારાએ અ.પણા તે ‘પુનમના ક્ષેત્રે તેરસનો  
ક્ષય’ વગેરે સિદ્ધાતો સાંકળીને મસ્કરી કરતા નથી, પરંતુ અનુકરણ  
કરે છેઃ જુએ, સં. ૨૦૦૦ના ચંદાશુ. માં મહા વદ ૦)) નો ક્ષય આપેલ  
છે ત્યારે તેઓએ તેમનો મહા વદ ૧૪ ની મહા શિવરાત્રી, ઉદ્ઘાત  
મહા વદ ૧૩ ને મંગળનરે લખીને ઉદ્ઘાત મહા વદ ૧૪ ને ખુંખવારના  
દિવસે મહા વદ ૦)) લખી બતાવી છે, માટે આપણા સિદ્ધાતોના  
મસ્કરી તો સંકત ૧૯૬૩થી આ નવીનપંથીઓએજ એશરમ થઈને  
કરવા માંડી છે, જ્યોતિષાઓએ નહિઃ અને તેથી આરાધના વિષયમાં  
'તમારા કહેવા માત્રથી આકાશના અહેનો યોગ થોડાજ ક્રી જવાનો  
છે ? ' એન તેઓ તો કોઈ ઓલતાજ નથી, પણ તમેજ તેવું ઉચ્ચિષ્ઠ  
ઓલવાનાં ગાંડાં કાઢવા લાગ્યા છો. આરાધકોએ આકાશના અહેને  
આરાધવાના નથી, પરંતુ શાસ્ત્રે મુકરર કરી આપેલી પર્વતિથિ  
આરાધવા છે, માટે આવું લખવામાં એ નવો મત તેઓનેજ પર્વતિથિ

ઓવડાવીને અહેને આરાધવા ગ્રેતો હોવાથી તેઓએ હવે આવું શાસ્ત્ર-  
ભાષ્ય પ્રલભન કરીનેજ જીવનું રહે છે, તે વાત ખુલ્ખી થવા સિવાય  
અન્ય કોઈજ તત્ત્વ નથી.

(૪૦) ચેજ ર૮ના બીજ પેરામાં “(ક્ષયે પૂર્વા) સૂતમાં ‘પૂર્વ-  
તિથિ કરવી’ એમ કહ્યું છે, પણ ‘અપર્વતિથિનો ક્ષય કરવો’ એમ કહ્યું  
નથી.” એમ લખીને પોતાનું નિરક્ષરભટ્ટારકપણું સ્થયને છે. પર્વતિથિના  
ક્ષયે પૂર્વ અપર્વતિથિ તો પંચાગદારે કરેલી પડીજ છે, જ્ઞાન સૂતકાર  
‘પૂર્વતિથિ કરવી’ એમ કહે છે, ત્યારે પણ તેઓને વિચાર નથી  
સૂત્રતો કે—‘એ પ્રદોષવર્ષે શાસ્ત્રકાર ભગવંત ‘પૂર્વની તે ઉદ્ઘાત અપર્વ-  
તિથિને પર્વતિથિ કરવી’ એમ વિધિ બતાવે છે’ એ આશ્ર્ય છે. એવાં  
સ્વની નિરક્ષર સ્થિતિમાં તેઓ માટે શ્રેયસ્કર એ છે કે—તેઓએ શાસ્ત્રોના  
યદ્વાતકા અર્થો કરતા અટકી જવું. તેમની તે પંક્તિની જ્ઞાન પ્રમાણે  
અજ્ઞાનતા જ્ઞાલમાં આવ્યા પઢી સુર સમજ શકે તેમ છે કે—તે રથળે  
તે પંક્તિને અવલંભીને આગળ જતાં તેમણે જે “આવો કલિપત અર્થ  
કરનારાઓને સહેજે પૂર્વવાનું મન થાય છે x x x x કાર્યા એવું  
સ્વીળિંગ કૃદન્ત ન મૂકૃતાં કાર્યઃ એવું ખુલ્ખિંગ કૃદન્ત મૂકૃતઃ. એટલે  
ઉપરનો અર્થ કોઈ રીતે સંગત થતો નથી.” એ પ્રમાણે લખ્યું છે તે  
તેઓની ડેવળ અજ્ઞાનોત્તિત જ્ઞાનયેષા જ છે.

(૪૧) ચેજ ર૮ના તે બીજ પેરાના છેડેથી તેઓએ “વળી પર્વ-  
તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતિથિનો ક્ષય કરવો એવો અર્થ કરીએ તો  
(વૃદ્ધૌ કાર્યા તથોત્તરા મુજબ) પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તર-  
તિથિની વૃદ્ધિ કરવી એવો અર્થ નિષ્પત્ત થાય અને એ રીતે આહમની  
વૃદ્ધિએ એ નોમ કરવી પડે. પણ એમ તો તેઓ કરતા નથી ત્યાં તો  
તેઓ એ સાતમ કરે છે. વચ્ચે એ ‘વૃદ્ધૌ ઉત્તરા’ અને કરે છે પૂર્વની  
વૃદ્ધિ !” એ પ્રમાણે લખ્યું તે સ્વઅતોત્તિત ઉન્માદ છે, ‘ક્ષયે પૂર્વા-  
તિથિઃ કાર્યા’ એ જેમ વિધિસૂત્રાંછે, તેમ ‘વૃદ્ધૌ કાર્યા તથોત્તરા’  
એ નિયમસૂત્ર છે. નિયમસૂત્ર, વિધિસૂત્રમું કોઈ ન જ કરે; એવી એ જેમને

સમજ ન હોય તે જ માણસ તે વૃદ્ધૌઠ સૂત્રથી ‘પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિની વૃદ્ધિ કરીશી.’ એવી એચકલ વાત કરી શકે. પંચાંગમાંના પર્વક્ષય વખતે ક્ષયે પૂર્વાંઠ વિધિસૂત્ર, પૂર્વાંઠ અપર્વાંઠને પર્વતિથિ કરવાને વિધિ પ્રવત્તાવે છે અને પર્વની વૃદ્ધિ વખતે ‘વૃદ્ધૌ કાર્ય તથોત્તરા’ નિયમસૂત્ર, એ સુર્યોદયવાળી બનેલી એક નિથિનું એક સુર્યોદયવાળી તરીકે નિયમન કરે છે; એ વાત સમજને બે શાસ્ત્રના અથો કરવા પ્રેરાતા હેતું તો તેઓથી તે નિયમસૂત્રથી એ આઠમ વખતે એ નોમ કરવાના કુવિકલ્પના ભોગ થતા જરૂર બચી જવાન અને તે નિયમસૂત્રે એ પ્રમાણે જ્યારે પંચાંગમાંની વૃદ્ધતિથિ-એ.તિથિમાંની જ્યારે ઉત્તરા બીજી નિથિનેજ પર્વતિથિ તરીકે નક્કી કરી આપી ત્યારે પંચાંગની શેષ રહેશી પહેઢી આઠમ અપર્વ જ બની રહેતી હોવાથી શાસનપક્ષ એ આઠમ વખતે આરાધનાના પંચાંગમાં એ સાતમ કરે છે; તે વ્યાજાંભીજ છે, એમ સમજવાનું તેઓને સદ્ગામ્ય પ્રાપ્ત થાતઃ એ સદ્ગામ્ય હાલ તો ઉદ્ઘાંભાં વર્તાતું નથી, એટલેજ નવામતતોનક્કી દરેખો ખોટા કંકો પણ સાચો કરવા સાડ આવા કુઅયત્નો કરી રહ્યા છે; અને સૂત્રની વર્ણયેથી શાસ્ત્રકાસ્નો કાર્ય શાફદ ઉત્તરાની દ્વારાનું પ્રાપ્ત કરીને પણ “વચને વૃદ્ધૌ ઉત્તરા” લખવાનું સાહસ કરી રહ્યા છે! વર્ણ્યે બે ‘કાર્યે’ પાઠ હેતું તો તેઓએ ઉત્તરની એ નિથિ કરવાની ને વાહિયાત વાત રજૂ કરી છે, તેને કાંઈકે સંગત કરવા મથી રોકાત; પરંતુ ત્યાં તો વર્ણ્યે છે ‘કાર્યે’ પાઠ, અને તે ઉત્તરની એ નિથિ કરવાની વાતને લાત મારે છે, તેથી આ સુવિહિતોએ (૧) પૂજય દર્શાપૂર્વધર બ્રહ્માસ્વાતિ વાયકશ્રીના તે ‘વૃદ્ધૌ કાર્ય તથોત્તરા’ વચનમાંથી કાર્ય પાઠ તેમજ તે પછીનો ‘તથા’ પાઠ એમ તે સૂત્રમાંથી એ પાઠ કાપી નાખીને ત્યાં વૃદ્ધૌ ઉત્તરા પાઠ ઉપજાવી કાઢીને છાપેલ છે. અહિં ‘ને તેમ હોય તો કાર્ય પાઠ કાપી નાખે પરંતુ તે સાથે ‘તથા’ પાઠ પણ શું કામ કાયો હોય?’ એમ કોઈની જાણકારી નાથી, માટે અત્ર તત્ત્વાંધી પણ ખુલાસો ફ્રિલિત થાય છે કે-શાસ્ત્રશરૂ, ‘ક્ષયે ખૂદ્ધૌ’

એ એક વાત છે અને 'વૃદ્ધો કાર્યા' એ ભીજી વાત છે, એમ જણાવે છે—એટલે કે બંને સુત્ર, વિધિદ્રષ્પ નથી, પરંતુ પ્રથમનું સુત્ર વિધિદ્રષ્પ છે અને પછીનું સુત્ર નિયમદ્રષ્પ છે એમ જણાવે છે; તેથી તે સુત્રમાંથી તેઓએ તથા પાઠ પણ કાઢી નાખીને પછી 'વૃદ્ધો ઉત્તર' પાઠ છાપેને પાઠ કાપ્યોડૂખીને છાપ્યો છે, તેમાં એ મૂળ મજામૂલ હેતુ છે. અને સુત્રજીતોએ ઘ્યાલ રાખવા જેવું છે કે-તેઓ શાસ્ત્રપ્રિય પણ આ પ્રકારનાજ છે! પછી તેઓ શાસનપ્રિય ડેવાક હોછ શકે, એ વિચારવું સુલભ થશે

(૪૨) તે ચોથા મણુકાના પૃથ રૂદ્ધના ભીજ પેરામાં “તેઓ કહે છે કે ‘ઉદ્યતિથિની ઘડીએ ક્ષીણુ પર્વતિથિમાં નાખરી’ એમ શાસનપક્ષને સંભોધિને લખે છે, તે જૂદું છે. ‘ઉદ્યતિથિની ઘડીએ ક્ષીણુ પર્વતિથિમાં નાખરી’ એવું શાસનપક્ષમાંથી એક પણ વ્યક્તિનું કુથન તેઓએ કયાંય પણ સાંભળ્યું છે? વાંચ્યું છે? વાંચ્યું હોય તો સ્થાન સાથે તેઓ જાહેર કરે. પર્વતિથિજ ક્ષીણુ છે, પછી તેમાં ઉદ્યતિથિની ઘડીએ નાખવાની વાતને સ્થાનજ કર્યાં છે? અને તેથીજ એવું વિચિત્ર, આ શાસનપક્ષનાં નામે સહૃદ્યાય તમેજ બોલી શકો છો, શાસનપક્ષની તો એકાદ પણ વ્યક્તિનું આવું ‘પહેલાંની તિથિઓને પછીની ગણ્યાતી ક્ષીણુ પણ (ભોગની અપેક્ષાવાળા) તિથિમાં નાખવાનું’ વિપરીત બચન અધારિ પર્યાન્ત કોઈએ ય સાંભળ્યું કે વાંચ્યું કે જાણ્યું હોય તેમ જાણવામાં નથી; અને બોલવા છુંઝે ય નહિ. ભીજાના જણાને દુને તમોનેજ આવું ચાલવાને અનુર્ધ્ય ઉલડુંજ બોલતું ગમે છે, તો ખુશીની વાત છે; પણ તેમાં પણ તમો વિદ્જનજીતોમાં હાંસીને પાત થતા અટકો, એ શુલ્ષ હેતુથી (ભોગની અપેક્ષાએજ) પ્રશ્ન છે કે—“પર્વતિથિ પ્રસંગે ઉદ્યતિથિ=પૂર્વની ઉદ્યાત અપવંતિથિ, એ ક્ષીણુ પર્વતિથિનો આધાર છે કે આધેય છે? જો આધાર છે, તો આધારદ્વારી ગણ્યાતી તે અપર્વતિથિની ઘડીએમાં આધેયદ્રષ્પ ગણ્યાતી ક્ષીણુ પર્વતિથિની ઘડીએ નાખવાનું બોલાય? કે આધેયદ્રષ્પ ગણ્યાતી ક્ષીણુ પર્વતિથિની

ધડીઓમાં આધારરૂપ ગણાતી અપર્વતિથિની ધડીઓ નાખવાનું ઓલાય?" અસ-મતના આગહવશાતું વસ્તુરવરૂપ યદ્વા તદ્વા ફેંક્યે રાખવું તેમાંથી ઓછો કુમંબંધ રખે સમજના અને આપનો તિર્થમત કે-જે સર્વું પ્રક અસત્ય કરેલ છે તે આવા સેંકડો પ્રપંચો કરો તો પણ કદમ્પિ સત્ય કરવાનો તો નથીજ ! કારણું કે શાસ્ત્ર અને પરંપરાને તજને આ. એ રામચંદ્રસુરિણું તેને મનસ્ત્રીપણેજ કાઢેલ છે. પછી તેવા મતને રાખવા તેઓ આદિ તમેઓ આ જવોભવ અથડી હાલતમાં ભૂણી રીઆવે, તેવા દુષ્પ્રયતનો ફર્જ પ્રકારના લાલગદ સમજાય છે?

(૪૩) પેજ ૨૮ના તે બીજ પેરામાંનો તે પછીનો—“એટલે ક્ષીણું પર્વનિથિવાળી પર્વ x x x x x કેમકે ગ્રહચારથી નિયત થયેલો જ્યોતિષનો કુમ ફેરવી શકાતો નથો” ત્યાસુધીની ૧૦ પંક્તિમાંનું જાખાણું, નં. ૪૨માંનું સમાવાન વાંયવાથી વાયકને સ્વયંનિર્થક જણાય તેમ છે. આગળ પણ કહેવાછ ગયું છે કે—આરાધકાને ગ્રહ-ચારથી નિયત થયેલો જ્યોતિષનો કુમ ફેરા કે ન ફેરા તે સાથે કશા લેવાદેવા નથો, તેનો તો આરાધવાની પર્વતિથિ ક્ષીણું હોય ત્યારે શાસ્ત્ર અને પરંપરાનુસારે તે ક્ષીણુંતિથિને જ સર્વોદ્યમને અને સ્વનામની જાંતા પામેચ તરીકે પ્રાપ્ત થાય તે જ જેવાનું છે. હવે આવું શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધ લખવા હિંમત કરનારા તમેજ ચૌદશના કષે તેરશ ૪ કે ૬ ધડી ઉદ્ઘાત હોય છાં ચૌદશનો પૌષ્ઠ, તેરશના સર્વોદ્ય પહેલેથી ય ઉચ્ચયરાવો છો, ઉપવાસ આદિનાં પરંયડખાણો પણ આપો છો, દીપખામાં અમાસ ઉદ્ઘાત હોના છાં બીવીરજ્ઞાન-નિર્વાણ કાર્યો કોકાનુગૈરિદ્ધને આંચીન બીને લોક સાથે ચૌદશે દીવાળી કરો છો તેમાં ગ્રહચારથી નિયત થયેલો કુમ ફેરો છે કે નહિં? એ ક્યાં જુઓ છો? માટેજ તે બખાણું પછી આગળ જર્તાં તમે તેજ પેજ ઉપરની પંક્તિ ૧૮ થી જે “એથી પાઠકો સમજ શકશે કે—પર્વતિથિના ક્ષ્યવૃદ્ધિ હોય ત્યારે તેની પહેલાંની અપર્વતિથિના ક્ષ્ય-વૃદ્ધિ કરવા એવો અર્થ આ પ્રદેશનો થતો નથો.” એ પ્રમાણે લખો

છે, તે બધું જ તેવી કપોલકલ્પિત વાતના આધારે હાંકે રાખવાટ્યું  
 હોવાથી ખોડું છે. તે 'ક્ષયે પૂર્વાં' પ્રવોષનો અર્થ, 'પંચાંગમાં પવિ-  
 તિથિના ક્ષયવૃદ્ધિ હોય ત્યારે તેની પહેલાંતી અપર્વતિથિના ક્ષયવૃદ્ધિ  
 કરવા' એ જ પર્વતાર્થભગવંતોએ કરેલ છે અને આજે પ્રચલિત  
 છે. હવે તમે કરવા લાગ્યા છો. તેવો તે ક્ષયે પૂર્વાંનો અર્થ કોઈ પૂર્વાં  
 ચાયોએ કર્મો છે? ઉલટા જનરનો અર્થ કોણું માને? વીર સં.  
 ૨૪૬૦ના તા. ૨-૬-૩૪ના તેમના જૈનપ્રવચનના ૧૨-૧૩-૧૪  
 સંયુક્ત અંકના પાના ૧૭ઝની ડેલિમ પહેલીના બીજી ઉત્તરમાં તમે  
 પણ એ અર્થ જ જણાવેલ છે કે—"એક જ દ્વિસે નણું તિથિનો  
 લોઙ આવતો હોય તો વચ્ચેદી તિથિ ક્ષયતિથિ કહેવાય છે.  
 તે તિથિ જો આરાધ્યપર્વકાણિની હોય તો પૂર્વની તિથિની  
 જગ્યાએ તેને જ કાયમ કરાય છે; કારણ કે-તે ક્ષયતિથિની  
 સમાપ્તિ પણ તે જ દ્વિસે થાય છે. તત્ત્વશાલી આત્માએને  
 આ વર્સ્તુ સ્પષ્ટ સમજાય તેવી છે?" જૈનપ્રવચનના તે પેજ ઉપર  
 બીજી ડેલિમમાં પણ તમે લખેલ છે કે—"તત્ત્વતરં ગિણુનો આધાર તો  
 સંવત્સરીની ચોથના ક્ષયે નીજનો ક્ષય કરવાનો છે, કે જે નિયમ પ્રમાણે  
 પહેલાં પણ વિઠમ સં. ૧૬૩૦માં વર્તન થયું હતું." આમાં છતાં તે જ  
 ક્ષયે પૂર્વાં પ્રવોષનો અર્થ, હવે 'પર્વક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિના  
 ક્ષયવૃદ્ધિ કરવા, એમ થતો નથી' એમ ઓલે! છો. તે પોતાનાં પણ એ  
 ઓલેલે અને વર્તોસુધી આચયરેલ વચ્ચેનો અને. તે મુજબનાં વર્તનથી  
 વિરુદ્ધ છે. તમારા દાદાગુરુ શ્રી દાનસુરિલુ મ. વિવિધપ્રાંતોત્તર ભાગ  
 બીજનાં પેજ ૮૪ ઉપર આ 'ક્ષયે પૂર્વાં'નો અર્થ. સાફ લખે છે  
 કે—"બીજ, પાંચમ, આઠમ, અગ્રીઆરશ અને ચૌદશ આદિ તિથિનો  
 જગ્યારે લોકિક પંચાંગમાં ક્ષય હોય. ત્યારે તે તિથિ પ્રથમ દ્વિસે કર્યી,"  
 આમ છતાં તે પુસ્તક છપાવતી વખતે શ્રી જાંબુવિજયજી આદિએ  
 સં. ૧૬૬૪માં તે પોતાના દાદાગુરુસ્કૃત અર્થને થોડો કરી. નાખવા  
 સારુ 'એટલે' કહીને ડોમામાં પોતાનું મંતવ્ય લેઓશીનાં નામે ગવાય

એ રીતે દાખલ કરી દીધું તેને સાચું કહવા મળો, તે ઐટું જ છે. શ્રી જંબૂસ્કુ. એ તો તે સં. ૧૯૬૫માં પ્રસિદ્ધ થયેલા અંધના પેજ ૨૬૬ ઉપર સં. ૧૯૯૨ના આવણ વદમાં નીકળેલ નવાચિતનો “નિધિની ક્ષયવૃદ્ધિમાં પૂર્વીપૂર્વતાર નિધિની ક્ષયવૃદ્ધિ કરીને શાસ્ત્રવિધિનું ખૂન કરે છે.” તે માન્યતા સં. ૧૯૬૨ના ભલા ભહિને કાલધર્મ પામેલા શ્રી દાનસ્કુ. મ.ના નામે ચડાવી દેવાનું પણ પરાક્રમ દાખલાયું છે કે? તેવા જૂડા માણસના લખાણ પર લક્ષે શે? આથી જ આગળ જતાં તમોએ તે પેજ ૨૬ ઉપર પંક્તિ ૨૨ થી જે—“આહી ભા. શુ. પના ક્ષયે ભા. શુ. જ ઉદ્યતિથિમાં સંવત્સરીમાં માનનારા પૂ. સિદ્ધિસ્ત્રગ્રામ આદિ એમ કહે છે કે—શાસ્ત્રે ઉદ્યતિથિની આરાધનાનું વિધાન કર્યા પદ્ધતિ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તેનું આરાધન કર્યારે કરવું? એ પ્રશ્ન ઉડે છે તેનાં નિરાકરણ માટે શ્રી ઉમાગ્વાતિ મહારાજે આ સૂત્ર કહેલું છે, તેથી તેનો અર્થ આ રીતે થનો ઘટે:- ક્ષયે પૂર્વી તિથિઃ કાર્યા ન્ત્યારે પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની (અપર્વતિથિ) તિથિ કરવી.” એ પ્રમાણે લખ્યું છે તે યથાર્થ છે, અને તે અર્થને જ સાચો માનવે! ડીક છે. આવું સાચું લખ્યા પછી પણ ‘તાણ્યો વેલો અતે થડેજ જય’ એ ઉક્તિ અનુસાર આગળ જતાં જે “અથોત્ તેનું આરાધન પૂર્વની તિથિમાં કરવું.” એમ લખાયું તે શોખનીય નથી. અનેક વખત પોતે પણ સ્વીકારેલ અને આચરેલા સાચા અર્થને ય મનસ્વીપણે મરડીને ઈરાદાપૂર્વક જિધો જણાવાયો છે! અત્ર મતાચહને જ દોષ આપવો રહે. અન્યથા મણુકા પાંચમાના પેજ ૨૪ ઉપરના પારશિષ્ટ તણે—

### “[૨] અપવાદ નિયમ..”

તિથિનો ક્ષય હોય (અર્થાત્ સૂર્યોદયમાં ન હોય) તો પૂર્વની તિથિ આરાધ્ય કરવી અને વૃદ્ધિ હોય (બે સૂર્યોદયને રૂપર્શતી હોય) તો બીજી તિથિ કરવી.” એ પ્રમાણેનો સત્ય અર્થ તમો ફરીથી પણ જણ્યાવો છો તે કેમ બને? હવે આ છેલ્લા અર્થને કદી છાડો નહિં. એ પ્રકારે

ખુદ્દ સદાને માટે ચિથર રાખવા વિનંતી છે; કારણ કે-ઓ નૈતધર્મ પ્રકાશ સં. ૧૯૮૦ના વૈશાખ માસના અં'કના પેજ ૫૧ ઉપર તે પ્રથોપનો આજથી ૩૩ વર્ષ પૂર્વે પણ “ક્ષયે પૂર્વાતિથિ ગ્રાહ્યા, વૃદ્ધૌ ગ્રાહ્યા તથોત્તરા એટલે ને બાર તિથિ પૈકી ડાધપણ તિથિનો ક્ષય પંચાંગમાં હોય તો તે તિથિનો ક્ષય નહિ કરતાં તેની પૂર્વની તિથિનો ક્ષય કરવો. જેમકે પુનમ કે અમાસનો ક્ષય હોય તો તેની પૂર્વે ઔદ્ધા પણ પર્વની તિથિ હોવાથી તેરસનો ક્ષય કરવો. અને વૃદ્ધ હોય તો પાળવા માટે એ પૈકી ભીજુ (ઉત્તર) તિથિ પાળવાની ઠરાવવી અને પ્રથમની તિથિનો ત્યાર અગાઉની તિથિ એ ઠગાવવામાં ઉપયોગ કરવો ” એ પ્રમાણે જ અર્થ જહેર કરેલ છે.

(૪૪) પેજ ૩૦ ઉપર હિંદી દાધપમાં પૂ. મુનિરાજ ની જવેરસાગરજ મ. ના પ્રસિદ્ધ કરેલા “ ને તિથિનો ક્ષય હોય તો પૂર્વતિથિમેં કરણી, ને વૃદ્ધ હોને તો ઉત્તરતિથિ લેણી. યદુક્તાં ક્ષયે પૂર્વા તિથિ કાર્યા, વૃદ્ધૌ કાર્યા તથોત્તરા ” એ શાખાભાનોની ‘કરણી’ શખદ પણ પર્વક્ષયે પૂર્વની તિથિને ઉદ્યાત પર્વતિથિ કરવાનું જ સૂચવે છે, અને વૃદ્ધ હોય તો એ તિથિમાંથી ઉત્તર-ભીજુને જ ઉદ્યાત પર્વતિથિ તરફ લેવી, એમજ સાંક જણાને છે; પરંતુ તમારી જેમ એ આઠમ વખતે એ નોંધ કરવાનું જણાવતો નથી. એમથી છેલ્લી એકને પર્વતિથિ તરફ લીધી, એટલે તેની પૂર્વની તિથિ તો અપર્વ ગણીને પ્રવર્તાવવાનું તે શખાભાનું ‘ઉત્તર તિથિ લેણો’ એ વાક્ય જ નક્કી કરી આપે છે. પેજ ૩૧ ઉપર પહેલા પેરામાં પૂ. આગમોહારક આચાર્ય મ. શ્રી આનંદ્સાગરસૂરીખંજુ મ. શ્રીના શ્રી સિદ્ધયક્તમાંતા (સ્થલ ટાંક્યા વિના જ) : જૂ કરેલા વાક્યો પણ પંચાંગમાં આવેલ પર્વવૃદ્ધ વખતે આરાધના માટે ઉત્તરતિથિને લેવાનું કહે છે, બીજું કહે છે જ ક્યાં? કે-જેથી તે શખાં અને વાક્યો ટાંકવા પણા?

(૪૫) પેજ ૩૦ના પેરા ખીજમાં—“ અહીં એ રૂપણીકરણ પણ આવશ્યક છે કે-ક્ષયે પૂર્વાનું સત્ત્ર માત્ર પર્વતિથિને માટે એટલે કે-

બારપવીને માટે જ નથી, પરંતુ કોઈપણ તિથિને માટે છે. એટલે જ ચૈવ શુદ્ધ ૧૩, ચોષ શુદ્ધ (?) ૧૦, અન્યકલ્યાણુક, વૈશાહ શુદ્ધ ૩, ઉપધાનમાળ-તિથિ, નતગ્રહખુનિથિ વગેરે તિથિના ક્ષય વખતે પૂર્વતિથિ ગ્રહણુ કરાય છે આ રીતે: વૈ શુ ઉના ક્ષે શુદ્ધ રનો દ્વિસ ભીજ પર્વના માટે પણ છે, અને અક્ષયતૃતીયા માટે પણ છે. ત્યાં કોઈ વૈ. શુ. ૧નો ક્ષય કરી એકમને ભીજ અને ભીજને ત્રીજ એમ કરતું નથી, તેમ કરાય પણ નહિં, કેમકે-પંચાંગ તો બીજને ઓદ્દિપિક ઘતાવે છે, અને ત્રીજ એ જ દ્વિસમાં ભેગી આવે છે.” એમ લખ્યું છે તે શાસ્ત્રના આધારો આપી લખી શકેલ નથી, એટલે સ૪૪૮ છે કે-કેવળ ફેંકાફેંક જ કરી છે. તેનું ભરોાત્પાદક લખાણ કરવામાં તેમણે આરાધના માટેની દર માસે પરિસંખ્યાત એવી અષ્ટમી આદિ ફરજીયાત પર્વતિથિઓ અને કલ્યાણુકો આદિ ભરજીયાત પર્વતિથિઓનો શાસ્ત્ર અને પરંપરાનિરૂપ ધર્માદ્યાપૂર્વક ઉદ્દ્દિક જનતાને બ્રમાં પાડવા શાંભુ મેળો કરવો, તે આરાધકપણું ન ગણ્યા. મહિનાની ભીજ, પાંચમ આદિ તિથિનો દરપણે, દરમાસે પરિસંખ્યાત અને પરિગણિત હોય છે, તેમ કલ્યાણુક વગેરે પર્વતિથિઓ દરપણે-દરમાસે પરિસંખ્યાતપણું નથી અને પરગણિત પણ નથી, અષ્ટમી આદિ પર્વતિથિઓ દ્વિસ પ્રતિનિયત છે, એટલું જ નહિં, પરંતુ આવકને પૌષ્ઠ્રાદ્ધિ અને સાધુમહારાજને ઉપવાસ, ચૈત્યવંદન વગેરેથી નિયત હોછને પરિગણિત છે, જ્યારે કલ્યાણુકાદિ પર્વતિથિઓ સુખ્યતાએ માત્ર તપસ્યાચી આરાધ્ય ગણ્યાય છે. અષ્ટમી આદિ અંગે અનારાધન સંબંધમાં પ્રાબંધિત જણ્યાવેલ નથી. તથા ભીજ, પાંચમ આદિ મહિનાની બાર પર્વતિથિની માઝક ‘એક દ્વિસ એકજ પર્વી આરાધવાનું વિધાન’ કોઈપણ શાસ્ત્રમાં કલ્યાણુકાદિ પર્વતિથિઓ માટે કરવામાં આવેલ નથી.—આર્થાત્ કલ્યાણુકપર્વતિથિઓ એક દ્વિસે અનેક પણ આરાધી રાકાય છે. એક દ્વિસે કલ્યાણુકપર્વી ધંધાં પણ હોય છે, જ્યારે બારપવીભાની કોઈપણ પર્વી એક દ્વિસે એક જ હોય છે. વળો કલ્યાણુક પર્વ સંબંધીના તપને માટે વૃદ્ધ દેવેન્દ-

ભરિકૃત યત્તિનસમાચારીમાં ધમાધિકારમાં જણાવેલ તિથિ હનિષ્ઠિક્ષ  
વિચારમાં ‘ચતુર્થદિન’ યાવદ્પિ તપ:પૂત્તિ:કાર્યતે’ એમ જણાવેલ  
હોવાથી કલ્યાણુક વગેરે પર્વીમાં પણ ચાર તિથિ સુધી પણ પાછળ  
જવાનું વિચાન છે, જ્યારે બાંપરીમાંની એકાદ પણ પર્વી માટે તે  
પર્વીને છાડીને એકાદ તિથિ પણ પાછળ જવાનું વિચાન નથી. ‘તત્ત્વ  
ત્રયોદશીતિ વ્યપદેશસ્યાપ્યસંભવાત्, કિનુ પ્રાયશ્રિતાદિવિધૌ  
ચતુર્દીશ્યેવેતિ વ્યપદિશ્યમાનત્વાત्’ પાઠવડે શાસ્ત્રકાર મહર્ષિઓ  
બારપરીમાંની ડોધ પણ પર્વતિથિના ક્ષય વખતે પૂર્વની અપર્વતિથિની  
સંસારો અભાવ કરીને આખા દ્વિષસ માટે જેમ ક્ષીણપર્વતિથિની સંસા  
કાયમ કરી, તેમ કલ્યાણુક પર્વતિથિના ક્ષય વખતે તે ક્ષીણ તિથિને  
પૂર્વની તિથિએ ડોધ શાસ્ત્રકારે તેના સંસા કાયમ કરી નથી, માટે  
બારપરીની માફક કલ્યાણુકપર્વ વગેરેના ક્ષમષ્ઠિ પ્રસંગે ક્ષયે પૂર્વીંથી  
સંસ્કાર અવિચિન્ન પરંપરાથી આપવામાં આવતો નથી, તેથી તેના  
ક્ષય વખતે પૂર્વતિથિ ગ્રહણ કરાય છે. આ વાત સં. ૧૯૬૫માં નવો  
મત કાલાર આ. શ્રી રામચંદ્રસુદ્ધિ અને તેમને અનુસરેલા તેમના  
ગુરુ, ગુરુજીના કાકાગુરુ, તેમજ રહી રહીતે સં. ૧૯૬૬માં જોડાએલા  
આ. શ્રી સિદ્ધિસુદ્ધિ મ. આદ્ય સર્વ નવા વર્ગે પણ સં. ૧૯૬૮  
તેમજ ૧૯૬૯ સુધી એજ પ્રમાણે નિરપવાદ આચારેલી છે. આવી  
સ્પર્શતિથિમાં ‘ક્ષયે પૂર્વીં તું સૂત માત્ર ૧૨ પર્વીને માટે જ નથી,  
પરંતુ ડોધપણ તિથિને માટે છે’ એમ શાસ્ત્ર અને સ્વયં આચારિત  
પરંપરા છિપર પણ એધડક પગ મૂકીને સંદત્ત જૂણું લખે, (આ,  
શ્રી રામચંદ્રસું, ૧૧ રૂપીયાવાળો નવો તિથિનિર્ણય અંથ પછાર  
પાડવા સારુ પાંચ વર્ષથી તલપાંપડ થઈ રહ્યા હોવા છતાં પછાર  
પાડવાની હિંમત કરી શકતા નથી, તે અંથમાંના આ ભાસતા  
કલ્યાણાને [ પ્રતીકરનું પરિથળ આપવા ] કદાચ વાનકીર્પે પણ લખતા  
હોય તેમાં ) તેને ડોધ રોકી શકે નૈ. શુ ૧૩ અને વૈ શુ. ૩  
જેવા વિખ્યાત કલ્યાણકાદિ પર્વી બારમાસે એક જ વખત આવે છે,

અને તેના ગ્રંથમાટિક વખતે આરાધકો અનુષ્ઠળ માર્ગ વર્ણાચિ કરી જ લેતા હ્યાયા છે. ઉપધાનમાળિથિ, વ્રાંગ્રહણિથિ ડે-જે વ્યક્તિમત તિથિ છે, તેને પણ હજે જે વ્યાપક પર્વનિથિ તરીકે ભાગવવા દીલ થયું હોય તો જે તે બાબત પણ ચર્ચા શકે.

(૪૬) પેજ ઉત્તે છેલ્યો “હજે પૂ. શ્રી સિદ્ધિસ્તુરિલુ મ. વગેરે પુનમના ક્ષયે શુ. ૧૩નો ક્ષય કરવા જતાં ડેવી આપત્તિ બ રહે છે, તે પણ જેઈએ. × × × × એટલે વાસ્તવિક રીતે પૂર્વનિથિનો ક્ષય નાભવતના પદ્ધતિજ બોટી છે.” ત્યાં સુધીના લખાણુનો તે આપો પેરો કથીરને સુવર્ણમાં ભપાવવાના મદિન હેતુથી આ. મ શ્રી સિદ્ધિસ્તુરિલુ મ.નું નામ બોટી રીતેજ અભગળ કરીને લખ્યો મારેલો છે; કારણ ડે-તેઓએ તેવી આપત્તિ ડેઢને બ જતાવી હોવાનું અદ્યાપિપર્યું ત જાણવામાં નથી. અમારી આ માન્યતામાં અમો અલ્પ અતિશયોક્તિ અતાવતા હોઈએ તો તેઓ આ. શ્રી સિદ્ધિસ્તુરિલુમ.ના હાથદસ્તકનું તેવું આપું લખાણ જ્લોક બનાવીને પ્રસિદ્ધ કરવાવડે જનતાને જહેર રીતે ભતાવી આ.પે. તેઓઓ તો એ નવા મતની આંગ્રેજીની રમતથી લગભગ અન્નાણ છે. એ સાવ લોણીયા દાદાને અટપરી પ્રોપેન્ડાના લોબ બનતા બચાવનાર પણ ડોણુ છે કે જે હેતુને તો જેને તેઓ બોટા કહેતા હતા તે તમાર સાવ નાપાચાદાર મતમાં પણ દોરવાઈ જવા પામ્યા; તે કેમ બને?

(૪૭) પેજ ઉત્તે અતિમ પેજ ૩૬ સુધીમાં ‘શ્રી વિજય-સિદ્ધિસુરીધરણુનો મત’ શીર્ષક તથે લખેલી વાતો સત્ય કરતા અસ્તયથી વધુ મિશ્રિત હોવાને દીધે ઉપેક્ષણ્યાય છે.

(૪૮) મણુક ખાંચમાના પેજ ઉથી પેજ ૨૧ સુધીમાં ‘હજે શુ. કરણું?’ શીર્ષક તથે લખેલી વાતો અધ્યતા વર્ષે આમદાવાડમાં એમને જનોલીષ વર્સુગ્રોની સગવડતા, આચીન આનંદસ્થાને પ્રમાણિક માનીને પ્રવર્ત્તા આમદાવાદના યુદ્ધિશયાંહી સંબના

આગેવાનો નાહાથે જ અમદાવાદમાં ઓલી કરાવવાની ગોલં દ્વારા-  
સવરૂપ જણુતી હોવાથી તેની ઉપેક્ષા કરવામાં આવે છે.  
આ તિથિચર્ચાના જગ્યિલ પ્રક્રિયા ઉકેલ માટે તેને અંસે તેઓ  
પોતાના નવામતને ધરાવવાર સથળ પક્ષ ન હોય તેવા નગરના  
શ્રી સંઘને તેવા નગરમાં આચાર્યેને એકઠા કરવાનું કહે  
તેમજ પ્રતિનિધિ, પોતાની જાળમાં કદિસપડાવાજ પામે નહિ,  
તેવી કોઈ પેઢીનું નામ જાગળ કરે તો પણ શ્રી દેવસ્તર  
સંઘમાં આ. શ્રી વિજયરામચંદ્રસુરિલુ કે તેમના નવા મતને  
અનુસરનારાખ્યામાંથી કોઇ પણ સાંધુ આદિ આ પ્રક્રિયા ઉકેલ  
લાવવા શ્રી સંઘને કોઈ પણ પ્રકારનું સૂચન કરે તે યોગ્યજ  
નથી. શ્રી દેવસ્તરસંઘના આચાર્યેની સલાહ-સંભતિ લીના  
વિનાજ સં. ૧૯૮૮માં જેમણે શ્રી સકલસંઘથી રવેચ્છાએ  
સંવત્સરી જુહી પાડીને અને સં. ૧૯૮૯થી તો શ્રી દેવસ્તર  
સંઘના આરાધનાના પંચાંગથી પોતાના પંચાંગા પણ મન-  
સ્વીપણે જુહી કાઢીને સમાજમાં ઘેર ઘેર કલે”। પેદા કરેલ છે !  
જે આજે પણ શામતો નથી ! તે વર્ગ, શ્રી દેવસ્તરસંઘને માર્ગ-  
સૂચન કરવાનો હક્ક રીતે ધરાવી શકે ? એવું અપૂર્વ  
કાર્ય કરવાને તો શાસનના અનુરાગી એવા સર્વ શાહેરેના  
મધ્યસ્થ, ધર્મનુદાની અને સુપ્રતિષ્ઠિત એવા સર્વમાન્ય  
સદગુહસ્થ આવકચર્ચેજ અધિકારી છે. સુંબધનગરીમાંના  
આપણા વિશાળ સંઘમાં આપણા શ્રી દેવસ્તરતપાગચ્છ સિવાય  
તો બીજે કોઇ સંઘ નથી ને ? ત્યાં આજે આપણા સેંકડા કેટલા  
પૂજ્ય સાંધુ-સાંનીલ મહારાજે પણ અનિરૂપભાન છે જ ને ?  
છતાં અવળું પડયું છે એટલે કેઓ આ પાંચમા માણુકાના  
પેજ ૧૮ ઉપર તે સુંબધભરના શ્રી દેવસ્તરસંઘને આજે  
ભારતના અનેક ગામ-નગરેમાં વસેલા સંઘોની અપેક્ષા  
ઓલી કરીને મહત્વની સંખ્યા વગરનો લેખાવવાની ખાલો-

શતા કરો શકે અને મુંબઠના અનેક ઉપાશ્રૂતોના સંધની અપેક્ષાએ મુંબઠના એ સેંકડો ગામોના જૈનોના શ્રી સંધને એક અંશમાત્ર ગણ્યાવવાવડે પોતાનો ઉન્મતતાનું પ્રદર્શિન પણ ભરો શકે છે, તેઓ અવળું પણેથી કાલે શ્રી રાજનગરના સંઘનેય કેવો લેખાવે? અને પેઢીને ઉતારી પાડવામાં પણ શું કમીના રાખે? માટે તેઓ ‘હવે કરવું શું?’ એમ આ પાંચમા મણુકા દ્વારા મુંબઠને પૂછે છે, ત્યારે તેનો જવાયું સહુએ “પ્રથમ તક ગુરુની આજ્ઞામાં આવો જાવ અને તે પછી પણ સમાજમાં વર્મિઝ હેયાંને વીશ વર્ષોથી વલોવી રહેંદા તમારા મતને તજી દેવાનો તરત જ જાહેરાત કરી દેવાપૂર્વક આપણા શ્રી સંધની અવિચિન્ન સમાચારીમાં જોગાઈ જાવ” એ પ્રમાણે તરત આપો હેવો, એ જ ઠીક જણાય છે.

(૪૬) મણુકો પાંચમો પેજ ૨૨ના પરિશિષ્ટ [૧] તરીકે તેઓ લખે છે કે—“આરાધન માટે સુર્યોદાય વખતે જે તિથિ હોય તે પ્રમાણું ગણ્યાય છે. (તે આખો દિવસ તે તિથિ આરાધ્ય કરાય છે.)” ન્યારે ચોથા મણુકાના પેજ ૨૫ની પંક્તિ ૧૭થી ૨૨ માં તેઓ લખે છે કે—“શાબ્દકારોએ પૂર્વતિથિ આરાધવાનું કહ્યું છે, નહિ કે—બાર દિવસ. તિથિ અને દિવસનો શાંલુમેળો કરવાનો નથી!” એ વદ્દોબ્યાધાત છે. કાં તો તેઓ ચોથા મણુકામાંનું આ હવે લખાણું ઈષ્ટ છે તો તેને વળગ્યો રહે અને કાં તો પાંચમા મણુકામાંના ઉપર જણ્યાવેલા પરિશિષ્ટ નં. પહેલાનાં પ્રાચીન માન્યતા મુજબના લખાણું પકડી લે, પરંતુ ઈર્યાદી કરવાનું ત્યજ હે.

(૫૦) પેજ ૨૨ના પરિશિષ્ટ [૨] તરીકે તેઓ “જો તિથિ ક્ષય હોય તો પૂર્વતિથિમાં કરણી, જો બૃદ્ધિ હોવે તો ઉત્તરતિથિ લેણી (આમાં પૂર્વતિથિનો ક્ષય કરવાનું નથી કહ્યું.)” એ પ્રમાણે ટેહું લખે છે, તો પ્રશ્ન છે કે—તેમાં ‘ક્ષય ન કરવો’ એમ કહ્યું છે? અને ‘ક્ષીણતિથિને પૂર્વતિથિમાં કરવી’ એમ તો કહ્યું જ છે કે? જો હા, તો

સં ૧૬૯૨થી તમે તે કથનાનુસારે ક્ષીણપર્તિથિને પૂર્વની અપર्व-  
તિથિમાં કરતાં બંધ થયા છો, તે ખોડું જ છે કે ?

(૫૧) પેજ ૨૩ના પરિશાષ્ટ [૪] તરીકે તેઓએ પોતાના ભતની  
સિદ્ધિને માટે જે “ક્ષીણાષ્ટમીકૃત્યં સદ્ગમ્યાં ક્રિયમાણં સાતમભાં  
કરતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. ‘ક્રિયતાં નામ તહીં ચતુર્દ્શીકૃત્યં  
ત્રયોદશ્યામણિ’ તો પછી ક્ષીણાષ્ટમીનું કૃત્ય પણ તેરશમાં જ કરો.”  
અહિં પણ ૭ કે ૧૩ નો ક્ષય નથી કર્યો.) તત્ત્વતરંગિણી પુ. ૪ ”  
એ પ્રમાણે શ્રી તત્ત્વતરંગિણી શાસ્ત્રના પણે! અને તેના અર્થો પ્રગટ  
કરેલા છે, તેમાં-તેઓએ રજૂ કરેલા શાસ્ત્રપાડા, પૂર્વનો અને પછીનો  
આગ કાપીને રજૂ કરેલ છે ! અને તે તુટક પાડોના પણ અર્થો ઉપનાની  
કાઢેલા છે. શ્રી તત્ત્વતરંગિણી અંથગતના પેજ ૩ ઉપર ચૌદશના ક્ષયે  
પૂર્વમે પક્ષી કરનાર ખરતરને પૂ. અંથકાર મહર્ષિ કહે છે કે—“તં  
અષ્ટમીના ક્ષયે સાતમઃપ પૂર્વની તિથિ આઠમ માટે અદ્ધણુ કરે છે,  
અને ચૌદશના ક્ષયે તેની પણીની પૂર્વમ અદ્ધણુ કરવાઃપ અર્દ્જનરતીય  
ન્યાયને અનુસરે છે, તે ટીક નથી. ક્ષીણ એવી પણ ચૌદશ, પૂર્વમભાં  
તેના ભોગની ગંધનો પણ અભાવ હોવાથી પૂર્વમભાં પ્રમાણું ન કરવી;  
પરંતુ તેરશમાં જ પ્રમાણું કરવી × × × × તેરશમાં ચૌદશ ઉદ્યર્પે  
નહિં હોવા અતાં તેરશનો પણ ચૌદશઃપે રવીકાર તેવી રીતે યુક્ત  
ગણ્યાય ? એમ તું કહે છે, તે ટીક છે, પરંતુ તે પ્રસંગમાં તેરશને દિવસે  
તેરશ એવા નામનો પણ અસંભવ છે. એટલું જ નહિ; પરંતુ પ્રાય-  
શ્ક્રિતાદિ વિધિમાં=ધર્મના આરાધનામાં, ચૌદશ જ છે, એ પ્રમાણે  
ઓદ્વાનો બ્યવહાર છે. યદુક્ત-સંવચ્છરણ॥૧॥ અહ જહ કહવિ  
ન લબ્ધ તાઓ સુરુળમેણ જુન્નાઓ । તા અવરવિદ્ધ અવરાવિ  
હુજ્જ નહુ પુષ્ટતવિદ્ધા ॥૨॥ શાસ્ત્રકારનાં તે સાક્ષીકયનમાંના  
અવરાવિ શખ્દમાંના અધિ શખ્દને આઓને શંકા ઉઠાવનાર ખરતને  
કહે છે કે—“પહેલાં તો ચૌદશ જ ખોલાય છે, એમ કલ્યાં અને અહિં તો  
અધિ શખ્દથી તે ચૌદશ, તેરશની સંસાવણી પણ થઈ જય છે તો

વિરોધ કેમ નહિં ?” એમ ન કહેવું કારણ કે પ્રાયશ્ક્રિતાદિ-વિધિમાં= ધર્મારાધનમાં ‘ચૌદશ છે’ એમ કહ્યું છે, અથવા ગૌણ અને મુખ્યભેદથી= વીપણાં અને આરાધનાની અપેક્ષા લેવાથી (વીપણાંતા અપેક્ષાએ જે તેરશ છે તે ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધનાની વાત છે તેની અપેક્ષાએ) ‘ચૌદશજ છે’ એમ જે પ્રથમ કહ્યું છે તે યુક્ત છે; એ અભિપ્રાયથી ઉક્તત્વાત्-તે હિવ્સે તેરશ કહેવાની ના કહી છે; તરુણ ત્વયાડદ્યં ગીકૃતમેવ-અને તે વાત તે પણ સ્વીકારેલ જ છે”

એ વાતના અનુસંધાનમાં શ્રીતત્ત્વતરંગિણીના પૃ. ૪ ઉપર શાલ્વકારે તે પાઠ, ‘અન્યથા ક્ષીણાષ્ટમીકૃત્ય’ સપ્તમ્યાં ક્રિયમાણમષ્ટમી-કૃત્યદ્યપદેજાં ન લમેત’ આ પ્રમાણે સંલગ્ન જણાવેલ છે, અને તેનો અર્થ—‘જે તેરો ચૌદશજ છે, એમ ન કાશૂલે તો સતતમાં કરતું ક્ષ્ય પામેલી આડમનું કૃત્ય=પૌષ્ય વગેરે ધર્માનુથન, અષ્ટમી । કૃત્ય તરીકે તમારાથી નહિં ઓલી શકાય,’ એ પ્રમાણે છે. જે આ. શ્રી રામયંત્રસૂત્રના નવા મને જૂડો ઈંવે છે, અને આ નવા વર્ગને તત્ત્વ-તરંગિણીના તેજ પાડોને આધારે યેનકેનાપિ સાચો લેખાવવો છે ! તેથી તેણે આ દસ્તો લીધો છે કે-શ્રી તત્ત્વતરંગિણી પૃ. ૪ ઉપરના તે સંલગ્ન પાડમાંથી અનુગ્રહનો ‘અન્યથા’ પાઠ કાપીને તથા પછ્યનો ‘અષ્ટમીકૃત્યદ્યપદેજાં ન લમેત’ એટલો અધ્યોજ વિભાગ રે. ૧ દ્વારા તેમના આ પાંચમા મણ્યકાના પેજ ૨ ડના પદ્ધતિષ્ઠ [૪] માં ઉપર પ્રમાણે “ક્ષીણાષ્ટમીકૃત્ય” સપ્તમ્યાં ક્રિયમાણ” એટલોજ પાઠ છાપ્યો છે અને તે સંલગ્ન આખા પાડો ઉપર દર્શાવેલ આપો અને સત્ય અથ ધરાદાપૂર્વક ગોપવીને ‘સાતમભમાં કરતું આડમનું કૃત્ય’ એટલોજ, પૂર્વાપરસંબંધ વગરનો અને શાલ્વકારના સાચા અર્થના ભૂગમાં ધા હેનારો ફરદમ જૂડો અર્થ જ્ઞૂ કરી દીધો છે ! તેઓનું આ રીતે સાલ્વપાડોને પણ ઓળવવાનું અને તોડીને રજૂ કરતા પાહોનું પણ અસત્ય અર્થો જણાવવનારું તર્કટ જેતાં તેઓ પ્રભુશાસનની સેવા કરી રહ્યા છે ઈ-પ્રભુશાસન ઉપર તીર્થય ધારવાળા કુઠાગેના પ્રદારા કરી રહ્યા છે ? એ સમજવું મુશ્કેલ થઈ પડેલ છે.

એ જ રીતે તેમણે તે પરિશિષ્ટ [૪]માં શ્રી તત્ત્વતરંગિણી અંથમાનો ખીજે પાડ જે-‘કિયતાં નામ તર્હી’ ચતુર્દીશીકૃત્યં ત્રયોવદ્ધ્યામણિ’ એ પ્રમાણે આપેલ છે, તે પણ તે પાડમાંના ‘તર્હી’ શબ્દ પછીને ‘તર્હીત્યૈવ’ પાડ કાઢી નાખીને-કાપી નાખીને પણી જ આપેલ છે ! અને તે પાડનો તેમણે જે-‘તો પછી ક્ષીણુ ચૌદશનું કૃત્ય પણુ તેરશમાં જ કરો’ એ પ્રમાણે અર્થ કરેલ છે તે અર્થું પણ શાસ્ત્રકારના સત્ય અર્થને હણી નાખનારો છે. તે આખા પાડનો સત્ય અર્થ- ‘તો પછી ( અષ્ટમીના ક્ષેત્રે જેમ સાતમને લોકનિંદાના ભયથા આડમ ગણ્યાને આડમનું કાર્ય કરો છો તેમ ) તે લોકનિંદાના ભયથી જ ચૌદશનું કૃત્ય પણુ તેરશના હિવસે ( ચૌદશ જ છે એમ માનાને ચૌદશે ) કરો’ એ પ્રમાણે જ છે. નિદાન વાચકે! અન શાસ્ત્રકાર મહર્ષિના પૂર્વપરવાક્યોને વિચારો જુઓ, અને જેઓ મતાચક આતર આ રીતે શાસ્ત્રના પાડોને પણ કાપીકૂપીને તુટક આપે છે અને તે તુટક પાડના અર્થો પણ જૂદા કરીને નૈનશાસનમાં નિજનું શાસન ચલાવવાની ધૂને ચટેલા છે, તેઓને હજુપણુ યથાસ્વરૂપે ઓળખી લેવાં ભાગ્યરાણી બનો. પરિશિષ્ટ [૪] ના તે બે પાડો અને તેના અર્થને તેવાં કદરૂપ બનાવીને આપ્યા પછી પણ તેઓ ત્યાં છેલ્લે ( અહિં પણ ઉ કે ૧૩નો ક્ષય કલ્યો નથી ), એમ કોંસમાં લખે છે તે ધૃષ્ટતાપૂર્વું જૂદાછું છે. શ્રી તત્ત્વતરંગિણીમાં શાસ્ત્રકારે જણાવેલા સંરૂપતાપામાંના ગ્રોફ અધિકારને વાચકો સાધાંત લક્ષમાં લઈ રહે, એ શુલ આશયથી મેં આ ઉપર વિરતારથી ગૂર્જર ભાષામાં પણ રજૂ કરેલ છે, જે સ્થિરચિત્તે વાચ્યવાથી નિદાન વાચકવ્યો સહેલાચથી સમજ શકે તેમ છે કે-શાસ્ત્રકારે અહિં અષ્ટમીના ક્ષેત્રે સાતમનું અને ચૌદશના ક્ષેત્રે તેરશનું નામ લેવાનો પણ રૂપણ નિષેધ કરેલ છે, તેથી ક્ષય જ જણાવેલ છે: અને “અહિ પણ ઉ કે ૧૩નો ક્ષય કલ્યો નથી.” એમ કહેનાર આ નવો વર્ગ, સમાજની અસાનઅહુલતાનો લાભ લેવા શાસ્ત્રકાર મહર્ષિના નામે પણ ધર્મરાધારૂર્ક તેવું જૂદું બોલે છે.

(૫૩) પેજ ૨૩ ઉપરના પરિશિષ્ટ [૫] માં પ્રવર્તક શ્રી કાંતિ-વિજયજીના નામે રજૂ કરેલ લખાણનું સ્થળ તો જણાયું જ નથી.

(૫૪) પરિશિષ્ટ [૬] માં ‘તિહિવાપ૦’ ભૂળ ગાથા જ આપવાનું કારણ અને તે ગાથાની ટીકાનો અર્થ જણાવવાને બદ્લે ટીકાનો ભાંગ્યોત્તૂણો તેમજ અધૂરો ભાવાર્થ જણાવવાનું કારણ ટીકામાં તેમને ‘સપ્તમ્યાદિરૂપાપ્રાચીનાતિથો’ પાડ જેઈતો હતો તે ન ભાયો અને છૃદ્ધ નથી એવો સપ્તમ્યાદિરૂપા પ્રાચીના તિથિઃ’ પાડ જેવા મલ્યો, તે છે. અહિં તેમનું ‘સપ્તમ્યાં ક્રિયમાણં’ સુકાદ્ધ જવા પામયું છે. ભાવાર્થમાં પણ ‘તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વાંતિથિ જ અહણું કરવી’ એમ જણાયું છે તે પણ યથાર્થ નથી. ‘તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વાં જ તિથિ અહણું કરવી’ એમ અર્થ છે.

(૫૫) પેજ ૨૪ ઉપરના પહેલા પેરાનું લખાણ ચન્દીતર્યાણુસ્વરૂપ હોવા છતાં ય જૂદું છે. પૂનમના ક્ષયે ચૌદશને ક્ષય મનાયે તેમ શ્રી હીરસૂંમ૦ ના ચ્રયોદશીવતુર્દ્દ્યોઃ વાક્ય કગેરથી તે ક્ષીણ ચૌદશને ઔદ્ઘયિક બનાવવા પૂર્વતર તેરશાલિથિનો પણ (માની થકાશે નહિ, શું?) મનાય જ છે, અને વૃદ્ધ હોય ત્યાર તો એ એકમનો હવે ભીજો પંથ કાઢો, તો ના કહેવાય નહિ, બાકી સખળો જ શ્રી દેવસ્સર-સંધ ખીજુને જ ઔદ્ઘયિક માને છે અને શ્રી હીરઅશ્રમાં તથા શ્રી સેનપ્રશ્નમાં તેવા સ્પષ્ટ દસ્તક પણ તમો જોઈ શકો છો. ખીજુન આદ્યિકી મનાસ્તી એટલે તેના પહેલાંની તો અપર્વ તરીક અનોદ્ઘયિકી બની જ જતી હોવાથી અપર્વ તરીક જ ઔદ્ઘયિક રહેવા પામે છે. સ. ૧૬૬૫માં ભરતરીય શ્રી ગુણવિનયે લખેલ ઉત્સુકભંડનના પૃ. ૪૦ ઉપર [એ પૂછ્યિમા તથા એ અમાસ આવે ત્યારે આપણે આરાધનામાં જે પ્રથમ પૂનમે તથા પ્રથમ અમાસે ચૌદશ કરીએ છીએ, તે બદ્લ ] ‘અન્યજી વૃદ્ધો પાદ્ધિકં ક્રિયતે ઇદં કિમ્? ’ એમ લખીને ‘તમે પહેલી પૂનમે ચૌદશ કરો છો તેનું કેમ?’ એમ આપણુને આપતી પણ આપી જ છે કે? આથી શ્રી દેવસ્સર તપગંઠસંધ પૂનમ

કે અમાસની વૃદ્ધિએ ખૂબાતર તેરશની વૃદ્ધિ પ્રથમથી જ કરતો આવેલ છે, નવું નથી કરતો, તેની આત્મી તે સતરભી સદીનો અરતરીય ગ્રંથ પણ આપે જ છે કે ? અને એ વાત તમે પણ જાણો જ છો કે ? જ્ઞાતાં ‘પૂનમની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ માનવી પડશો.’ એમ લખો છો અને પ્રચારો છો તે શાસ્ત્ર પ્રત્યે હવે અંદ્રા જ રહી નથી તેનું ખુલ્લું પ્રતીક નથી ?

(૫૬) પરિશિષ્ટ [૭] માં શ્રી તત્ત્વતરંગણીકાર મહર્ષીના નામે જે— “પ્રાયશ્રિતાદિ વિધિમાં ચૌદશ કહેવાનું, શ્રી ધર્મસાગરજી મહારાજે ફરમાવ્યું છે, લૌકિક વિધિમાં તો ઉદ્યતિથિ તેરશ હોવાથી તેરશ જ કહેવાય.” એ પ્રમાણે છંડાદાખૂર્વક જ્ઞાનું લખાયું ચદ્રના દેવામાં આવેલ છે, તે લયભીતિના અભાવનું સૂચક નથી ? પૂજન્ય મહોપાઠ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજે “પ્રાયશ્રિતાદિવિધિમાં ચૌદશ કહેવાનું ફરમાવ્યું નથી પણ ‘ચતુર્દિશ્યેવ-ચૌદશ જ છે’ એમ કહેવાનું ફરમાવ્યું છે કે ? વળી “લૌકિક વિધિમાં ઉદ્યતિથિ તેરશ હોવાથી તેરશ જ કહેવાય.” એ વાક્ય પણ તેઓ શ્રીના નામે તમારી માન્યતા ચડાવી દેનારું પ્રપંચી છે કે ? તત્ત્વતરંગણીમાં તે સ્થળે મૂળ મહોપાઠ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજે તેવું તો ફરમાવ્યું જ નથી, પરંતુ “ધર્મો-રાધનમાં ચૌદશ જ છે, એમ કહીને તે વાતની ગૌણ અને મુખ્યમનેદ્યી વ્યવસ્થા જણ્યાવી છે. એટલે કે-દીપણું અને આરાધના એ એની અપેક્ષા લેવાથી દીપણુંની અપેક્ષાવળી ત્યાં જે તેદ્દશ છે, જે (ઉદ્યુ-તેરશ હોવાથી તેરશ જ કહેવાય; કારણ કે-તે તેરશની અપેક્ષાએ) ગૌણ છે: માટે મુખ્ય જે ધર્મની આરાધનાની વાત છે તેની અપેક્ષાએ ‘ચૌદશ જ છે’” એ પ્રમાણે જ ફરમાવ્યું છે કે ? જો હા, તો પછી શાસ્ત્રકારના નામે તેવા જ્ઞાન અર્થે કરવામાં એને પ્રચારસ્ત્રામાં સ્વપરને લાભ શું ? અને પ્રલુદાસનની તેમજ આપણા લોકોત્તર સમાજની ખાનાખરાખી કેટકી ? હજુ પણ વિચારવા શાસનહેલ આપને તક આપે, એજ શુભેચ્છા.

(૫૭) પેન્ન ૨૫ના પરિસ્કૃત [૮] તળે 'અહ જાહ કહવિ' ગાથાનો અર્થ, શ્રી જંખૂસુરો એ પર્વતિથિપ્રકાશના પેન્ન ૨૪ ઉપર ફરેલ છે અને જેને અનેક વખત જૂહા અર્થ તરીકે જાહેર કરવામાં આવેલ છે તે અર્થને ત્યાંથી તેઓએ તિ અર્થમાંથી 'તેને ઉત્તર એટલે' જીવાડું જૂહું વાક્ય કાઢી નાખીને, 'નિધિના નામવાળોજ રહે' એ વાક્યમાંનો 'જ' કાગ, ત્યાંથી ડુહાવીને 'નિધિના' શબ્દ પણી રથાપીને, તેમાંના 'સંસા' શબ્દનો 'નામ' શબ્દ કરીને અને 'નામવળી પણ બને છે' એ વાક્ય પણી 'કિન્તુ' શબ્દ વધારાનો ઉમેરાને] અત ઉડાના લીધેલ છે. તેમાં તેઓએ ' અવરવિદ્ધ અવરાવિ હુજ નહુ પુંબ તવિદ્ધા' નો અર્થ ક્ષીણુતિથિયુક્ત પૂર્વની નિધિ પૂર્વતિથિનાજ નામવાળી રહે એમ નહિ, પણ તે ક્ષીણુતિથિની સંશાનાળી પણ બને છે" એ પ્રમાણે કર્યો છે તે પણ સદંતર જૂહાજ અર્થ છે. " અવરવિદ્ધ=ખૂય પામેકી એવી અનુદ્દ્યા ચૌદશ આદ્યિ વિધાએકી અવરાવિ=ચૌદશ આદ્યિ નિધિએ પણ 'હુજ' ભવેયુઃ=થાય, નહુ=નૈવ=નહિ જ કે પુંબ=પૂર્વ=તેરસ આદ્યિ તવિદ્ધા=ચતુર્દિયાદિમિ-વિદ્ધાઃ ભવેયુઃ=ચૌદશ આદ્યાનિધાએકીથાય," આજ એ ગાથાનો પદ્ધચે=પૂર્વક સાચો અર્થ છે. એટલે કે-'ક્ષીણુતિથિયુક્ત પૂર્વની નિધિ (તેરસ) ક્ષીણુતિથિ(ચૌદશ)ના નામવાળી પણ બને છે. (કિન્તુ) ક્ષીણુતિથિયુક્ત પૂર્વની (તેથિ (તેરસ) પૂર્વ નૈવ-તેરસ તરફે રહેજ નહિ.)" એજ એ ગાથાનો સાચો અર્થ છે. ખરતરે તે ગાથામાંના અવરાવિ શબ્દ ઉપરથી 'તેરશ પણ કહેવી પડશે' એમ આપણુને આપણિ આપેલ નથી; પરંતુ તે અવરાવિ શબ્દમાંના અપિ શબ્દનેજ આઓને તેવી આપણિ આપેલ છે અને તે આપણિનો પણ પૂણ્ય ગ્રંથકાર મહર્ષિએ 'મુખ્યમેદે તે દિવસે ચૌદશજ કહેવી' એમ તે ગ્રંથમાં સમાધાન પણ આપેલ છે. આ દરેક વરતુ જાણવા છતાં તેઓ અવરાવિમાંના અવરા શબ્દનો 'ચૌદશ' અર્થ છાડીને 'તેરસ' અર્થ કરને ચાલે અને અપિ શબ્દને મુખ્યમેદેમાં શાસ્ત્રકારે રથાનજ નહિ

આપેલ હોવા છાં તે અધિક શાખનો ‘પ્રાયશ્વિત્તાદિ વિધિમાં પણ’ અર્થ કરીને ચાલે અને તેમ કરીને ‘ક્ષોળુટિથિ(તેરસ)ની સંજ્ઞાવાળા પણ બને છે’ એમ શાસ્ત્રકારના ‘ચૌદ્દશાજ કહેવાય’ એ નક્કર અર્થથી સહંતર જૂડો અર્થ કરીનેજ પ્રચારી રાખે તેને શાસ્ત્રની ઘેરનાવાળા હોણુ ગણે ?

(૫૮) પેજ ૨૫ના પરિશિષ્ટ [૬] તળે શ્રી તત્ત્વતરંગિણી ટીકાના નામે આપેલો પાઠ, હરતલિભિત સર્વ તત્ત્વતરંગિણી અંથમાં છેજ નહિ, કોઈ કોઈ અંથમાંજ છે, અને એટલા માટે તો તેઓએ પણ અહિ તે પાઠનું પેજ કયું ? તે તો બતાવેલજ નથી ! અમની શાસ્ત્રપાઠ પ્રતિની વિજાહારી આવી છે. “ તે અંથ વાંચતી વખતે કોઈએ તે અવરવિદ્ધ અવરાવિ હુજા. પાઠનો અર્થ (બરાબર નહિ ઐસવાના યોગે) જે પ્રકારે એડો તે પ્રમાણે તત્ત્વતરંગિણીના મૂળ લખાણ : નીચે પ્રથમ નોટમાં સંસ્કૃતમાં લખ્યો હોવ અને પાછળથી તે પ્રત ઉપરથી બીજ ઉત લખાવનારા-ઓના હાથે મૂળ સાથે તે કુટનોટ જોડાઈ જવા પામી હોય, એ બનવા-નોગ લાગે છે કે નહિ ? ” એ મુજબ પૂજય આગમોહારકદેવેશઓએ સં. ૧૯૯૬માં પાલીતાણ્યા મુકામે પનાલાલ બાધુની ધર્મશાળામાં એ પાડતે વંડામાંથા સમજજવા આવેલા આ. શ્રી નિજયક્ષમાભદ્રસ્તુરિણુને જણ્યાવનાં આ. ઓ ક્ષમાભદ્રસ્તુરિણુએ “બરાબર બનવાનોગ લાગે છે, કારણું કે-સુરત નૈતાનંદ પુરતકાલયમાંની આ શ્રી તત્ત્વતરંગિણીની હરતલિભિત પ્રત મેં જોખેલ છે, અને તેમાં તે ખાડ નથી ” એમ કષૂલ ક્રેલ હોવાનું જાહેર થયું છે. આમ છતાં તેવા કોઈ અધૂરી સમજજના સાધુની તે કુટનોટને શ્રી તત્ત્વતરંગિણીની ટીકા તરંક લેખાવતા અટકવું જ નહિ, તે કષ્ટ પ્રકારની માનવતા ? અને એ માનવતાધારી, તેવા પાઠનો મન મુજબ ભાવાર્થ લખ્યા પડી (અર્થાત્ એ તિથિ લેગી) એમ લખી મારે એને ટેવા કહીએ ?

(૬૦) પેજ ૨૫ના પરિશિષ્ટ [૧૦] તળે ભાવાર્થનો પંક્તિ ૪ માં “ ચૌદ્દશ પણ કહેવાય અને તેરશ પણ કહેવાય ” એમ અર્થ લખ્યો

છે, તે અંમોદમૂલક છે, ત્યાં તેવો અર્થ છે જી નહિ અને કરી શકાય પણ નહિ. તેઓએ કોઈ સંરકૃતપણિતને ‘પણ’ શબ્દના એ રીતે એ અર્થ થાય ખરા ? એ પૂછીને આ પોતાની પોતાને અગ્રાન લેખાવે એની ભયંકર ભૂલને તાત્કાલિક સુધારી લેતી એ હિતસલાદ છે.

(૧૧) પેજ ૨૬ના પરિશિષ્ટ [૧૧] વાળો શ્રી તત્ત્વતરંગિણીના પેજ ૨૮ ઉપરનાં પાડનો અર્થ, તે જી તત્ત્વતરંગિણીના પેજ ૩ ઉપરના “અશૈવમંગીકૃત્યાપિ કશ્ચિત્વ ભ્રાન્ત્યા સ્વમતિમાન્યાચ્વાષ્ટમ્યા-  
દિતિથિક્ષયે સપ્તમ્યાદિરૂપા પ્રાચીના તિથિઃ” પાડના સાચા અર્થને ઉડાની દેવાની મહિન વૃત્તિપૂર્વક અસત્ય કરેલ છે. શાસ્ત્રકારનું એ ત્રીજા પેજ ઉપરના પાડને અનુલક્ષીને તે પેજ ૨૮ ઉપરનું વાક્ય છે. ત્રીજા પેજના પાડમાં ભરતરને જાણુંબેલ છે કે—  
‘આઠમના ક્ષયે તે આઠમ માટે તું પૂર્વની સાતમ લે છે’ તેથી ૨૮મા પેજ ઉપરના તે પાડમાંના સપ્તમ્યાં ‘ક્રિયમાણત્વેન’ પાડનો અર્થ  
‘સાતમના દિવસે (આઠમની સંતો આપીને) કરાતો (આઠમનો પૌષ્ઠ)’  
એમ છે, ‘સાતમમાં કરાતો’ એમ અર્થ છેજ નહિ. આમ છતાં તેઓ  
( અર્થાત् સાતમને સાતમ કહેવાતી અને પર્વના હિસાએ આઠમ પણ  
કહેવાતી, પરંતુ સાતમનો ક્ષય નહિ કરવાનો) એમ કૌંસમાં લખી મારે  
છે, તે પોતાના મતાઅહની કારભી આંધાનું તોઝાન સમજવું જી રહે છે

એ પરિશિષ્ટ ૧૨ થી લઇને પેજ ૩૮ ઉપરના પરિશિષ્ટ ૩૫ પર્યન્ત તેઓએ શાસ્ત્રોના થોકઅંધ પાડનો મેધાડાંબર ધારણ કરીને પોતાનો ભત આટલા તો શાસ્ત્રપાડો ધરાવે છે ! એ પ્રકારનો હાઉ અતાવવાનો જે જે પાડોદારા કૂટ પ્રયાસ કરેલ છે તે પ્રાય: બધાજ પાડો, ઉપર મુજબ ગંભડવાળા અને અસત્ય અર્થો ઉપજની કાઢેલા હોઘને તે બધાજ પાડના તેમજ અર્થોમાંના અસત્યનું આ પ્રમાણે આમૂલયુલ ઉદ્ધારન થઈ રહે તેમ છે, પરંતુ લખાણ ધણું જી વર્ધી જવાના ભાગ્યી ઇત્યાદ વિસ્તરેણ.

ને કે—શ્રી કલપસૂત્રસુભોગિકાના ‘ચતુર્દશીવૃદ્ધૌ પ્રથમાં ચતુર્દશીપવગણય્ય દ્વિતીયાયાં ચતુર્દશીં’ પાડમાં તેમજ શ્રી સિદ્ધયક્ત  
પાક્ષિક વર્ષ ૧, અક ૨૧, પૃ ૫૦૭ આદિમાં જણાવેલ એ ચૌદ્ધશા-  
એ અમાસ, ’ની વાતને અદ્રિકો પાસે રજૂ કરીને “જુઓ—કલપસૂત્રમાં ય  
એ ચૌદ્ધશા કરી છે, અરે ! ખુદ સાગરજી મહારાજે પણ એ ચૌદ્ધશા—એ  
અમાસ લગેવ છે, તાં ‘પર્વતિય એ ન હોય’ એમ એલે છે ! તે  
સાચું અનાયજ કેમ ?” એમ કહેવાવડે પણ તેઓ જનતામાં અમણા  
તો ફેલાવીજ રહ્યા છે અને તેથી વધારે નહિ તો તેટલા પૂરતા સવિસ્તર  
સ્પષ્ટીકનણું અધૂર્ય ધણુંએ હિતસ્વીઓને અત્ર જરૂર જણારો;  
પરંતુ વિવેચન ધાર્યાં બહાર વધી જવા સાથે ‘શ્રી કલપસૂભોગિકાડારે  
તેમજ શ્રી સિદ્ધયક્તમાં જે એ ચૌદ્ધશા—એ અમાસ જણાવેલ છે, તે  
લૌકિકિય-પણુમાં આવે છે તેને અતુલકીને જણાવેલ છે, આરાધનાને  
આશ્રીને તે વાત જણાવેલજ નથી.’ એમ અનેક સુરજનો સ્વભાવજી  
છે, તેથી તેઓના તે માયામૃષાવાહની ‘દૂઃતો તણુભવાનેય આજે’ એ  
ગણત્રથી અત્ર ઉપેક્ષાઉચિત માનેલ છે.

## શાસ્ક્રીય સંવત્સરી ભા. શુ. ૪ ને ખુદ્ધવારે જ છે

ચરમતાર્થપતિ ત્રિલોકનાથ ઓ મહાત્મારાભ્રનુના શાસનમાં આરાધના  
માટે નિયત થએલાં અનેક પર્વામાં શ્રી સંવત્સરી પર્વ સર્વાશ્રેષ્ઠ પર્વ  
દેખાય છે. એ મહાન ખર્દને પામીને કલ્યાણુકાભી જનોએ રવના પ્રતિ-  
સ્પર્ધાને પણ ખમાવવાની ડેમળતા દાખવની એ જૈનધર્મનો સાર છે.  
આરાધન માટેનું એ અનેડ સંવત્સરી પર્વ નજીક આવે છે. એ પુણ્ય-  
પ્રસંગે આપણે આપણું એ નિસ્તારક પર્વને ઉદાત અને નેર્મલાચિત્તે  
ભેટવા અને પામીને આરાધવા ઉજમાળ રહ્યાએ.

આપણું આ મહાન ઓ સંવત્સરી પર્વ ભા. શુ. ૪ અને પાંચમનું  
લોડીયું પર્વ છે. પાંચમ જેણે હુદ્ધરેલી હોય તેને આ સંવત્સરી  
પર્વનો અદ્ભુત મુખ્યવૃત્ત્યા ભા. શુ. ૩ થી જ કરવાનું પૂરુષી હી હીરસુરિણી

મહારાજને શ્રી હી પ્રભમાં ફરમાવેલ છે, અને આ. શ્રી દાનસુરિણુમ. પણ  
પોતાના વિવિધ પ્રક્રોતઃ ભાગ બીજના પેજ ૧૦૮ ઉપ 'આ પાઠમાં  
શ્રી જગહંગુર (હિરસુરિણ) મહારાજ પંચમીનું' જેમ આરાધન થાય  
તેમજ ફરમાન કરે છે.' એ પ્રમાણે તદ્દન સ્પષ્ટપણે જણાને છે, એ  
જેનાં એ જેડીયા પર્ણની મહત્ત્વા આપણને ધણી સમજાય છે. આથી  
આપણે આ ભા. શુ. ૪-પના જેડીયા પર્વને સદા કાગથી જોડેજ  
બિલું રાખીને આરાધતા આવ્યા છીએ, અને તેમાંજ અવિચિન્હ  
પરંપરાનુસારીપણાનું ગૌરવ લઈએ છીએ. તદ્દનુસાર આ સંવત્સરી પણ  
તે ભા. શુ. ૪-પનું જેડીયું પર્વ આપણે જોડેજ બિલું રાખી શકીએ  
તોજ સાચી સંવત્સરીની આરાધના પાખી શક્યા, એમ સંતેષ  
અનુભવી શકીએ તેમ છીએ સં. ૧૬૬૨ સુધીનો નવો વર્ગ પણ  
આપણી માફક તે ૪ અને પાંચમનું જેડીયું પર્વ જોડેજ બિલું  
રાખીને ભા. શુ. ૪ના દિવસે સંવત્સરી અને તેની પણીના ભા. શુ.  
પાંચમના દિવસે અફુમનો છેલ્લો ઉપવાસ કરી કરાવીનેજ સંવત્સરી  
પર્વનું આરાધન કરતો હતો.

આમ છતાં ઘેણી વાત છે કે—“ સં. ૧૬૬૨ના આવણુ માસે  
નવો તિથિમત કાઢ્યા પછીથી આ. શ્રી વિજયરામયંડસુરિણ અને તેમના  
દોગાઈ જવા પામેલા નવાવર્ગે સં. ૨૦૦૪માં ચંડાંશુયંડુમાં ભા. શુ.  
૫ નો ક્ષય આવ્યો હતો તે પ્રસંગે ઉદ્યાત ચોથને બનાને પાંચમને  
ગુલ્લી રાખવાની વાત છીડીને ‘૪૫૫ લેણાં એક દિવસે આરાધાઈ જય છે’  
એમ ક્રોધપણ શાસ્ત્રના આધાર વિનાજ કહેવા અને પ્રચારવા લાગી  
ગયા! પરિણામે તેઓને તે ૪-પનું એ દિવસ સંલગ્નપણે આરાધવાનું  
જેડીયું પર્વ ઉડાવી દેવાના બયંકર ઢાખના ભાગી બનવું પડ્યું, અને  
સમાજને આ પર્યુષણા જેવા મહાન્ પર્વને આરાધવાની સુવર્ણાખ્લેજ  
કુલેશર્મા સાંજદવાનું બન્યું !! !”

સં. ૨૦૦૪માં ભા. શુ. પનો ક્ષય આવેલ, એ પ્રમાણે સં.  
૧૬૫૨-૬૧ અને ૮૮માં ભા. શુ. પનો ક્ષય તો આવેલ જ હતો,

પરંતુ ઉપર જણાવી ગયા તેમ તે પ્રસંગે તો આ નવા પર્ગ પણ આ કા શુ. એ અને પાંચમનું જોડીયું પર્વ, જોડે જ જીલું રાખીને આપણી માદ્ક ચોથ અને પાંચમ તરીકે એ દિવસ સંલગ્નપણે આરાધીએ હતું, આમ છતાં સં. ૨૦૦૪માં તે જોડીયાં પર્વને ઉદ્ઘાત ચોથના બનાવડો ખણાના તણે તોડી નાખવાનું અને કા. શુ. પંચમી પર્વતિથિની આરાધનાને જ શાસનનાંથી ફિગાવી રેવાનું દુઃસાહસ કરેલ છે ! પંચાંગમાં પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તો ક્ષયે પૂર્વાંના સંસ્કાર-વડે તે ક્ષાળું પર્વતિથિને જ આરાધના માટે રજૂ કરવાની છે, ત્યાં ઉદ્ઘાત લિથિનો આયાદ રાખવાનો નથી, એ વાત તેણો સમજે છે છતાં ત્યારથો ઈરિદાપૂર્વટ / ભૂલ્યા ! અને “ઉદ્ઘાંમિ જા તિહિ વાળા ઉત્સર્ગમાર્ગને જો પર્વક્ષય વખતે પણ વળણી રહેવાનું વિધાન હોત તો પૂજય ઉમાસ્વાતિજી મહારાજે ફરમાવેલ ગણ્ણાતા ક્ષયે પૂર્વાં વાળાં અપવાદમાર્ગનું વિધાન શું કામ ?” એ પ્રશ્નનો ઉત્તર આપવાનું બંધ રાખ્યું !

મહીનાની ફરજાચાત ગણ્ણાતી અષ્ટમી આદિ બાર પર્વતિથિમાંની કોઠ પણ પર્વતિથિનો પંચાંગમાં ક્ષય હોય તે વખતે આપણે ( તે ઉદ્ઘાંમિ જા તિહી સા પમાણ આદેશક ઉત્સર્ગમાર્ગ કાર્યસાંધક બનતો નહિ હોવથી ) ઉત્સર્ગ કરતાં અપવાદને બળવાન કહેલ છે, એ વાતને ધ્યાનમાં લઈ ક્ષયે પૂર્વાંના અપવાદવડે તે તે ક્ષીળ્ણપર્વને સંસ્કાર આપીને આપણાં આરાધનાનાં પંચાંગમાં મહીનાની એક દિવસે એક જ આરાધવા સ્વરૂપ તે બારે ય પર્વી અખંડ અને સ્વતંત્ર જ જીલી રાખી આવ્યા છીએ, એ મુજબ સંવત્ ૧૯૬૨ સુધી તો આપણામાંનો આ નવો વર્ગ પણ પોતાનાં લીંતિયાં પંચાંગમા [ દીપખ્યામાંની ક્ષીળ્ણપર્વતિથિને પૂર્વની ઉદ્ઘયવાળા અપર્વતિથિનો તો ક્ષય જ કરી નાખવાપૂર્વક ] મહીનાની તે બારપર્વની તો અખંડ અને સ્વતંત્ર જ જીલી રાખતા હતાઃ આમ છતાં ઉપર જણાવ્યા મુજબ સં. ૧૯૬૨ના શ્રાવણમાસે ભતિવિપર્યાસ થવાને લીધે ઉપરોક્ત વિષમ

પરિણામ આવવા પામ્યું અને પછી તો સં. ૧૯૮૩થી તે નવા વર્ગને આખાએ સંધથી આરાધનાનાં જુદાં પંચાંગ જ બેલાં કરવાં પછાં અને તેમાં પણ=આરાધનામાં પણ લૌકિક ટીપણા પ્રમાણે પર્વક્ષય અને વૃદ્ધિ બતાવવા માંથા ! એમ વર્તાવને તેઓએ લૌકિક ટીપણાં, એ જૈન આગમ નથા, એ જૈનોની માન્યતાને ગંભીર ફટકો માર્યો અને લૌકિક ટીપણાને જ જૈન આગમ માનવું મનાવવું રાઝ કરી દીધું ! પરિણામે સમાજમાં એ કલેશ લાણે ચાલ્યો ! કે-જેનું સાંત્વન કરવાને સમાજહિતેચું જનોએ અનેક વખત પ્રયાસો કર્યા હોવા છતાં તે વર્થું નીવડવા પામ્યા છે !

આપણા શુમાજની પ્રવર્ત્તતી આ ચાલુ વર્ષે પણ આપણે જે નિર્મલચિત્ત આરાધવાનું છે, તે સંવત્સરી પર્વના પ્રસંગને આપણા એ નવા વર્ગો અત્યાર આગમચથી જ વિકટ બનાવવો રાઝ કરી દીધો છે ! અર્થાત् “સં. ૨૦૦૪ ની માફિક આ વર્ષે પણ પંચાંગમાં ભા. શુ. પનો ક્ષ્ય આવેલ હોણથી ‘તે ૪-પનાં જેરીયાં પર્વને તોડી નાખીને ભા. શુ પાંચમને અમે પવં માંથી ઉડાવી દીધી છે, તે બરાબર જ છે’ એ પ્રમાણે બાદકજનોનો મગજમાં [ બનાવટી શાલ્ખપાડોને આગળ કરવાપૂર્વક ] હસાવવા જ્ઞાઝ તે નવાવર્ગો પડા પાછળા રહીને છેલ્લા ? માસમાં બધ્યે હજર નકલ તરીકે જ પુસ્તિકાએ પ્રસિદ્ધ કરેલ છે અને હૈનિકપત્રોમાં જે તે નામથી યદ્યાતદ્વા લાંબા લાંબા લેખો પણ લખાવવા માંથા છે ! ” આ પ્રકારે તે વર્ગ તરફથી બરાબર પર્વારાધનાના ટાંકણે જ ફેલાવાઈ રહેલા મિથ્યા વિભ્રમમાં આપણા સમાજનો અદિકૃવર્ગ મૂળમાર્ગથી=સાચી સંવત્સરીની આરાધનાથી ચ્યૂત થવા ન પામે, એ જેવાની આપણી ફરજ આવી બેલી રહે છે: અને તેથી—એ શુલ્ક આશયથી આ પત્રિકા દ્વારા તે વર્ગના પ્રસ્તુત પ્રચારમાંના તરત જાહેર કરી દેવા જરૂરી એવા ૬૧ જૂહાણું-ઓનું ઉદ્ઘાટન તો તરત જ જાહેર કરી દઈને સમાજને આ પત્રિકા-ઇએ સમયસર પીરસી દેવામાં આવેલ છે, જે વાંચીને કલ્યાણકામી

આતમાજો ‘શ્રી દેવસ્કર તપાગચ્છનો સાચી સંવત્તસરો લા. શુ. ૪ ને યુંનારે જ છે’ એ પોતાનો નક્કી માન્યના શાસ્ત્ર અને પરંપરાનુસારી જ છે, એમ સમજવા ભાગ્યશાળી અને

## ઉપસ્થિતિ ઉપસ્થિતિ

ઉપરોક્ત પ્રયાસવડે વાચકો સમજ શક્શે કે—“યુગાન્તરના

આસાઢમાસની વૃદ્ધિ વર્ષને નૈન નયોત્તિષ્પ્રમાણે આખાદી પૂનમનો ક્ષય થતો હોવા છનાં તે ક્ષીણુપૂનમને શાસ્ત્રકારે પૂનમસંજ્ઞા આપી જ છે, એમ નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારનાં વચ્ચેનો આપીને જણાવવામાં આવેલ હોવાથી પંચાંગની પૂનમના ક્ષયે શ્રી સંધમાં આરાધનામાં ઉદ્ઘાત ચૌદશે પૂનમ થાય છે અને ઉદ્ઘાત તેરશે ચૌદશ થાય છે, તે શાસ્ત્રથી પણ સિદ્ધ છે, એમ નક્કી કરી આપવામાં આન્યું છે. [ ચાલુ વર્ષે પણ તેથી જ સક્રિય દેવસ્કરસંધમાં પંચાંગોમાં લા. શુ. ૩ નો ક્ષય કરવામાં આવેલ છે અને લા. શુ. ૫ ને પર્વ તરફે સ્વતંત્ર બતાવવામાં આવેલ છે, ]

તે શ્રી નિર્યુક્તિ અને ચૂર્ણિમાંના ‘અમિવદ્ધિઅસંબંધિરે જત્થ અહિઅમાસો પડતિ તો આસાઢપુણિમાતો વીસતિરાતે ગતે ભણતિ ડિઆમોચ્ચિ’ પાઠના આધારે શ્રી હિરપ્રક્ષમાં શ્રી વિજય-હિરસુરિલ મહારાજે પણ ‘પૂર્ણિમા તૂટી હોય તો તે ક્ષીણુપૂર્ણિમાનો તપ ચ્રયોદશીચતુર્દિયોઃ કિયતે-તેરશ ચૌદશે કરાય છે’ એમ જણાવવાવડે ‘ક્ષીણુપૂનમને ચૌદશે ઉદ્ઘાત પૂનમર્દ્દે બનાવાય છે અને તેમ કરવા જતાં ક્ષય પામતી ઉદ્ઘાત ચૌદશને તેરસે કરાય છે એમ નક્કી કરી આન્યું છે. તિથિ વિના તે તિથિતપ કરવાનું. બની શકે જ નહિ, એ તો બાળક પણ સમજ શકે તેવી થીના છે. પ્રશિદ્ધ થએલા શાસ્ત્રીય પૂર્વાનુષ્ઠાનાં પૂર્વાચાર્યોના લખાણો પણ એજ પ્રકારના છે. ]

ઉદશંમિ જા તિહો સા પમાણ સિદ્ધાંત, [પંચાગમાં ઉદ્યમાં રૂતાં પર્વનિથ કુવચિત ઉદ્યકાલવર્તીની, મધ્યાહ્નકાલવર્તીની અને અપરાહ્નકાલવર્તીની પણ હોછ શકે છે, તેવા પ્રસંગે આલણેાની માઇક ડેટ મધ્યાહ્નકાલવર્તીની તિથિને કે એઠ અપરાહ્નકાલવર્તીની તિથિને પ્રમાણિક ગણ્યાવવાની પ્રવૃત્તિમાં પડી શાસનને કોણે નહિ એ. માટેનો] ઉત્સર્વ માર્ગ છે, અથા નવા વર્ષની જેમ પર્વતિથિના ક્ષય વખતે પણ જો તે ઉત્સર્વ વિધાનને જ વળણી રહેવાનો આગ્રહ કરવામાં આવે તો તેવા આમહીને તેવા પ્રસંગે ઉદ્યાત પર્વનિથ તો પ્રાપ્ત જ થતી નહિ હેવાથી ‘હૃથરીષ કીરમાણીય આણાભેં ગણવત્થા-મિચ્છત્તવિરાહણ પાવે’ એ તો ઉત્સર્વના ઉત્તરાર્ધના સંજાદ આધારે ‘શાસ્ત્રની આસાનો બંગ, અનતરસ્થાદેષ, મિથ્યાત્ત્વ અને ચોથમાં પાંચમ માનવામાં ઉદ્યવાળી પંચમીને નહિ માનવાદ્ય વિરાધના પ્રાપ્ત થાય છે.’ એ વાત પણ ઇલિત કરી આપે છે.

‘ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા’ એ પ્રવૈષ અપવાદ તરીકેનું વિધિસૂન હેવાથી તે સૂત્ર, પંચાગમાં પર્વતિથિનો ક્ષય હોય ત્યારે આરાધના માટે તે ક્ષીણું પર્વતિથિને પૂર્ણની અપર્વતિથિનાં સ્થાને તેની સંસા અપવાદ્યૂર્વાંક ઉદ્યતિથિ બનાવવાનો વિધિ કરીને નિવર્તે છે. આથી તે અપવાદસૂત્રના આધારે શ્રી સક્તિ સંધુ, દીપણુમાંના પર્વક્ષયે આરાધનાનાં પંચાગમાં પૂર્વની તિથિનો ક્ષય કરીને તે ક્ષીણું પર્વતિથિને ઉદ્યાત અનાવે છે તે બધાર્થ છે. અને નવો વર્ગ, ‘તે ક્ષયે પૂર્વા’ અપવાદ તો અમે પણ માનીએ છીએ’ એમ કલ્યા કરતો હેવા છતાં લોંકિક પંચાગમાંના પર્વક્ષયે તે સૂત્રથા તે ક્ષીણુપર્વને ઉદ્યાત અનાવવા-દ્ય જે સંસ્કાર આપવાનો વિધિ કર્યાનો છે, તે વિધિને તો હરણીજ આદરતો નહિ હેવાથી એટલે તે-લોંકિકીપણામાં પર્વતિથિના આવેલ ક્ષયને પેતાના આરાધનાના પંચાગમાં પણ યથાવત છાપીને તે ક્ષીણુ પર્વની આરાધનાથી પોતે ચ્યૂત થઈ આશ્રિતેને પણ ચ્યૂત કરતો હેવાથી ‘ક્ષયે પૂર્વાં ને તો અમે પણ માનીએ છીએ’ એમ ઓઢું જ

ઓલે છે કે ? જો માને છે તો તે સૂત્રથી કયું કાર્ય કરી જતાવે છે ? તે તો બતાવી શકતો નથી, અને અહિનાની શાસ્ત્રસિદ્ધ બારપર્નની અગીઆર ખ્વો બતાવી હે છે, એ તો પ્રત્યક્ષ છે માટે તેઓ ઉત્તમાર્ગ ચઠી ગાંબળ છે, એ વગેરે વિસ્તારથી સિદ્ધ કરી આંખું છે

‘ક્ષયે પૂર્વાંતો પ્રવૈષ પંચાંગમાંના પર્વક્ષયે પૂર્વનિથિનો ક્ષય કરવાનું કહેતો જ નથી’ એવું શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વપરીત કૃથન, આપણો આ નવો વર્ગ સં ૧૯૬૨ના આવણ માસથો જ કહેવા અને પ્રચારવા લાગેલ છે ! તે પહેલાં તેમના વડાદાગુરુ પૂ આત્મારામજ મેં આહિ બધાજ પૂર્વનો અને ચોતે પણ એ ‘ક્ષયે પૂર્વાંતો’ ‘પર્વનિથિનાં ક્ષયે પૂર્વનિથિનો ક્ષય કરવો’ એમજ અર્થ કરીન ચાલ્યા છે અને પોતાના આરાધનાનાં પંચાંગમાં પણ તે પ્રમાણે ણાખીને પણ પ્રવર્ત્યા છે વાસ્તવિક સ્થિતિ એજ હોવાથી તે વર્ગ એ ‘તે પ્રવૈષ, પૂર્વની તિથિનો ક્ષય કરવાનું કહેતો જ નથી’ એમ ઓલવા લાગેલ છે, તે તેમના બાપદાદાંઓની તથા સં. ૧૯૬૨ સુંદીની પોતાની પણ અધ્યાનશીથી વિરુદ્ધનું એવું ધરાદ્ધપૂર્વક જૂદું ઓલી રહેલ છે અને ખાખનો ભય તળને તેવું જૂદું પ્રચારી રહ્યો છે. આ વસ્તુ તેમના સં. ૧૯૬૦ના નૈનપ્રવયત વર્પ ૧, અંક ૧૨-૧૩-૧૪ના પેજ ૧૭૭ ઉત્તરના “એકજ દિવસે ત્રણ તિથિનો લોગ આવતો હેઠાં તો વચ્ચેલી તિથિ ક્ષયતિથિ કહેવાય છે તે તિથિ જો આરાધ્ય પર્વક્ષાંતિની હેઠ તે પૂર્વની તિથિની જગ્યાએ તેનેજ કાયમ કરાય છે.” એ વચ્ચેનોથી તથા ‘શ્રી તત્ત્વતરંગિણુનો આધાર તો સંવત્સરીની ચોથના ક્ષયે નીજનો ક્ષય કરવાનો છે’ એ વચ્ચેનોથી પણ જિદ્ધ કરી અધ્યપેદ છે તદ્વપરાંત તેમના દાદાગુરુ આ. શ્રી વિજયદાનસુરિજીના વચ્ચેનોથી તથા ૩૦ દર્શક પૂર્વ શ્રી નૈતધર્મ પ્રચારક સલાયે કરેલી તે ક્ષયે પૂર્વાંતો રપ્શુનર અર્થની જહેરાત વરેરેવડે પણ નક્કી કરી આપેલ છે.

શ્રી તરાતરંગિણુકારે ‘સૌદશના ક્ષયે તેરશી ચૌદશજ કહેલો ‘તેરશુ’ એમ નામ પણ દેવું નહિ’ એમ જણાવવાબડે પૂર્વનિથિનો

કષ્યજ કરવાનું કહ્યું હોવાથી અને અષ્ટમીના ક્ષયે ખરતર પણ સાતમ તિથિને અ ઇમજ કહે છે, એ પણ સિદ્ધ કરી આપ્યું હોવાથી ‘પર્ક્ષયે એક તિથિમાં બંને તિથિનું આરાધન આવીજ જાય છે,’ એમ કહેનાર નવો વર્ગ, શાસ્ત્ર ઉપર પગ મુક્કીને મૂળમાર્ગ ભૂલે છે, એમ પણ નક્કી કરી આપ્યું છે. એ સાથે ‘કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂતમ ને આસો શુદ્ધ પૂતમના ક્ષયે તે નવો વર્ગ પણ ચૌદશમાં પૂતમનું આરાધન તો કરી બતાવતોજ નથી-એલે છે તેવું વર્તન કરી બતાવતોજ નથી’ એમ પણ નક્કી કરી આપેવ હોવાથી આ વખતે લા. શુ. પાંચમના ક્ષયે આ. શુ. ૪માં પાંચમની આનંદના આંદીજ જાય છે’ એમ લખવા, એલવા અને પ્રચારવામાં તે વર્ગ અસ્ત્રયાના જ ઉપાસના કરી રહેલ છે, એ પણ રૂપણ્ટ અથ્ થઈ જવા પામેન છે, આથી તે નવો વર્ગ તે અધું શાસ્ત્ર અને પરંપરાવિરુદ્ધ એલા રહેલ છે અને પ્રચારી રહેલ છે, એમ કદ્યાણડામી આત્માઓને હવે ફેરી સમજનવવાનું રહેતું નથી.

‘પવંત્મ વૃદ્ધ વખતે પૂર્વ કે પૂર્વતરતિથિની વૃદ્ધ કરવાનું વૃદ્ધી કાર્ય તથોાચારા પ્રદોષ કહેતોજ નથી’ એ પ્રકારનો તે નવા વર્ગના પ્રચાર પણ શાસ્ત્ર અને પરંપરાથી સહંતર વિરુદ્ધ છે. એમ સં. ૧૫૫૫માં ખરતરીય શ્રી ગુરુવિનયકૃત ઉત્સુકખંડનમાના ‘અન્યચ્ચ વૃદ્ધી પાદ્ધિકં ક્રિયતે ઇદં કિમ’ ઇત્યાહિ વબનોથી તેમજ સં. ૧૬૬૨ સુંધરીની પ્રેતાની પણ તેવી જ હતી તે આભરણા આદ્યથી સિદ્ધ કરી આપેલું છે.” [એટલે ‘લા. શુ. ૪૪૫ ને ગુરુવારે સંવલસરી છે’ એમ તેઓ પ્રચારે છે, તે શાસ્ત્ર અને પરંપરાથી સહંતર વિરુદ્ધ છે એમ આ પુનિધારો એ સમસ્તસરં રૂપણ્ટ કણી આપે છે.]

**આ. શ્રી પ્રેમસૂરણ મહારાજે મૌન રહેવું ઉચ્ચિત હતું**

આ ઉષસંદાર પછીથી આચાર્ય પ્રેમસૂરણ, (કે-જેએ સં. ૨૦૦૧ થી મારે નવો મન મુક્કી દેવો છે અને મૂળમાર્ગ આવી જવું છે, એમ અનેક વખત આ લેખકને પણ અરોગ્ય મારણન ક. ૧૨ મી

ચૂકેલા છે.) અમદાવાદ ગયા પણીથી જ ફરી ગયા છે. સં. ૨૦૦૧થી તેમણે જૂઠા તરીકે ભાનેલ તે નવા મતને સંદેશ તા. ૧-૭-૫૭માં, સુંઘર સમાચાર તા. ૪-૭-૫૭ તથા તેમના મહાવીરશાસન (?) માં શ્રી પદ્મબિજયળના નામે પ્રસિદ્ધ કરાવેલા પોતાના પત્રમાં આજે સાચો કહેવાની ભયંકર ભૂલ કરી છે, એટલું જ નહિ પણું એવી અસત્ય જાહેરાત કરવાની રિથિતમાંથી તેઓએ સુમાર્જમાં એકયત્ના રથાપવાના તન, મન અને ધનથી સતત્પ્રયાસ આદરનાર સેવાભાવી શ્રી સુંઘર દેવસૂરસંહ ઉપર આક્રમેણી જે જડીએ વરસાવી છે તે મોટામાં મોટી ભૂલ કરી છે, એમ હરકોઈ વિદ્ધાન અને ભદ્રયથ વાચકોને લાગ્યા વિના રહે તેમ નથી. એના કરતાં તો તેઓએ મૌન રથા હોત તો લાખના લાગતે, એમ મારે નન્દ અભિપ્રાય છે.

તે પત્રમાં તેઓ કહે છે કે—“સંવત્સરી ભાદરવા શુદ્ધ ચોથે પ્રવર્તેલી છે અને શ્રી સંધને ભાન્ય પાંચાંગમાં ગુરુવારે જ ભાદરવા શુદ્ધ ૪. ઉદ્યાતતિથિ છે, તેથી આ વરસે સંવત્સરી ગુરુવારે જ આરાધની અને આરાધાવવા એ શાસ્ત્રાનુસારી અને ખરંપરાનુસારી શુદ્ધમાર્ગ છે.” આ બદ્ધ તેઓને પ્રશ્ન છે—‘લા. શુ. પણો કથ્ય હેઠાંતો પણ ભા. શુ. ૪ ઉદ્યાત સંવત્સરી કરવી’ એવું કથ્ય શાસ્ત્રમાં ‘જણાવ્યું’ છે? તેમજ તેવી પરંપરા પણ તમે કયાં દીહી છો? જો ‘તેલું કોઈ શાસ્ત્રમાં નથી તેમજ તેવી કોઈ પરંપરા પણ દીહી નથી’ એમ જ જવાબ છે. તો ગુરુવારે સંવત્સરી કરવામાં પાંચમપર્વી અને ૪ ઘનાંનેડીયા પર્વનો પણ લેખ્યું અને હેઠાના દોષો તે ઉધાડી આંશેં હેઠી રથા છો: પછી, લા. શુ. ૪ ને ગુરુવારે સંવત્સરી કરવામાં શાસ્ત્ર અને પરંપરાનુસારીપણું જણાનોછો, તે સાચું શા રીતે? જ્યાખના ગુરુજીની ગુરુજી અને તેના પણ ગુરુજી પૂ. જ્યાત્મારામજી મહારાજી, સં. ૧૯૫૮ માં જ્યાવેલ આ. પ્રકારના લા. શુ. ૫ ના કથ્ય પ્રસંગે આ. શ્રી વિજયવલ્લબ્ધસૂરિજી મ૦ના હાથે પંનંબ ગુજરાવાળાથી સં. ૧૯૫૮ના જેઠ શુદ્ધ પ ને રવિવારે ભર્યાનિવાસી શેઠ અનુપચંદ મહુકચંદ ઉપર લખ્યોલ [જાસનસુધાકર તા. ૧૦-૬-૫૬૮૮] પેજ

૫૦ ઉપર તથા તા. ૨૩-૮-૫૧ના સિક્ષયકના વધારાના પેજ ૧૭ થી  
 ૧૮ ઉપર ઘલોક અનાવીને પણ જાવાયેલ] પત્રમાં “ચોથ  
 પાંચમ લેળાં ગણ્ણીએ તો ચોથને દહૂાડે તો સંવત્સરીની  
 કિયા કરો પરંતુ પાંચમતિથિની કિયા કરે દહૂાડે કરવી? એ  
 પ્રમાણે જાણાવવાવડે લા શુ. એ અને લા. શુ એ બંને ય પર્યા-  
 તિથિને જોડીયાપવં તરીકે જુદી જુદી સ્વતંત્ર જલી રાખવાનો  
 આવશ્મકતા દર્શાવી છે કે? વિવિધ પ્રક્રોતાર ભાગ પહેલાના પેજ ૧૦૯  
 ઉપર આપના ગુરુશ્રી દાનસૂરિજી મં પણ આ લા. શુ. પાંચમને  
 ઉદ્દેશીને જે ‘આ પાઠમાં શ્રી જગદુરુ મહારાજ પચભીનું જેમ  
 આગધન થાય તેમજ ફરમાન કરે છે’ એમ જાણાવે છે કે? છતાં  
 આપ તે લા. શુ. પાંચમને તો ‘ચોથમાં સમાધ ગઈ-એ દિવસે બંને  
 તિથિનું આરાધન થઈ જય છે’ એવું જૂદું બોલનારના મતને પુષ્ટિ  
 આપવાવડે લા. શુ. એ ને ઉડાવી જ હો છો કે? આ સ્થિતિમાં તે  
 બધાએ આપના જ ગુરુઓનાં પણ તે તે ટંકશાળી વચ્ચેને આપ  
 છડેયોક નિહિતતા નથી? જે નિહિતે જ છો તો પણી આપની,  
 આપશ્રીને શાસ્ત્રાનુસારી કે પરંપરાનુસારી લેખાવો છો, તે સાચું રીતે?  
 મૃષાવાદનું ખુલ્ખું સેવન કેમ નહિ? આ પ્રશ્નોનો  
 ખુલાસો જાહેરપત્રેમાં આપશ્રીના નામથી જાણાવવા કૃપા કરશો કે-  
 જેથો સં. ૨૦૦૦ના જેઠ માસે તે નવા મતની આ રીતે જ  
 એ એ જે તે શબ્દોથી ખોઝ લઈ રહ્યા છો, તેની જાણું થતાં આ લેખકે  
 આપશ્રીને ૨૭ પ્રશ્નો (કે-જે શાસ્ત્રનસુખાકરસ્વર્ણ, અંક ૧૪-૧૫નાં  
 પેજ ૧૫૧ થી ૧૫૩ ઉપર પ્રસિદ્ધ છે) પૂછ્યા. હતા, અને તે સાથે  
 તે પ્રશ્નોના મુજબની સલામાં ખુલાસા આપવા પણ આપશ્રીને  
 જાણાવેલ હતું, છતાં આપશ્રી, તે વખતે તેવી સુલામાં તે નવા મતને  
 સાચો હનારી આપવાની હિંમત બતાવવામાં નાચીપાસ જ નીવજ્ઞા  
 હતા, તે વાતની પુનરાધૃતિ થવા ન પામે. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી  
 મંને અત્ર એક વાત પૂછી હશે કે—“આપશ્રીએ છેલ્ખા છેલ્ખા ૨૧૩

જૈન શાસ્ત્ર અને પરંપરાનુસારી—

## શ્રી પર્યુષણા પર્વની આરાધનાનો કાર્યક્રમ

આવણ વદ ૧૧ બુંધવાર તા. ૨૧-૮-૫૭

શ્રી પર્યુષણ પર્વ ઘેઠાં

આવણ વદ ૧૪ શનિવાર તા. ૨૪-૮-૫૭

કદ્દપથર-કદ્દપસ્ત્રવાંચન.

આવણ વદ ૦)) રવિવાર તા. ૨૫-૮-૫૭

પ્રલુ શ્રી મહાવીર જનમવાંચન.

ભાદ્રવા શુદ્ધ ૪ બુંધવાર તા. ૨૮-૮-૫૭

શ્રી ભારતસાસૂત્રવાંચન-સંવત્સરી પ્રતિક્રમણ.

---

ન.....વ.....દ.....ન.

આ પુસ્તિકાની કેાઈપણ લાગ્યથાળીએ બીજ આવૃત્તિ  
ઇપાવવી હોય તો કાપ્રૂપ કર્યાં વગર ઇપાવી શકે છે.

પ્રકારાં

